

# પાંચભી આવૃત્તિ - ૨૦૧૩-૧૪



ફક્ત પોસ્ટ કાર્ડ લખો અને વિના મૂલ્યે  
વિના પોસ્ટેજ ખર્ચ ઘર બેઠા  
આ પુસ્તિકા મેળવો

શ્રી સુભાષ દોશી • અ.સૌ.સ્મિતા દોશી  
દારા સ્પ્રેમ બેટ

ઈ. ૫૧/૫૨, ગ્રેઇન મર્ચન્ટ્સ કો.ઓ.હા.સો.લિ  
સેક્ટર - ૧૭, વાશી નવી મુંબઈ - ૪૦૦૭૦૩



- STEAM ROOM
- MASSAGE BATH-TUB
- SHOWER ROOM
- SHOWER PANELS
- SPA



**PAM PERING**

**YOUR**

**SENSES**

**બાથરૂમની લેટેસ્ટ  
ઇન્ફોરેટ આઇટમો**

**HEAL SPA BATH  
CONCEPTS**

**C & F**

**SUBH SMIT ENTERPRISES**

- E 51/52, Grain Merchants Chs, Sector -17, Vashi, New Mumbai - 400703 M.: 9821015454
- Plot No. 41, Sector No. 26/27, Parsik Hill, CBD, Belapur.
- Show Room : 4/H, Laxmi Ind. Estate, New Link Road, Andheri (W), Mumbai - 400 053. Ph.: (022)230728388/90 Fax : (022)230728388 Web : [www.healspabath.com](http://www.healspabath.com)

# પાંચમી આવૃત્તિ - ૨૦૧૩-૧૪



ફક્ત પોસ્ટ કાર્ડ લખો અને વિના મૂલ્યે  
વિના પોસ્ટેજ ખર્ચે ઘર બેઠા  
આ પુસ્તિકા મેળવો

શ્રી સુભાપ દોશી • આ.સો.સિમતા દોશી  
દારા સપ્રેમ બેટ

ઈ. ૪૧/૪૨, ગ્રેઇન મર્ચન્ટ્સ કો. ઓ.હા.સો.લિ.  
સેક્ટર - ૧૭, વાશી નવી મુંબઈ - ૪૦૦૭૦૩

સુરત  
સ્મરણાર્થ




શ્રી પ્રભુદાસ રૂગનાથભાઈ દોશી

જન્મતા : ૧૨-૨-૧૯૩૬


સ્વર્ગવિસ્તા : ૩૦-૬-૨૦૧૦

અનુષ્ઠાનિક પદ્ધતિ : જીવની વિસ્તાર

# સ્મરણાર્થ




પુ. પિતાશ્રી  
રૂગનાથભાઈ તારાયંદ દોશી  
સ્વર્ગવાસ તા.: ૧૭-૮-૧૯૮૫



પુ. માતૃશ્રી  
દિવાળીબેન રૂગનાથભાઈ દોશી  
સ્વર્ગવાસ તા.: ૧૭-૬-૧૯૮૭


# સ્મરણાર્થે



વડીલ બંધુશ્રી

મથુરદાસભાઈ રૂગાનાથભાઈ દોશી

જન્મ: ૧૪-૧૨-૧૯૯૮ ● સ્વર્ગવાસ : ૧૦-૬-૧૯૬૦




વડીલ બંધુશ્રી

અનંતરાચ રૂગાનાથભાઈ દોશી

જન્મ: ૧-૬-૧૯૩૧

સ્વર્ગવાસ : ૨૨-૧-૧૯૯૯

# સ્મરણાર્થ



શ્રી ધીરજલાલ અમૃતલાલ કામદાર

જન્મતા : ૨૬-૬-૧૯૨૮

સ્વ. તા : ૨૦-૨-૧૯૯૭

૨૩૦૦-૫૫-૫૫૫૫

# સ્મરણાર્થે




શ્રીમતી શીલા સુભાષ દોશી

જન્મ: ૩૦-૧૧-૧૯૫૦

સ્વર્ગવાસ : ૧૪-૧૦-૧૯૮૭

# સ્મરણાર્થ




સ્વ. ઇલેશાભાઈ ચંદુલાલ કામદાર

જન્મ તા : ૨૬-૮-૧૯૯૭ • સ્વર્ગવિસ તા : ૧૩-૧-૨૦૧૨

“અપનાગાં છવપલ છસતા રહાં,  
ઝોણથી સૌના હૈયે વસતા રહાં,  
સર્વત્ર સુવાસ ફેલાવી,  
સંભારણા સૌના દિલમાં રાખી ગયા”

# આ પુસ્તક અમદાવાદમાં મેળવવા માટેનું સ્થળ



Be different, Think different..

સુરત જિલ્લા માત્રાની બાજુની વિધૂલી રીતે કાપીની આપણી પુસ્તક અનુભૂતિ

## સુરત જિલ્લા માત્રાની બાજુની વિધૂલી રીતે કાપીની આપણી પુસ્તક અનુભૂતિ

સુરત જિલ્લા માત્રાની બાજુની વિધૂલી રીતે કાપીની આપણી પુસ્તક અનુભૂતિ

# VANSH STATIONERS

---

Whole Salers In All Kind Of **VANSH** Brand Paper Products

---

"Dhiraj House" 413, Haja Patel's Pole, Kalupur, Ahmedabad-1

Ph.- 079 2532 2500, 2538 0520, M:- 098250 30378, 094278 03578

email: [vansh\\_stationers@yahoo.com](mailto:vansh_stationers@yahoo.com)

## શ્રી સુલાષ દોશી દારા



૧૯૬૮થી દેશી દવાની બુકો છાપવાનું મેં શરૂ કર્યું. જે દરેકને વિનામૂલ્યે - વિના પોસ્ટલ ખર્ચે ઘરે બેઠા પહોંચાડી છે. આ ભારી પાંચમી આવૃત્તિ છે - ૨૦૧૩. આમ અંદાજે ૧૪,૦૦૦ બુકો છાપી. આ બધો જ જશ દેશી દવાઓ ઉપર વિશ્વાસ રાખનાર વાંચકને જાય છે.

આ બુકો છાપવાનો મુખ્ય હેતુ એ છે કે લોકો દેશી દવા અને હોમિયોપથિક દવાઓ માનતા થાય - અને પોતાના શરીરને વિલાયતી ડોઝથી બચાવે. વિલાયતી લોકો આજે આપણી દેશી દવા અપનાવતા થઈ ગયા છે, જ્યારે આપણે દેશી દવાઓથી દૂર ભાગી વિલાયતી દવાઓનો ઉપયોગ કરતા થઈ ગયા છીએ. આજની

ભારતની સત્ત્રીઓ (અમુક ટકમાં) પોતાના બાળકોને દૂધ પીવડાવવા ગલ્લાતલ્લા કરતી થઈ ગઈ છે જ્યારે ફોરેનની સત્ત્રીઓ પોતાના બાળકને પોતાનું દૂધ પીવડાવતી થઈ ગઈ છે. જેમાં કેટલા ફાયદાઓ છે તે સમજતી થઈ ગઈ છે. જેમાં મુખ્ય (૧) તો એ બાળક કદી માંદું પડતું નથી. સત્ત્રી અનેક રોકોથી બચી જાય છે. વર્ષો અગાઉ અમેરિકનો ભગવાનને માનતા ન હતાં. આજે તેની કરન્સી (ડોલર) ઉપર છાપે છે કે અમે ભગવાનને માનીએ છીએ.

(બિદેશીઓ આપણી જડિબુઝીઓને ખૂબ જ મહિંદ્ર આપે છે અને તેની પેટન્ટ રજિસ્ટર્ડ કરી નાખે છે, જેથી ભવિષ્યમાં એ દેશી દવાઓ આપણા ઘરાંગણામાં ઉગાતી હોવા છતાં આપણે પણ તેને વાપરી શકીશું નહીં.)

આ બુકમાં ઘણા સારા-સારા સુવાક્યોને પણ સ્થાન આપેલ છે, તે આપને જરૂર ગમશે.

(૧૦૩) એલોપેથી દવાઓ એટલે ગોળીઓ – કેખ્યુલ, ઇન્જેક્શન જે ઇન્ડિયામાં તથા ઇન્ડિયાની બહાર બનતા હોય તેને અહીં વિલાયતી દવા તરીકે સંબોધી છે.)

કોઈ પણ રોગને જડમૂળથી અને તે પણ તાલ્કાલિક કાઠવા માટે યુરિન થેરેપી અપનાવો. આજે કરોડો લોકો સ્વભૂતનો પ્રયોગ કરે છે. સ્વભૂત અથવા બીજા કોઈનો પણ પેશાબ પીવાથી નીચેના રોગો ઝડપી મટેન્છે:

(૧) રેંયુલર પેશાબ પીવાથી કદી એટેક આવશે નહીં. પછી તે પેચાલિસીસ એટેક કેમ ન હોય. પ્રથમ વખત પીવાથી કોઈ

તમારું મન મજબૂત હશે તો રોગ આપોઆપ ચાલ્યો જશે.

પણ એટેક આગળ વધતો અટકી જશે અને જેનો ડોડ શરીરમાં ૧૮થી ૨૦ કલાક ચાલશે. (૨) એઈડ્જ (૩) ગમે તેવો તાવ પછી ભેલેચિયા, ડેલ્યુ, ટાઇફોઇદ વગેરે કેમ ન હોય. (૪) છરી-પથ્થર કે કાંઈપણ વાગ્યું હોય અને લોહી નીકળતું હોય તો તુર્તજ તેના ઉપર પેશાબ લગાડી દો. બીજા દિવસે જ અડધું મટી ગાંયું હશે. દિવસમાં બે-ચાર વખત ફક્ત બે દિવસ એ ધા ઉપર પેશાબ લગાડો. (૫) ડાયાબિટીસ, બી.પી., કેન્સર, કોલેસ્ટેરોલ, ટી.બી., દમ વગેરે એવા કોઈ રોગ નથી) કે પેશાબ પીવાથી ન ભટે. તમારો પોતાનો પેશાબ તાવ આવ્યો હોય ત્યારે થતો નથી. બીજા કોઈનો પણ પેશાબ પાઈ દેવો. તમારો કે બીજા કોઈનો ગમે તેવો પેશાબ હોય, ડાયાબિટીસ, બી.પી., રસી પડતાં હોય વગેરે છતાં એ પેશાબની તાકાત એટલી જ રહે છે, જેટલી તંદુરસ્ત માણસની હોય.

**પેશાબ પીવાની રીત :** (૧) કાચના ગલાસમાં જ પીવો. પેશાબ પીધા પછી એ ગલાસને સાફ કરી બાથરૂમમાં જ ઊંધો ભૂકી દેવો. (૨) દિવસમાં ગમે તેટલી વખત ગમે તેટલો પી શકાય છે. (૩) સવારના ઉઠતા વેંત જ પેશાબ થાય છે તે વધુ ગુણકારી છે. (૪) એક વખતી પેશાબ પીધા બાદ રિપીટ પીતાં રહેશો તો આપણા ભાટલાના પાણી કરતાં પણ શુદ્ધ પાણી ભળશે. ભાટલાનું પાણી પણ ભાવશે નહીં. ફક્ત મન હોય તો ભાળવે જવાય, ભરોસો અને સુગા ન ચડવી જોઈએ. પોતાનો જ કચરો પોતે પીવાનો છે. એમાં વળી સુગ શેની ?

— લિ. ચુભાષ દોશીના જય જિનેન્ડ


કોઈપણ ખોટા કાર્યોથી દૂર રહો.

દૈશી વૈદુની આ પાંચમી આવૃત્તિ મારો લાડલો પુત્ર  
**ચિ. પવનના**  
**તા. ૧૨-૧૨-૨૦૧૩ના શુભલગ્ન પ્રસંગે**

**અનુક્રમણિકા**


**કમાં વિગત પાન નં.**

૧. શ્રી સુભાષ દોશી જારા	૧-૧
૨. શ્રી દોશી કુટુંબ જોગ	૧-૨
૩. આંખના નંબરો કાટવા માટે, નાની-મોટી ફોડકીઓ, બાળક, હાઈ-લાડપ્રેશર, કસુવાવડ. થવાના કારણો, વાર્ચવાર કસુવાવડ,	૩-૪
શાલ	
૪. સોસાયટીના મકાન ઉપર મોબાઇલ ટાવર મુકવો એટલે સાક્ષાત્ યમરાજનું તેડું - જુ, લીખ, દાંત	૪-૬
૫. સફ્ટેચ ડાઇ-કોટ, ખાવાપીવાની આઇટમો, વીર્યવૃદ્ધિ, ડોક્ટર,	૭-૮
નવરાત્રિની નવ દેવીઓ, જાતીય સુખ	
૬. લક્વા, પેશાબમાં રેતી, કલોઝુ જુર, ટામેટા, હાડકા, એન્ટિબાયોટિક, નાળિયેર, વસ્તી, આંધ્રપ્રદેશની રક્કીમ	૮-૧૦
૭. ખાંસી, ગાંઠને ઝડ, છાતીમાં પિતા, તોતડણાપણું, અજમાવી જુઓ	૧૧-૧૨
૮. ખીલ, શેરભાર, દુદ્ધીનો રસ, સિએરિયન બાળક, જુવજંતુથી	૧૩-૧૪
છૂટકારો	
૯. ધા-જખમ, જલદર-પેટ મોટું થવું, કાળી ચૌદસ, બાળક, લોહીવા બંધ પડે, વાર્ચવાર પેશાબ	૧૫-૧૬
૧૦. કોલેસ્ટ્રોલ, લક્ષ્મી મેળવવા, ધનપ્રાપ્તિ માટે, અજમાવી જુઓ	૧૭-૧૮
૧૧. શ્રણ ટાઈપના માણસને કદી ભુલશો નહીં, સંતાનપ્રાપ્તિનો ભંગ, વિદ્યાભ્યાસમાં સંતાનોની કુશાગ્ર બુદ્ધિ માટે તેમજ યાદશક્તિની વૃદ્ધિ માટેનો ભંગ	૧૯-૨૦



ક્રમ	બિગત વિના અનુભૂતિ	પાન નં.
૧૨.	બ્રેસ્ટ કેન્સર, સ્વીચેસ્ટ, હર્ડે-લોર્ડે-આંબળા, ગળો-ગોખરું	૨૧-૨૨
૧૩.	ખૂબ એટલે, દરાજ, પેશાબ અવરોધ, બોટલ પીણાં અને ગંકફૂડ, પુરુષાતન વધે	૨૩-૨૪
૧૪.	જૂનો ગોળ, ધનસંપત્તિ, ઘર મોટું, સુખની ચાવી, ગોળ	૨૫-૨૬
૧૫.	બહેરાશ, વ્યાસન, વજેન, દાંતની પીડા, કોટ	૨૭-૨૮
૧૬.	માઈગ્રેન, આધાશીશી, એચઆઈવી, મેરા ભારત મહિના, સોફ્ટ ડ્રિન્ક્સ, ગુટખા, અજમાવી જુઓ	૨૮-૩૦
૧૭.	વાળો, ભૂખ વધારવા, લીમડો	૩૧-૩૨
૧૮.	મેલેરિયા આટકાવ/સારવાર, શક્તિ વધે, સીતાકૃષ્ણ	૩૩-૩૪
૧૯.	સાધના અને સિદ્ધિ, દાનવદોષ, પ્રેતદોષ, થકદોષ, સર્પદોષ, દેશી ભરીમસાલા	૩૪-૩૬
૨૦.	કિડની, કેરડા, પેટની ચરબી ઘટાડો, એઇક્ઝ, પેશાબમાં રેતી, જખમથી સોજા, ડેઝાયુ	૩૬-૩૮
૨૧.	દ્વાન આપો, ઘરમાંથી જીવજંતુઓની છુટી કરો, દાંત, અજમાવી જુઓ	૩૮-૪૦
૨૨.	વીજળી, મોબાઈલ ટાવર	૪૧-૪૨
૨૩.	અજીર્ણા, કાનમાં બારીક કીડા, શ્રી ગણપતિ બાપા, સારણગાંઠ	૪૩-૪૪
૨૪.	દાંત રૂટકેનાલ, સંકેદ પાણી, મરડો, ચામડી ફાડે, માથું દુખવું	૪૫-૪૬
૨૫.	અજમાવી જુઓ, રક્તપિત્ર, માથાનો દુખાવો	૪૭-૪૮
૨૬.	મસા, નાસુર અને ભખંડર, સૂંઠ, આમવાયુ, પુરુષાતન વધે, પાચનશક્તિ વધારવા	૪૮-૫૦
૨૭.	અજમાવી જુઓ, આધાશીશી	૫૧-૫૨
૨૮.	માઈગ્રેન, કાળા વાળ	૫૩-૫૪
૨૯.	કોટ, ગૂમંડું પાકે, ગર્ભરસ્થાન સુધરે, મીઠો પેશાબ, બાળ	૫૫-૫૬
૩૦.	જીવજંતુનો નાશ, ટીલી નસો મજબૂત કરો, જખમ રંગાય, અજીર્ણા, સંધિવા	૫૭-૫૮

ક્રમ નં.	વિગત	પાન નં.
૩૧.	ટી.બી.-ક્ષય, ચાંદી-ચાંદા, બાળક, દાંતના દદ	૫૮-૬૦
૩૨.	વીર્ય વધે, રતાંધળાપણું, રક્તસત્ત્રાવ, અજમાવી જુઓ	૬૧-૬૨
૩૩.	વાળ કાળ કરવા, છાતીએ પિતા, કામ કરતાં-કરતાં ચાલતા	૬૩-૬૪
૩૪.	રહો, ટી.વી.	૬૫-૬૬
૩૫.	ભૂખ વધારવા, કમળો, વધારાવળ, હરસા-નાસુર અને ભખંદર,	૬૭-૬૮
૩૬.	ભોજન રૂફ, માનાન, માનાના, કાંદાન, કાંદાના, કાંદાનાન	૭૧-૭૨
૩૭.	એરકન્ડીશન મશીન, ડાયાબિટીસ, પેટનો દુખાવો, ડર કે ભય	૭૪-૭૫
૩૮.	કોટ, પરમો, પથરી, હરસ, આંખનું તેજ વધે, શરીરે સોજા	૭૬-૭૦
૩૯.	અજમાવી જુઓ, મેલેનિયાના ચિહ્નો, ચુચિચાર	૭૧-૭૨
૪૦.	અજમાવી જુઓ, કડવો પણ લાભકારી લીમડો, કમળો, ખંજધાળ,	૭૩-૭૪
	કાનમાં ધા થવો	૭૫-૭૬
૪૧.	વાયુ-ગેસ-અપાયન, મીહું, અંજુર, પેટમાં ગોળો, ગાંઠ ગુમડાં	૭૫-૭૬
૪૨.	ડાયાબિટીસ, પાઈલ્સ, કાનમાં ગુમડાં, વાળને ડાઈ, શરીરમાં કાંદાન	૭૭-૭૮
૪૩.	સુરતી માટે, અજમાવી જુઓ	૭૯-૮૦
૪૪.	ઝગનો મલમ	૭૬-૮૦
૪૫.	સારણગાંઠ, વાતવિકાર, હરસમસા, ઊંઘ આવતી નથી, સોજા,	૮૧-૮૨
	પથરી, સંગ્રહણી	૮૩-૮૪
૪૬.	સુવા રોગ, દાંત, હરસમસા, ઝાડા અને લોહી	૮૩-૮૪
૪૭.	વાળ કાળ થાયુ, બાળકોની હરકતો, બરોળની ગાંઠ, ગળાનો	૮૫-૮૬
	સોજે, લોહીની ઓછપ, ઓછી ભૂખ લાગવી, તાવ, ઓસિડીટી,	૮૭-૮૮
	કૃમિ રોગ, સત્ત્રીને દૂધ વધે	૮૯-૯૦
૪૮.	રતવા, પ્રદર, ગર્ભસ્થાન સુધરે, લકદો, અંડવૃદ્ધિ	૯૧-૯૨
૪૯.	વાયુગોળો, પેશાને રેતી, લીંબું, અસ્વચ્છ પાણી, વજન ઘટાડો,	૯૩-૯૦
	સાંખેખમ, દાડમ, કપુરકાયલી	૯૪-૯૫
૫૦.	અજમાવી જુઓ, સંધિવા	૯૧-૯૨
૫૧.	પેટનો વાયુ, બંધકોશ, રક્તસત્ત્રાવ, કશા ખર્ચ વગાર અનેક રોગોને	૯૩-૯૪
	દૂર રાખનાર પાણી પ્રયોગ	૯૫-૯૬



ક્રમ નં.	વિગત	સ્વાચ્છ	પાન નં.
૪૬.	કમર દુખવી, રક્તપિતા, મોટા પરના ચાઠાં, પેશાબ છૂટે, આમવાત (રમેટિગ્રમ)		૯૫-૯૬
૫૦.	એસિડીટી-અમલપિતા, એઈડ્જ		૯૭-૯૮
૫૧.	રોજ સવારે નરણે કોઠે ૪ ગલાસ પાણી પીવું, કોટ, લોહી પડવું, મરડો		૯૯-૧૦૦
૫૨.	કબજિયાતનો સાચો/સરળ ઉપાય, પેસમેકર, બલગામ-કફ્ફ, શારીરનો કોઈપણ ભાગ બળી જાય, પથરી, વૃષણમાં પાણી, ચહેરાની કાળાશ		૧૦૧-૧૦૨
૫૩.	વીર્ય વધે, વા-દાનધોરિયો વા, રક્તશુદ્ધિ		૧૦૩-૧૦૪
૫૪.	અજમાવી જુઓ, લીમડો લાજવાબ, ઘરગાઢ્ય ઉપાય, કાનમાં દા, જખમ		૧૦૪-૧૦૫
૫૫.	પથરી, શૈત પ્રદર, મેલેટિયા, પેટાની તકલીફ, જ્યુ મરછર, પોપકોન, માસિક, બટેટા અથવા દૂધી		૧૦૭-૧૦૮
૫૬.	બરોર, અજમાવી જુઓ		૧૦૮-૧૧૦
૫૭.	ગર્ભરથાનના દર્દ, કોફ્ટ્રીંકસ, આઈઝ્કીમ-ચોકલેટ, મરડો, આમવાયુ, પેશાબે પથરી, મરડો		૧૧૧-૧૧૨
૫૮.	અજુર્ણા, વધરાવળ, બાળકો, જાડાપણું, વજન વધવાના કારણો		૧૧૩-૧૧૪
૫૯.	બગલમાં ફોડલો, વૃષણમાં પાણી ભરાવું, ગુમડાં ફૂટે, બાળકને ખૂંધ્ય નીકળો, પેશાબ છૂટે		૧૧૫-૧૧૬
૬૦.	લીમડો, કિડનીની પથરી, શૈતપ્રદર, મેલેટિયા, પેટાની સમસ્યા, જ્યુ મસા, સુવાક્યો		૧૧૭-૧૧૮
૬૧.	અળસી		૧૧૯-૧૨૦
૬૨.	ધોળા વળ કળા કરવા માટે, લસણ, હૃદયરોગ, દમરોગી, સ્થૂળતા, લીવરની તકલીફ		૧૨૧-૧૨૨
૬૩.	લોકિક લસણના અલોકિક ગુણા, સુપ અને સલાડ ડાયેટ, ભૂલેચૂકે વજન ઓછું કરવા નીચેના પ્રયોગ કદી કરશો નહીં		૧૨૩-૧૨૪

## શ્રી દોશી કુટુંબ જોગ

જ્યાં બે ધર્મ ભેગા થાય છે ત્યાં સંઘર્ષ થાય છે. જે વ્યક્તિ પોતાના ધર્મ ઉપર ઓછો વિશ્વાસ અથવા વિશ્વાસ નથી રાખતો અને પોતાના ધર્મ કરતા બીજો ધર્મ વધુ ઉપયોગી માની નવો ધર્મ અપનાવે તે વ્યક્તિ પોતાના જૂના ધર્મની નીતિ-નિયમોની વિરુદ્ધ થાય છે. અને પોતાના જૂના ધર્મમાં નવો ધર્મ ભેળવવા પ્રયત્નો કરે છે. અને સંઘર્ષની સ્થાપના કરે છે. બાપદાદાની નીતિ-નિયમોને નેવે મૂકી દેવા બધા જ પ્રયત્નો કરે છે, ફક્ત ચંદ રૂપિયાના ડોનેશન માટે....

## ભૂલો ભલે બીજું બદ્યું માબાપને કદી બદલશો નહીં...

આપણે બધા જ દેવ-દેવતાઓને, બધા જ ભગવાનને આપણા ધર્મ જેટલું જ માન આપીએ છીએ છતાં આપણા ધર્મસ્થાનમાં તેમની સ્થાપના કરતા નથી. હા, આપણા ધરમાં કે ઓફિસમાં છબી-મૂર્તિ મૂકીએ છીએ. આપણા ધરમાં પણ કોઈ એક ભગવાન, દેવ-દેવીઓની બે મૂર્તિ કે બે છબી મૂકતા નથી. આ આપણા વડવાઓ કહી ગયા છે. આપણે સ્થાનકવાસી જૈન છીએ. શ્રી મહાવીર ભગવાન આપણા ભગવાન છે. શ્રી મહાવીર ભગવાનના આપણે ભાગલા પાડી દીધા. આપણા સ્થાનકમાં (ઉપાશ્રયમાં) શ્રી મહાવીર ભગવાનની મૂર્તિ મૂકતા નથી, જ્યારે આપણા બીજા જૈનો જેને આપણે દેરાવાસી વગેરે ગણીએ છીએ તેઓ તેમના

પારકું ધન ટેકા સમાન ગણવું.

સ્થાનકમાં શ્રી મહાવીર ભગવાનની મૂર્તિની સ્થાપના/પ્રાણપ્રતિષ્ઠા કરે છે. આપણા સ્થાનકમાં કોઈપણ ભગવાન, દેવ-દેવીઓની તસ્વીર કે મૂર્તિ મુક્તાતી નથી અને આ નિયમોને આપણે સદીઓથી પાળતા આવ્યા છીએ. તો શું આપણે આપણા બાપદાદાના નિયમોનો નેવે મૂકી માતાજી મહાકાલી માતાના ત્રિશૂલને બદલે ત્યાં શ્રી મહાકાલી માતાની મૂર્તિ મુકીએ ? શ્રી મહાકાલી માતા આપણાં કુળદેવી છે, છતાં આપણા વડવાઓ શ્રી મહાકાલી માતાની મૂર્તિને બદલે ત્રિશૂલની સ્થાપના કરી તેના ઉપરવટ જઈએ ? બાપદાદાના નિયમોનું ઉલ્લંઘન કરીએ ? કદી નહીં !

વિચારો, પૂ. મહાકાલીમાતાના પ્રતાપથી પૂ. બાપા પ્રગાટ થયા. આપણા વડવાઓએ પૂ. મહાકાલી માતાને આપણાં કુળદેવી તરીકે માન્યતા આપી હોવા છતાં આપણાં વડવાઓએ પૂ. મહાકાલી માતાની મૂર્તિને બદલે પૂ. મહાકાલી માતાને ત્રિશૂલાતરીકે રૂપ આપ્યું. આનું રહસ્ય આપણે સમજવું જ રહ્યું !!

હરકે-બરકે-આંબળા-ગળો-ગોખરુ અને જેઠી મધનો બજારમાં મળતો પાઉડર લઈ, મીકા કરી, રોજ સવારે નરણે કોઢે પાણી સાથે એક મોટો ચંમચો ફાકી જવાથી બે-ચાર મહિનામાં જીવાન થઈ જશો. ૧૦ વર્ષ ઉમર વધી જશો. જીવાન જ લાગશો. લેવાથી તેટલા વર્ષો આ પ્રયોગ કરો.

પૈસાની પૂજા કરો, પૈસાના પુજારી ન બનો.

## નાની મોટી ફોડકીઓ

### ૨. આંખના નંબરો કાટવા માટે :

પુરુષ ખરડોલીના મૂળનો પાઉડર (ડોડીના મૂળનો પાઉડર) એટલી જ સારામાં સારી ખડીસાકર મીક્ષ કરી નરણે કોઢે રોજ સવારે એક મોટો ચમચો અડધા કપ દૂધમાં મીક્ષ કરી પી જવું. આ પ્રયોગ ૮૦ દિવસ કરવાથી ૮૦ દિવસથી ૬૦ દિવસમાં તમારા આંખનાં નંબરો ચાલ્યા ગયા હશે. આંખ દાણીમાં જેવી થઈ ગઈ હશે.

૩. બજારનું વધુ પડતું ખાવાથી શરીરની નળીઓ બલોક (બંધ) થઈ જશે અને પછી એન્જુયોગ્રાફી અને એન્જુયોલાસ્ટ ઓપરેશન કરાવવું પડે છે.

### ૪. નાની મોટી ફોડકીઓ :

સીબીજ આગળ નાની ફોડકીઓ અને સાથળના ભાગમાં બાજુના સાથળ પર ખંજવાળ, કાળાશ, ચાઢાં પડી ગયા હોય તો એન્ટીફેંગાલ (Flocnazol) ૧૫૦ મિ.ગ્રા. ગોળી લોકે ગોળી અઠવાડિયામાં બે વખત લેવી, જે ચાર અઠવાડિયા સુધી ચાલુ રાખવી. અંદરના વસો કોટનના પહેરો. શરીરનો દરેક ભાગ રચચ્છ રાખો. ફંગાસ થયું હોય તેટલા દિવસ તેના ઉપર સાબુ લગાડવો નહીં.

૫. બાળક : થવા માટે સીના માસિકના ૭ દિવસથી બારમાં દિવસની વચ્ચે બને તો દરરોજ સંબંધ રાખવો. અને જન્મ માટે ઉપરોક્ત દિવસોમાં એકીમાં સંબંધ રાખો.

પોતાની ભૂલો શોધો, બીજાની નહીં.

૬. હાઈબલડપ્રોશાર કોને થાય ? : ગુસ્સો કરવાથી, ટેન્શન, નમક વધારે લેવા વગેરેથી.

૭. કસુવાવડ થવાના નાના મોટા કારણો :

(૧) તાવ આવવો, (૨) પેટનું દર્દ થવું, (૩) આદ્યાત લાગવો, (૪) કમરમાં એકાએક તાણ આવે અને દર્દ શરૂ થાય છે. રક્તસાવ થાય, તુર્ટજ હોચિટલમાં લઈ જવી.

૮. વારંવાર કસુવાવડ :

જો થતી હોય તો ગાયનું તાજું છોણમાં ૭/૮ ગલાસ પાણી નાખી તેની પરાસનો એક ગલાસ પાઈ દેવો. ૧૦૦% કસુવાવડ થતી અટકી જશો. ગર્ભશાય મજબૂત થઈ જશો.

૯. શ્રાદ્ધ :

બ્રહ્મભોજન કે કાગવાસ એટલે શ્રાદ્ધ તેવું માનનારાની સંખ્યા યોડી ઓછી થઈ છે. શ્રાદ્ધ - ખરું શ્રાદ્ધ કોને કહેવાય ? મરનાર વ્યક્તિના માર્ગ ચાલવું. તેના અધૂરાં કાર્યો પૂરા કરવા. શ્રાદ્ધ ધરતી વખતે ત્રણ વખત 'સ્વધા-સ્વધા' બોલવું. વડીલો હંમેશાં તેના બાળકો ગમે તેવા હોય છતાં તેઓનું હિત જ ઇચ્છતા હોય છે. વડીલો ક્યારેય સંતાનોને નડે નહીં. શ્રાદ્ધને દિવસે ધરમાં ખીર બનાવવી. પિતૃઓને મોકા અપાવવા શ્રાદ્ધની પરંપરા શરૂ કરી છે. એથી વધુ પુત્રો હોય તો ફક્ત એક પુત્રે જ શ્રાદ્ધ કરવાનું રહે છે. બિહારના બોધીગાયા અને પુષ્કર તીર્થ શ્રાદ્ધ માટે ફેમસ છે. એ જ રીતે ગુજરાતમાં સિદ્ધપુર-પાટણ પૌરાણિક સ્થળ છે. કાગડાઓને ખીર અને વડા તે દિવસે ખવરાવાય છે.

જરૂરિયાતો જેટલી ઓછી તેટલી ઉપાધિ પણ ઓછી.

ન,  
ભાડરવો મહિનો એવો છે કે જ્યારે ચંદ્ર પૃથ્વીથી વધુમાં વધુ  
નજીક હોય છે, જેથી ચંદ્ર પૃથ્વીથી નજીક આવતા જ પિતૃઓ પણ  
પૃથ્વીના સંપર્કમાં આવે છે.

### શ્રાદ્ધ :

સ્વર્ગાસ્થ પૂર્વજોનું આપણા ઘરે એક દિવસના મહેમાન  
તરીકે પદ્ધરામણું થાય છે. એક પ્રકારે મૃત્યુ પણી પણ વડીલો  
સાથે સંબંધનો સેતુ આ શ્રાદ્ધના ભાઈયમથી બનાવી શકાય છે.  
વધુ વિગત માટે - [jwalantchhaya@guj.bhaskarnet.co](mailto:jwalantchhaya@guj.bhaskarnet.co)

૧૦. સોસાયટીના મકાન પર મોબાઇલ ટાવર મુકાવવો એટલે  
સાક્ષાત્ યમરાજનું તેડું :

થોડા ઝપિયા કમાવવા માટે મોબાઇલ ટાવર મુકવું એટલે  
સોસાયટીમાં રહેતી વ્યક્તિઓ તો શું ૫૦ મીટર સુધીના મકાનોમાં  
રહેતી વ્યક્તિઓને રેડિયોશનના કારણે તમામ સભ્યોની તબિયત  
નરમ-ગરમ રહેવા માંડે છે. મગજનું કેન્સર, શરીર જાડુ થઈ  
જવું, અનિદ્રા આવવી, પાયનતંત્ર ખરાબ થઈ જવું, આંખના  
નંબર વધી જવા, ચાદશક્તિ ઘટવી વગેરે રોગોથી ઉપરાંત  
છોકરાઓ પેદા કરી શકતા નથી. આજકાલ નાના છોકરા-  
છોકરીઓ મોબાઇલનો બેફાબ ઉપયોગ કર્તા થઈ ગયા છે. ૪ થી  
૫ મિનિટથી વધુમાં વધુ ૭ થી ૮ મિનિટથી રોજનો વધુ  
વપરાશવાળાને ઉપરોક્ત રોગો જલ્દી લાગુ પડે છે. ઉપરાંત  
છાયમાં ખાલી ચડવી, કાનના રોગો થવા, એટેક આવવો,

પેરાલિસીસ થવું. સમજવા કેવી વાત છે. કરી જુઓ નીચેનો પ્રયોગ - મોબાઈલ શું છે. જ મોબાઈલ ફોનને એકબીજાની પાસે પાસે ફરતે ગોઠવવાના અને આ ચારેય મોબાઈલની વચ્ચે કાચી પોપકોર્ન મુકી અને આ ચારેય મોબાઈલને રણકી ઉંડાડી. અના રેડીયેશનથી પોપકોર્નનો દાણો પાકી જશે. રેડીયેશનની ગરમી આટલી બધી હોય તો મોબાઈલ ટાવરોની તો શું વાત કરવી ?

#### ૧૧. જૂ-લીખ :

માથાના કે શરીરના કોઈભાગના વાળની અસ્વચ્છતા રાખવાથી જૂ અથવા લીખ પેદા થાય છે. માયુ ધોવાની આળસથી જૂ-લીખનો જથ્થો પેદા થાય છે. તેના ઉપાયમાં (૧) બે ભાગ ગંધક ને એક ભાગ પારા સાથે એક રસ કરી તેનો ભૂકો અડધી ચમચી તેલમાં મેળવી રાત્રે એ જગ્યાએ મસણવું અને કપડાથી બાંધી દેવું, સવારના જૂ-કપડાને વળગોળી જણાશે. (૨) ધતુરાનું તેલ એ જગ્યાં એ લગાડી રાખો જૂ-લીખ મરી જશે.

#### ૧૨. દાંત :

દાંતનો દુખાવો જોરદાર ઉપક્યો હોય રત્યારે તો દુખાવો તોબા પોકારાવી દે છે. આ માટે (૧) જાયકળનું તેલ દાંતમાં મૂકવું. (૨) દૂધેલીના પાનનો રસ કાનમાં નાખવો અને તે છૂંઢી દાંત ઉપર મૂકો. (૩) જો દાઢ દુઃખતી હોય તો નાકમાં અને તાળવામાં દીવેલ લગાડવું. (૪) કાંદાના બીજ છૂઢી તેની પોટલી દાંત ઉપર મૂકવી. (૫) ગાલ ઉપર માટીનો પાટો બાંધવો.

બીજાની ભૂલો કરતાં પોતાની ભૂલો શોધો.

**૧૩. દાડમ :** દાડમના બી ઉપરાંત દાડમની છાલમાં દુર્લભ આરોગ્ય ગુણો છે. વિજ્ઞાનીરો પણ આશ્રય પામે છે. દાડમનાં દાણા વચ્ચે જે જાળા છે તે પણ અતિ ગુણકારી છે. જલડપ્રેશાર - કેન્સર વર્ગેનો અક્ષિશ ઉપાય.

**૧૪. સફેદ ડાઘ - કોટ :**

સ્પર્શથી આ રોગ ફેલાતો નથી. સફેદ થયેલ ચામડી પર સૂર્યના કિરણો અથવા અલ્ટાવાયોલેટ રેંજ લેવો. કથ્ય, ફેફસામાં દાહિ, દમ, બીસીજુ એમ આર.આર. અથવા લસીની પ્રતિક્રિયાને કારણો કોટ થાય છે. માનસિક આધાત, અશક્તિપણું, ચિદચાપણું, કોધભાવના, દબાવી રાખવાની ટેવ, તણાવથી ત્વચા પર પરિણામ આવે છે. આનો યશસ્વી ઉપચાર માટે દાદરકર બિંડીંગ, રેફિ, એ, પાનેરી શોરમ નજુક, તિરુપતિ કલેક્શન ઉપર, બીજો માળ, એન.સી. કેલકર રોડ, દાદર વેસ્ટનો સંપર્ક સાધવો.

**૧૫. ખાવા-પીવાની આઈટમો :**

બગારની ખાવા-પીવાની ચીજેમાં વર્ષો પહેલા ભેળસેળ થતી હતી, હવે તો છુદ બહારની ભેળસેળ થાય છે. ચેતો.

**૧૬. વીર્ય વૃદ્ધિ :**

શક્તિ માટે વીર્ય વધારો મહિંદ્રની ધાતુ છે. વીર્યનો વધારો કરવા માટે (૧) વડની જટાની કુમળી મૂળીનો ભૂકો અને સાકર સરખે ભાગો મેળવી પાંચ ગ્રામ વેટલું ખાવાથી લાભ થાય છે. (૨) ઓલચી-જાવંશી, પ્રણા-પ્રણા વાલ તથા બદામનો મગાજ ૧૦ ગ્રામ વાટી સવારે ખાવાથી તાકાત વધશે. (૩) તલને વાટી પાણીમાં કાંઝુ બનાવી ગરમ ગરમ પીવાથી વીર્યમાં વધારો થશે.

કોઈ જ્યારે ટનબંધ મસકા મારે ત્વારે ચેતજો !

૧૭. ડૉક્ટર : ડૉક્ટરને ઘરની કોઈ વ્યક્તિ બીમાર હોય અને જો લાવવી પડે તો તેને આવકાર ન અપાય તે ખાસ યાદ રાખશો. ડૉક્ટરને યમ કહેવાય છે.

૧૮. નવરાત્રિની નવ દેવીઓ :

(૧) શ્રી અંબા મા (૨) શ્રી કાલીકા મા (૩) ગાયત્રી મા  
(૪) શ્રી સંતોષી મા (૫) શ્રી ખોડીયાર મા (૬) શ્રી લક્ષ્મી મા  
(૭) શ્રી બહુયર મા (૮) શ્રી સરસ્વતી મા (૯) શ્રી ઉમિયાદેવી મા

૧૯. જાતીય સુખ :

આજે ૧૩ થી ૧૭ વર્ષની છોકરીઓ જાતીય સુખ ભોગાવી લેતી હોય છે. તેજ રીતે છોકરાઓ ૧૫ થી ૧૮ વર્ષે જાતીય સુખ ભોગાવી લેતા હોય છે. તેમને કંન્ડોલમાં રાખવા આટલું જરૂર કરો. (૧) ઈન્ટરનેટ - ટીવીથી દૂર રાખો. (૨) મોબાઇલથી દૂર રાખો. (૩) નોરતામાં ગરબા રમવા સાથે જાવ, જ્હેનપણી - દોસ્તારો સાથે ન જાય તેની કાળજી રાખો. (૪) રાત્રે મોડા આવે તો તેનો શ્યાસ પારખો કે કોઈ નશો તો કર્યો નથીને. (૫) મંદીરમાં રોજ જનાર છોકરીઓ ઉપર ધ્યાન રાખો અથવા સાથે જાવ. (૬) મોબાઇલ ફોન આપેલ હોય તો તે કોને કેટલી મિનિટ વાતો કરે છે. ફોનો આવે છે તે તપાસ, તે નંબર ઉપર ફોન કરી ઘટતી વિગત જાણી લો. એજ રીતે એક બીજુ છોકરીઓ તેમાં ખાસ તો મોટા ઘરની-નાના ઘરની છોકરીઓને બધાજ શોખ શીખવી દે છે અને એક બીજુ ફેન્ડ સાથે આપ-લે પણ

મરણ કરતા ચુંચણ વધારે બળવાન છે.

કરાવી દે છે. ઘરના સભ્યો - કાકા - કાકી, ભાઈઓ વગેરે ઘરમાં રહેનાર વ્યક્તિઓથી જગતા રહો. ચેતો આજે તમારું માનશે - પછી કાલે નહીં માને. આ શોખ પણ એક નશોજ છે તે ખાસ ધ્યાન ધો. બાળકો માટે સમય નાનપણાથી કાઢો.

૨૦. લક્વા : ફળ અને શાકભાજુ મહિલાને લક્વાનું જોખમ ઘટાડે છે.

૨૧. ૨૦૧૨ : ૨૦૧૨માં પૃથ્વીના વિનાશની આગાહી ખોટી પડી છે. તેનું અર્થદારન ખોટું કરવામાં આવેલ છે. જે વર્ષ ૨૦૧૨ની ૨૧ ડિસેમ્બરે વિશ્વનો વિનાશ થશે.

૨૨. પેશાબમાં રેતી :

(૧) દીમાં વધારેલી ચોળાની ભાજુ રોજ ખાવાથી ધણો ફાયદો થાય છે. (૨) ગરમાળાના ઝાડનો કોઈપણ ભાગ ઉપયોગી થાય છે. ગાજર રોજ શેકીને ખાવાથી પણ સારી રાહત થાય છે.

૨૩. કલૌજુ જુરુ : વનસ્પતિક આહાર સાથે નિયમિત વપરાતા ભસાલાભમાંનો ભહૃત્યનો પદાર્થ છે. ઉત્તમ પાયન થાય છે. દરેકે રસોડામાં જરૂર રાખી ઉપયોગ રોજરોજ કરવો. જુરુ પાયન માટે દરેક ઘરમાં વપરાતું જ હોય છે. કલૌજુ જુરુ રંગમાં કાળુ છે. જે ઉષણા, દીપન, પાયન, સંગ્રહી, મેદ્ય, ગર્ભાશયનું શોધન કરનાર, તાપ ઉતારનાર, વિર્ય વધારનાર, શક્તિ આપનાર, ઇચ્છિકારક છે. કફવાતહર,

મોબાઈલથી દૂર રહો.

અંખોને હિતકારી ગોસ (ઉદરવાયુ) ઝાડા અને સૂંઠ સાથે ગરમપાણીમાં માથે લેપ કરવાથી શરદી અને શિરઃશૂલ મટે છે. (૨) પથ્થરી - કલોજુ ગોખર, પાષણબેદ સરખેભાગે મેળવં. આમાંથી ૧ થી ૨ ગ્રામ ત્રણાવખત લેવાથી શૂલ અને પથ્થરી મટે છે. ઘણીબધી વ્યાધિ અને ઉપાધીઓથી બચાવે છે.

૨૪. ટામેટા : હાડકા મજબૂત કરવા રોજ ચાર ટમેટા ખાઓ.
૨૫. હાડકાં : તૂટી ગયા હોય તો બની શકે તેટલુંં વધું લસણ ખાવ.
૨૬. ઓન્ટીબાયોટીક : બાળકોને ન આપો.
૨૭. નાળિયેરના : પાણીમાં ઘણા વ્યુદ્ધા દર્મ છે. મૂત્રમાર્ગમાં બળતરામાં રાહત થાય છે.
૨૮. વસ્તી : વિશ્વની કુલ વસ્તી ૨૦૧૦માં સાત અબજીથી વધુ હતી. ભારતની ૧૨૦ કરોડ + ઈનલીગલ આમ ચીનની વસ્તી કર્તા ૨૦૫૦ સુધીમાં ભારતની વસ્તી વધી જશે. ૨૦૮૦ ૨૦૫૦માં વિશ્વની કુલ વસ્તી ૧૧ અબજીનો આંકડો વટાવી જશે.
૨૯. આંધ્રપ્રદેશની સ્કિમ ૨૦૧૦ : પતીને તમાયો મારો અને ૩. ૧૦૦૦નું ઈનામ મેળવો.

મરણ કરતા સ્મરણ વધારે બળવાન છે.

### ૩૦. ખાંસી :

● સામાન્ય ખાંસીને અવગાણવી નહીં. બાળકોને ખાંસી થઈ હોય તો વંશલોચનનું ચૂર્ણ મધ્યમાં નાંખીને આપવું અથવા વાંસની ગાઠ હોય તે ઘસીને પાવી. મોટાઓએ ઘોડાવજનો કટકો ભીટામાં રાખવો. હળદરને શેકી રાત્રે સુતીવખતે મોંખાં રાખી રસ ગળવો. દાડમની છાલ ખાવી.

(૫૬. જી. બાળ કલાકારીની કલાકારી નિર્માણ કરતું હતું.)  
● ખાંસીના કફને દરેક સમયે બહાર કાઢો નહીં તો (૬) (૬. જી. બાળ કલાકારીની કલાકારી નિર્માણ કરતું હતું.)  
છાતીમાં સુકાઈને પડ બનતા જશે અને દમ થશે.

### ૩૧. ગાંઠને રૂગ :

(૪. શરીરમાં બહાર નીકળેલી ગાંઠ ક્યારેક ફૂટે ત્યારે તેને ઝર્ણાલાવવા કળીચૂનાનું નીતર્થું પાણીનાં પોતાં મૂકવાં. બીજા ઉપાયમાં લીમડાના પાનની રાખ સરસીયા તેલમાં મેળવી લગાડો. આ ઉપરાંત કાથો ધીમાં મેળવી લગાડવું. ગાંઠમાં જુવડા પડે તો તેના ઉપર ખાંડ ભભરાવવી જેથી ખાંડ ખાવા માટે કીડા ઉપર તરી આવશે ત્યારે કપૂરનો ભૂકો મુકવાથી કીડા મરી જાય છે.

### ૩૨. છાતીમાં પિત્ર :

શરીરમાં પિત્ર વધી જાય ત્યારે છાતી દુઃખવા માંડે છે. આ માટે દાડમના રસમાં પાંચ ગ્રામ સુનામૂળી મેળવી ખાવું. છાતીએ કફ પડે ત્યારે સિંધવ ખારની ભષ એક વાલ મધ્ય રોજ બે વખત

યભરાજને બોલાવવા બિહિંગ ઉપર મોબાઇલ ટાવર મૂકો.

ખાવું. છાતીએ લોહી પડે ત્યારે પાંચ ગ્રામ અથવા વધારે હીરાદખણાનું ચૂર્ણને અધકચરા કરી દાળમાં ભેળવી રોજ ત્રણ વખત એક સપ્તાહ લેવું. આ પ્રયોગ ચાલતો હોય ત્યારે તેલ, ઘી, ખટાઈ, માછલી, મરચું ખાવું નહીં. ખાંડ સાથે ચૂનામુખી ખાવાથી કષ્ટ થાય છે.

### 33. તોતડાપણું મટે :

તોતડાપણા શબ્દોને સુધારવા પીપળાના પાકેલા ફળ (ટેટા) અથવા તેનું ચૂર્ણ બનાવી રોજ ખાવાથી તોતડાપણું મટે છે. (૨) ગાયના ઘી સાથે ચૂનામુખી ખાવી. (૩) હળદર, ઉપલેટ, પીપર, સૂંઠ, જુરુ, અજમો, મેથીમદ્ય સરખે ભાગો લઈ તેનું ચૂર્ણ બનાવી તેમાંથી અઢી ગ્રામ જેટલું લઈ તેને ઘીમાં ભેળવી ખાવી. (૪) લૂણીની ભાજી ખાવી. આ બધું સાથે એક એક કલાકને અંતરે પણ ખાઈ શકાય છે.

### 34. અજમાવી જુઓ :

- એલ્યુભિનિયમના પ્રેસરે કુકરને સાફ્ફ કરવા તેમાં રાતના એક અખબાર મૂકી બે ગલાસ પાણી નાખી પલાળી રાખવું. સવારે અખબારથી કાચ લુણવાથી કાચ ચકચિત થાય છે.
- ગરોળીને હાંકી કાટવા રૂમાં ઈડાનું ફોલરું મૂકવું.
- કાચના વાસણને ચમકીલા કરવા પાણીમાં એક કપ વિનેગર ભેળવી ધોવા.

ટેટા નહીં સિંહ બનો.

- ઊનના સ્વેટર, શાલ વગેરે પર પડેલા ડાધા દૂર કરવા ડાધા પર થોડું દહીં ઘસીને ધોવું.
- રસોડામાં ઉપયોગમાં લેવાતા કપડાને ચણાનો લોટ મેળવેલ પાણીમાં પોણો બોળીને ધોવાથી કપડું બરોબર ધોવાય છે, તેમજ તેમાંથી ચીકાસ પણ દૂર થાય છે.
- વાળને ખરતા અટકાવવા ગરમ ઓલિવ ઓઇલમાં બે ટેબલસ્પૂન મધ્ય અને એક ચંભચી તજ પાઉડર બેળવી વાળમાં મસાજ કરી ૩૦ મિનિટ બાદ વાળ ધોવા.

#### ૩૫. ખીલ :

ખીલ, જ્લેકહેડ્સ તેમજ ત્વચાની રૂક્ષતા દૂર કરવા મેથીના પાનને વાટી તેમાં લીંબુનો રસ બેળવી ત્વચા પર રાતના લગાડવું. સવારે ચહેરો ધોઈ નાખવો. નિયમિત લગાડવાથી ચહેરા પર કરયાલી પણ નથી પડતી, તેમજ કોમ્પ્લેશન પણ સુધરે છે.

#### ૩૬. શેરબંજાર :

મેટલ શેર અથવા એવી કોઈ આઈટમ નીચે ઉતરી જાય તો તેને એવરેજ કરવા બીજુ ખરીદી કરી કરશો નહીં.

#### ૩૭. દૂધીનો રસ :

દૂધીનો રસ કાઢતા પહેલા દૂધીને ચાખી જુવો કડવી તો નથીને, દૂધી કડવી હોય તો તેનો રસ ન પીઓ. દૂધીના રસમાં

આશીર્વાદ ખરીદાતા નથી, મેળવવો પડે છે.

અન્ય કોઈ ફળના રસ ભેળવીને કયારેય ન પીવો. દૂધીનો રસ પીધા પછી જો કોઈને જડા-ઉલટી અથવા તો અન્ય પ્રકારની સમસ્યા થાય તો તેણે ટાલ્કાલિક નજીદીકની હોસ્પિટલમાં તપાસ કરાવવું. ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદની વેબસાઈટ પર ઉલંઘ આ બાબતે આપેલી માહિતીનો ઉપયોગ કરવો.

### ૩૮. સિએરિયન બાળક :

૩૪ સપ્તાહની અંદર સિએરિયનથી જે બાળકોનો જન્મ થયો હોય તેવા ૩૦ ટકા બાળકોને શાસની તકલીફ થવાની શક્યતા રહેલી છે.

### ૩૬. દાંયવું :

અચાનક કોઈ કારણસર દાંયી જવાય તો (૧) ચૂનો ૧૦ ગ્રામ અને મીઠું તેલ અથવા અળસીનું તેલ ૧૦૦ ગ્રામ મેળવી એકદમ પાતળું બનાવી તેનો મલમ બળેલા ભાગ ઉપર લગાડો. (૨) ચૂનાનું નીતર્યું પાણી ૧૦૦ ગ્રામ, તેમાં ૫૦૦ ગ્રામ કોપરેલ નાંખી ખૂબ હલાવવું. તેમાં કલઈ સફેદો ૧૦૦ ગ્રામ મેળવી ત્રણ દિવસ પછી સૂક્કાય જાય તો તેલ નાંખવું, તરત દાંયેલા ભાગ ઉપર આ લગાડવાથી ફોલ્લા પડે તો તરત ઝડ આવે છે.

### ૪૦. જીવજંતુથી છૂટકારો :

(૧) ક્ષય (ટી.બી.) ના જીવજંતુ માટે સાકરનો ઘુમાડો દરદીને આપવો. સાકરને સાળગતો અંગારા પર મૂકવાથી પણ જીવજંતુ

ઓવી કોઈ જાયા ગોતો જ્યાં દુઃખ ન હોય !

દૂર થઈ હવાને શુદ્ધ કરે છે. શારીર ઉપર કોહવાટ થાય ત્યારે જીવડાં પડે છે, ત્યારે કાંટાશેળિયાના પાનનો રસ લગાડવાથી પણ જીવજંતુ મરે છે. સીતાફળનાં પાન તથા બી જીવજંતુને મારે છે. પાણીમાં જીવજંતુ હોય તો લીંબુનો રસ નીચોવી નાખવાથી પણ જીવજંતુ હટે છે.

#### ૪૧. ધા-જખમ :

તુર્તજ પોતાનો અથવા બીજા કોઈનો પેશાબ લગાડી છે. આમ એજ દિવસે ૨ - ૪ વખત લગાડશો તો બીજે દિવસે તમોને દુખાવો બળતરા કે પાકશો નહીં. અને તુર્તજ મટી જશે. અથવા પેશાબ ઉપર - બેટાડીન અથવા સોફ્રામાઈસીન મલમ ધા ઉપર લગાડો.

#### ૪૨. જંદટ / પેટ મોટું થયું :

ચાર ચમચી અજમો અને ખારેકના પ્ર ઠળીયાનું ચૂણ્ણ બનાવી રોજ બે વાર પાણી સાથે લેવું. પેટ કોઈ પણ કારણસર મોટું થાય ત્યારે ગરમાળાના પાન છૂંઢી ગરમ કરવા અને તેનો રસ પં ગ્રામ જેટલો લઈ દરદીને રોજ બે વખત પીવરાવવું. મૂળાના પાનનો રસ રૂંગ ગ્રામ જેટલો લઈ તેમાં દસ ગ્રામ દીવેલ મેળવી રોજ પીવું. સામુદ્રફળને દીવેલમાં ઘસી રોજ પી શકાય.

હજાર ઝેરી સાપની વચ્ચે એક બીન ઝેરી સાપને વર્ષો સુધી રાખો તો બિન ઝેરી કયારેય ઝેરી બનતો નથી. જ્યારે માણસ એક ભાગે જીવ ઓવો છે જે કોઈના સારા કે બુરા પ્રભાવમાં પડવામાં વિલંબ કર્તા નથી.

માણસની આંકણી એના સદ્ગુણોથી થાય છે.

### ૪૩. કાળી ચૌદસો :

કાળી ચૌદસની પેદાશ સમાજને વધુ કનકે છે. કાળી ચૌદસ વર્ષમાં એક વાર આવે છે. જ્યારે કાળી ચૌદસની પેદાશ તો દરરોજ આવી શકે છે.

### ૪૪. બાળક :

બાળકને બુદ્ધિશાળી બનાવવા નાનપણાથી જ સુવર્ણના ઘસારો (ગાળથુથી) સાથે બ્રાહ્મી સ્વરસ આપો.

### ૪૫. લોહીવા બંધ પડે :

ખીને વધારે પડતું લોહી જતું હોય તો લોધર બે આની ભાર જેટલું આપવું. (૨) કડાના ફૂલ અટી ગ્રામ, સાકર અને એલચી દરેક અટી ગ્રામ લઈ તેને ૫૦૦ ગ્રામ પાણીમાં ઉકાળવું. આ પાણી દિવસમાં થોડું થોડું ત્રણ વખત પીવું. (૩) વધારે પડતું હોય તો કેવડાની જડ અટી ગ્રામ લઈ તેને ૧૦૦ ગ્રામ દૂધમાં ઘસી સાકર નાંખી સાત દિવસ પીવું.

### ૪૬. વારંવાર પેશાબ :

જુવારનો લોટ ૫૦૦ ગ્રામ, ધી ૨૫૦ ગ્રામ, ખાંડ ૧૦૦ ગ્રામ લઈ તેનો લાડુ બનાવી સવાર સાંજ દરેક વેળા આશરે ૧૦૦ ગ્રામ જેટલું ખાવું. આ રોગને સોભ રોગ કહેવાય છે. એ માટે ભીડા બીજ, ગાળોના સાટ્યને અટી ગ્રામ લઈ તેને દૂધમાં ઉકાળીને પીવું. આના વધુ ઇલાજ તરીકે બે આની ભાર જેટલી ફૂલાવેલી હીરાકસી લઈ મલાઈ સાથે બે વખત ખાવું.

શરીર જળથી, આત્મા ધર્મથી અને બુદ્ધિ જ્ઞાનથી પવિત્ર થાય છે.

## ૪૭. કોલેસ્ટ્રોલ :

દવાઓ ખાવાથી ઓછું થતું નથી. દવાઓ ખાવાથી લીવરની એન્જાઈમ વધી છે, કેન્સર વગેરે થવાનું જોખમ વધી જાય છે. ડીપ્રેશન, શારીરના હાડકા માંસમાં દુઃખાવો થાય છે. કોલેસ્ટ્રોલ બે પ્રકારના હોય છે. ગુડ અને બેડ કોલેસ્ટ્રોલ અને બેડ કોલેસ્ટ્રોલથી હાર્ટની બીમારી થાય છે. કોલેસ્ટ્રોલ ઘટાડવાનો એકજ ઉપાય છે - પરેજુ, તંબાકુ, પડીકી, શરાબ, તેલ, મસાલા, હોટલનું ખાવાનું, જંક ફૂડ વગેરે ખોરાકની પરેજુ અથવા બધુંજ ખાવ પરંતુ દરરોજ બાજરીનો નાનકડો રોટલો કે બાજરીની રાબ થોડીક લેવાની રાખો.

## ૪૮. લક્ષ્યી ભેળવવા :

લક્ષ્યી ભેળવવા માટે ધનતેરસથી ભાઈબીજ સુધી દિપાવલી પૂજા પ્રયોગ મંત્ર - દિવાપલી પૂજા પ્રયોગ કર્તાં પહેલા સવારના સ્નાન પછી દર્ભના અથવા જે આસન પ્રાચ્ય હોય તેના ઉપર બેસી ધીનો દીવો ભગવાન સમક્ષ કરવો. ત્યારબાદ પોતાના ઈષ્ટદેવની જમણી બાજુ અર્થાત્ પોતાની ડાબી બાજુ ધીનો દીવો કરવો તેમજ પોતાના ઈષ્ટદેવની ડાબી બાજુ અર્થાત્ પોતાની જમણી બાજુ તેલનો દીવો કરવો. પૂજા પૂરી થાય ત્યાં સુધી બઢે દીવા ચાલુ રાખવા. તે સિવાય જેમનાથી શક્ય હોય, સાચવી શકાય તેમ હોય તેમણે એક ધીનો દીવો તેમજ એક તેલનો દીવો ધનતેરસથી ભાઈબીજ સુધી અખંડ રાખવો. આ પ્રયોગથી આમૂલ્ય અભ્યુદય,

તમો ઇથિયાને સાચવશો કે ઇથિયા તમોને ?

સુખસંપત્તિ તેમજ સૌભાગ્ય સુખની વૃદ્ધિ અર્થે, સંતાન સુખની પ્રાપ્તિ માટે, બીમારીના નિવારણ માટે, નોકરી-ધંધાની મુશ્કેલી દૂર કરવા, દેવામાંથી મુક્તિ મેળવવા અથવા કોઈપણ આપત્તિની ફસામણીમાંથી મુક્ત થવા માટે શ્રીસુક્ત રાત્રિ સુક્તિ, મહાકાલી, મહા સરસ્વતિ, મહાલક્ષ્મીનો મંત્ર જપ, મૃત્યુજ્યા જય હનુમાન ચાલીસાના પાઠ, ગણપતિની સ્તુતિ, ઠાકોરજીની સ્તુતિ, જય મંગાણના પાઠ, નવકારમંત્ર, ગુરુ ગ્રહની પ્રાર્થના પોતપોતાના ધર્મ પ્રમાણે જે દેવદેવી પર શર્જા છોય તે પ્રમાણે કરવી.  
સૌભાગ્યવતી બહેનો એ વિશેષમાં દીપપૂજન-પીપળાનું પૂજન કરવું.

#### ૪૬. ધનપ્રાપ્તિ માટે :

**ધનતેરસથી બાઇબીજ સુધી દીવાળી પૂજા પ્રયોગ મંત્ર  
નીચે મુજબ કરવો –**

- (૧) શ્રી કર્લી મહાલક્ષ્મી નમ: અથવા
- (૨) ઊં શ્રી હીં શ્રી કમલે કમલાલયે પ્રશીદ શ્રી હીં શ્રી ઊં મહાલક્ષ્મી નમ: અથવા
- (૩) ઊં હી શ્રી કલંદ, ઊં ધંટાકર્ણ મહાવીરલક્ષ્મી પૂર્ય

**પ્રો. અજમાવી જુઆં :**

લવિંગને પાણી સાથે વાટી જરા ગરમા કરી

ગર્ભનિરોધક ગોળીઓથી બ્રેસ્ટ કેન્સર થાય છે.

ખની  
કેલી  
તિની  
ાલી,  
માન  
જ્ય  
ધર્મ  
ગાનું  
મંત્ર  
ત્રિ  
રૂપ્ય  
દર્રી

કપાળ તથા કાનની પાઇળ લેપ કરવાથી સ્નાયુની પીડા ભટે છે.

- દમના રોગી, હળદર અને સૂંઠનું ચૂરણ મદ્ય સાથે લાંબા દિવસો સુધી ચાટવાથી ફાયદો થાય છે.
- લેધર પર્સ પરથી શાહીના ડાઢા દૂર કરવા નેલ પોલિસ રિમુવરનો ઉપયોગ કરવો.
- લીંબુના રસમાં પાણી ભેળવી આ ભિક્ષણથી દાંત સાફ કરવાથી દાંત ઉપર જામેલી પોપડી ટીલી થઈ દૂર થઈ જાય છે. તેમજ મુખ દુર્ગાધથી છૂટકારો મળે છે.
- લીલા શાક વાસી થઈ ગયા હોથ તો ઠંડા પાણીમાં ચેક-બે લીંબુનો રસ ભેળવી તેમાં ભીજવવાથી તાજા જેવા થઈ જશે.
- વાસણમાંથી ચીકાસ દૂર કરવા કેળાની છાલના અંદરના ભાગથી ઘસવા.
- રોટલી થઈ ગયા બાદ તવા પર લીંબુની છાલ રગડવાથી તવો સાફ થઈ જાય છે.
- ઈડલીના બચેલા આથાથી તવો સાફ કરવાથી તેના પરની ચીકાશ દૂર થાય છે.
- પ્લાસ્ટિકની ગરણીને પાણીમાં કપડા ધોવાનો સોડા ભેળવી સાફ કરવાથી નવા જેવી થાય છે.

રોજ ૩૦ મિનિટ ઝડપી ચાલો, બલડપ્રેશરથી બચો.

પ્ર૧. ત્રણા ટાઈપના માણસને કદી ભૂલશો નહીં....

(૧) તમારા ખરાબ સમયમાં તમોને મદદ કરે.

(૨) તમારા ખરાબ સમયમાં તમોને છોડી જાય.

(૩) તમને ખરાબ પરિસ્થિતિમાં મૂકી દે.

પ્ર૨. સંતાન પ્રાપ્તિ - ગર્ભધારણ માટેનો મંત્ર :

‘નનદ ગોપગૃહે જાતા યશોદા ગર્ભ સમખવા

તત્ત્વતૌ નાશાયિષ્યામિ વિન્દ્યાચલ નિવાસીની.’

ધનતેરસથી ભાઈબીજ સુધી ઉપરોક્ત મંત્ર ભોજપત્ર પર અથવા નાગરવેલ કે પીપળાના પાન પર ચંદનથી યથાશક્તિ લખવા અથવા આ મંત્રના સંપૂર્ણ લારા શતયંડી કરવાથી ગર્ભયોગ, સંતાનયોગ થાય છે. શતયંડી કરવાની પોતાની શક્તિ ન હોય તેમણે ઉપરોક્ત મંત્ર દરરોજ ગર્ભધારણ સુધી લખવા અને ત્યાર પણી લખેલા મંત્ર તીર્થરસ્યાને નદીમાં પદ્ધરાવવા.

પ્ર૩. વિદ્યાભ્યાસમાં સંતાનોની કુશાગ્ર બુદ્ધિ માટે તેમજ યાદશક્તિની વૃદ્ધિ માટેનો મંત્ર :

‘સર્વરસ્ય બુદ્ધિરૂપેણ જનરસ્ય હૃદિ સંસ્થિતે,

સ્વર્ગપવર્ગદે દેવી નારાયણિ નમોસ્તુતે.’

વિદ્યાભ્યાસમાં સંતાનોની કુશાગ્ર બુદ્ધિ માટે, યાદશક્તિની વૃદ્ધિ માટે દરરોજ ઉપરોક્ત મંત્રજાપ કરવાથી શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત થાય છે.

એક-ઓક કલાકે પાણી પીવાથી કોઈ રોગ નથી થાય.

ધનતેરસથી ભાઈબીજ સુધી આ મંત્રને ભોજપત્ર પર લખવો અને તે ભોજપત્ર સંતાનને આપી રાખવાથી મંદબુદ્ધિમાં સુધારો થાય છે. તેમજ યાદશક્તિ વધે છે.

#### ૫૪. બ્રેસ્ટ કેન્સર :

બ્રેસ્ટ કેન્સર ૩૦ થી ૩૫ ટકા મહિલાને સ્તન કેન્સરથી થાય છે. સ્તન કેન્સર થવાના ઘણાં કારણોમાનું એક બેદરકારી છે. પ્રથમ ગાર્ભવર્ષથાની વર્ષે વધતું જતું અંતર, કેન્સર માટેની મેમોગ્રામ થેરેપી બહુ પીડાદાયક છે વગોરે. પણ વાસ્તવમાં આમ હોતું નથી. ઉપરાંત સ્તન કાટવું જ પડે તેવી માન્યતાં નથી. શરૂઆતી તબક્કામાં નિદાન થાય તો સંપૂર્ણ પણે ક્યોર કરી શકાય છે. ગાયનેકોલોજિસ્ટ ડૉ. ગીતા પંડિયાનું પુસ્તક 'જાણો તમારા સ્તન' જરૂર વાંચો. આ બિમારી ૩૦ વર્ષની આસપાસની ઉંમરની સીઓમાં વધારે જોવા મળે છે. શાકભાજુ અને ફળો સાથે એન્ટિઓક્સિડન્ટના વધારે પ્રમાણવાળો ખોરાક લેવો. ઉપરાંત નિયમિત કસરત રાખવી. ૩૦ વર્ષની ઉંમર બાદ નિયમિત ચેકઅપ કરાવવું. વલ્લ સંશોધનમાં જણાવ્યા મુજબ દિવસમાં ભાગ અડધો કલાક ચાલવાથી સ્તન કેન્સરના જોખમમાં ઘણો ઘટાડો થાય છે. ડોક્ટરો જણાવે છે કે એક વખત સારવાર કર્યા બાદ ફરી ગાંઢ થવાની શક્યતા ૧૦ ટકાથી પણ ઓછી છે. અને ક્યોર થયા બાદ ગાર્ભવર્ષથા ધારણ કરવામાં કે સ્તનપાન કરવામાં માતાને કે બાળકને કોઈ જોખમ રહેતું નથી.

એક કરતાં બે ભલા અને બે કરતાં ત્રણ.

#### ૫૫. જી ચેસ્ટ :

આપનું વજન ખૂબ ઓછું હોય તો થોડું વજન વધારો, ચેસ્ટ થોડા ભરાવદાર થશે. વજન વધારવા દરરોજ કઠોળનો વધુ ઉપયોગ કરો. સાથે સવાર સાંજ pro one પ્રોટીન પાઉડર લેવાનું રાખો. થોડી ધીરજ રાખવી પડે રાતોરાત ચેસ્ટ ભરાવદાર કાંઈ ન થઈ જાય.

#### ૫૬. હરકે-બરકે-આંબળા-ગળો-ગોખરું :

રોજ નરણા કોઠે ૧ ચમચી પાણી સાથે ફાકી જવ - એક વર્ષમાં જુવાન થઈ જશો. શરીરમાંથી અનેક રોગોનો નાશ થઈ જશો. આ સિવાય બીજા અસંખ્ય ફાયદા થાય છે. લાંબું આયુષ્ય સુખરૂપે જીવી શકો છો.

#### ૫૭. લુલાગવી :

ઉનાળામાં સખત ગરમીમાં લુલાગી જાય છે. તડકામાં ગરમીથી બયવા બાળકને ઉધરસ, દમ હોય તો તેમને ધાણા-ખડી સાકર પાણીમાં પીવડાવવું. લુલાગી હોય તો મેથીની સૂકી ભાજુ પાણીમાં પલાળી તે પાણી મદા સાથે પીવડાવવું. મોટામાં કાળી દ્રાક્ષ આલુ અથવા જેઠીમધ રાખવાથી પણ લુલા નહીં લાગે.

#### ૫૮. માથામાં દુખાલો :

સુંઠને પાણીમાં ઘસી અનો નાશ લેવો. બોરડીનું મૂળ અને

પરમેશ્વરની પૂજા કરો પરંતુ મંદિર ન બાંધો.

પીપર દસી કપાળે લગાડવું. કેળની કુંપળનો રસ પણ માથે લગાડી શકાય. અઠી ગ્રામ જેટલી કાળી મસળી કોપરા સાથે ખાવી.

#### ૫૯. મૂત્ર અટકે :

પેશાબ એટકતો હોય અથવા અટકી-અટકી આવતો હોય તો દૂધમાં ગોળ ભેળવીને પીવું. તાંદળજાની ભાજુના મૂળનો રસ અઠી ગ્રામ લઈ તેને ચોખાના ધોણમાં પીવો. ગોખરનો ઉકાળો લઈ તેમાં જે ભાગ ગૃહાળ નાખીને પીવું. જુરા સાથે જૂનો ગોળ ખાવો. તાડનું મૂળ લઈ તેને ચોખાના ધોણમાં પીવું.

#### ૬૦. દરાજ :

દરાજ થવાના કારણોમાં અરસચ્છતા અને લોહીની અશુદ્ધિ ઉપરાંત મન વ્યઘ રહેતા તેની અસર ત્વયા ઉપર થાય છે. ઉપાયમાં પારો, ગંધક, આમળા, મોરથૂયું, લીંબુના રસમાં વાટીને લગાડવું. રક્ત શુદ્ધિ માટે ઉપાયો કરવા જોઈએ. બદામના મગજને લીંબુના રસમાં દસીને ગ્રાણ દિવસ લગાડવો.

● ‘આલાપ – પ્રલાપ અને વિલાપ એ એક લાલસા છે. આ ઈશ્વરને પામવાના ગ્રાણ પગથીયા છે.

(૧) દાણી કન્ટ્રીઓમાં પ્લાસ્ટીકની ચલણી નોટોનો ઉપયોગ થાય છે. હવે ઇન્ડિયામાં પણ શરૂ થશે.

(૨) આવતા ગ્રાણ વર્ષમાં પેટ્રોલનો ભાવ કદાય ૩. ૨૫૦ થઈ શકે છે. તો મોંઘવારી કેટલી થશે. બચત કરો.

દરેક વાત ઉપર હસતા માણસનો ક્યારેય વિશ્વાસ ન કરો.

- (3) ભારતમાં મોબાઈલ ધારકોની સંખ્યા ૮૦ કરોડે પહોંચી છે. હું પોતે છેલ્લા ધણા વર્ષોથી મોબાઈલને સ્પર્શ પણ કરતો નથી.
- (4) ગરીબ વ્યક્તિ સુખી હોય શકે, પરંતુ સુખી વ્યક્તિ ક્યારેય ગરીબ ન હોય શકે.

#### ૬૧. પેશાબ અવરોધ :

કોઈપણ કારણસર પેશાબ બંધ થઈ જાય તો તલ બે ભાગ અજમો એક ભાગ મેળવી દિવસમાં ત્રણવાર લેની ફાકી ભારવી.

(૧) નાની કોડી પાણીમાં ઘસીને પીવાથી પણ પેશાબ છૂટથી આવે છે. (૨) દસ નંગા કાળા ભરી છૂંદીને ૨૫૦ ગ્રામ પાણીમાં નાખી તે પાણીને બીજા વાસણમાં નાખી તે પાણી ઊંચી ધારથી પીવું. (૩) મૂળાના પાનનો ૧૦૦ ગ્રામ રસ પીવો. (૪) મૂળાનો ઇપ ગ્રામ રસ, ૧૦ ગ્રામ સાકર દિવસમાં બે વખત પીવો.

#### ૬૨. ‘બોટક પીણાં અને ગંકફૂડ : તબિયતનો સાથ્યનાશ.’

હવે તો દેશી દવાઓ – ઝાડના મૂળનો પાઉડર દરેક જગ્યાએ મળે છે.

#### ૬૩. પૂરુષાતન વધે :

સાચું પૂરુષાતન વધારવું હોય તેમણે જાયકળ, લવિંગ, કેસર, સુંઠ સરખાભાગો લઇ તેને પાનના રસમાં એક વાલ વજનની ગોળી બનાવી એક એક ગોળી ૧૪ દિવસ ખાવી. આ

કોઈ કારણ વગાર ગિફ્ટ આપે તો ચેતજો !

ઉપરાંત ખારેક ૧૦ ગ્રામ પાણીમાં ઉકાળી પોચી પડે ત્યારે તેને ચીરીને ઠળીથા કાઢી નાખવા, ખારેકને સૂકાવા દેવી, કઠણ થાય ત્યારે ખારેકને ૫૦૦ ગ્રામ દૂધમાં ઉકાળી પીવાથી લાભ થાય.

#### ૬૪. જુનો ગોળ :

જુનો ગોળ જઠરાંનિને પ્રદીપ્ત કરનાર, પૌષ્ટિક પચવામાં હળવો, વીર્ય વર્ધક, હૃદય માટે હિતકારક, રચિકર, લોહી વિકારને દૂર કરનાર, બ્રિદ્ધિ શામક, થાકને દૂર કરનાર તથા કથય, ખાંસી માટે ગોળ સાથે સૂંઠ સાથે લેવામાં આવે તો કફનો પણ નાશ કરનાર છે.

#### ૬૫. ધનસંપત્તિ :

વધુ ધન સંપત્તિ જેની પાસે હોય તે અતિ વ્યગ્ર રહે છે. નિદ્રા લઈ શકતો નથી. સંપૂર્ણ પણે નિદ્રાધીન થતો નથી. જેની પાસે વધુ પડતું ધન નથી તેની પાસે આત્મસમૃદ્ધિ અને સંતોષ છે.

#### ૬૬. ઘર મોટું :

ઘર મોટું હોય તો ભેગા નથી રહેવાતું પરંતુ મન મોટું હોય તો ભેગા રહી શકાય. આ કેટલાં અંશે સાચું ?

૬૭. સુખની ચાવી : મહાલક્ષ્મી (હક્કની - સારી લક્ષ્મી) એ સુખની ચાવી છે.

- રોજ ૩૦ મિનિટ ઝડપી ચાલો અને જલડપ્રેસરથી દૂર રહો.

## ૬૮. ગોળ :

જૂનો પછી છે મહિના કે ૧૨ મહિનાનો ગોળ રોજ ખાઈ શકાય છે. ગોળ બાળકોનો પ્રિય છે. જૂનો ગોળ પચવામાં હલકો છે. તે પાચનતંત્રને સુધારે છે. પોષિક છે. ઇથિકર/વીર્ય વર્ધક છે. થાકને દૂર કરે છે. ઉનાળમાં ગોળનું ‘આંખલવાણું’ કરીને ખાવાની પ્રથા છે. ગોળમાં કેલ્લિયમન તથા ફોસ્ફરસનું સારું અવું પ્રમાણ છે. હાડકા ભજબૂત થાય છે. ખાંડનો વપરાસ દૂર કરી ગોળનો વપરાશ અપનાવવો જોઈએ. ખડી સાકર ખાંડ કરતાં ગુણમાં શ્રેષ્ઠ છે. આદુ સાથે ગોળ લેવાથી રોગોનો નાશ થાય છે. હરકે સાથે લેવાથી પિતનું શમન થાય છે. અને સૂટ સાથે લેવાથી વાયુનો નાશ થાય છે. એક વર્ષથી વધુ જૂનો ગોળ ખાવાથી નાનાભોટા ૧૦૦ રોગ મટે છે. નવો ગોળ ખાવાથી રોગોનું ઉત્પાદન થાય છે. જેને ખજવાળ, ખરજવું, ખસ, દાદર, સફેદ કોટ કે બીજા-ત્રીજા ચામડીના રોગો હોય તેમણે ગોળ ન ખાવો. આ સિવાય પ્રમેહ, મેદની વૃદ્ધિ, કૃભિ, દાંતનો સડો અને કફ કે શરદી હોય તેમણે પણ ગોળ ન ખાવો. ગોળ ખાવાથી બાળકોને કૃભિ થાય છે, જેને કૃભિ થઈ હોય તે બાળકને ગોળ ન ખવરાવવો. ગોળ દહીં, દૂધ, અડદ કે તલ સાથે ન ખાવો. આ દ્રવ્યો સાથે ગોળ વિરુદ્ધ આહાર ગણાય છે.

- (૧) શાસના દર્દીને ગોળ ઉપયોગી થાય. જે માટે ૧૦ ગ્રામ જૂનો ગોળમાં એટલું જ સરકિયું તેલ નાખી બરાબર ચોળીને એક માસ સુધી ખાશો તો શાસ દરદ કાબુમાં આવે છે.
- (૨) આંબળાનું ચૂર્ણ અને ગોળ સરખા ભાગે ભેળવી રોજ ખાવાથી વિર્યની વૃદ્ધિ થાયે છે.

#### ૬૬. બહેરાશ :

શરદી અથવા બીજા અન્ય કારણોસર કાનમાં બહેરાશ આવી ગઈ હોય તો કાંદાનો રસ કપડાંથી ગાળીને કાનમાં ભૂકવો. આથી બહેરાશ અને શરદી બજે દૂર થશે. સિવાય આંબળાના પાનનો રસ, મધ્ય સાથે ભેળવી કાનમાં ટીપાનાખો. બીલાંને ગૌમૂરમાં ભેળવી એક ભાગ એ અને બે ભાગ બજરીનું દૂધ, બે ભાગ પાણી અને છ ભાગ તેલ ઉકાળી તેલ બનાવી એ તેલ કાનમાં નાખવું.

#### ૭૦. વ્યસન :

સીગારેટ, તમાકુ, દાર કે કોકીન વગેરે છોડવા માટે કોઈ દવા નથી. હા, એક દવા છે. જે તમો જ મક્કમ થઈ ત્યાંગી દો.

હું ૪૦ વર્ષથી રોજની ૩૦ થી ૪૦ સિગારેટ પીતો હતો તે છોડી શીધી છે.

- જલેબીને ફિફેલ અને ફાફડાને મેળ કેમ કહેવામાં આવે છે - કારણ જલેબી (ફિફેલ) સીધી થઈ શકતી જ નથી. બીજે દિવસ પણ વાંકી જ રહેવાની છે, જ્યારે ફાફડા બીચારો સીધો જ હોય છે.

૭૧. વજન : વજન ફાસ્ટફૂડથી વધી જાય છે. પ્રેગનન્સીમાં સીનું વજન વધતું હોય છે, તેનું મુખ્ય કારણ પણ ફાસ્ટફૂડ છે, બાકી બાળકનું વજન કેટલું ?

૭૨. દાંતની પીડા : આધુનિક ખાણીપીણી નોતરે દાંતની પીડા.

૭૩. કોટ : કોટ ઉપર કનેરનું મૂળ તથા ફૂલ ઠંડા પાણીમાં ફૂટી ચામડી ઉપર મુકવાથી તે રંગ બદલાય છે. કાજુનું તેલ ચામડી ઉપર લગાડો અને ચામડી ઉપર મસળો. ચણોઠીનો લેપ મૂકો. દૂધમાં ધોયેલો ગાંધક અટી ગ્રામ, ૧૦૦ ગ્રામ દૂધ એક માસ સુધી લેવું. કોટના ચાંદાં મટાડવા ગાયનું દૂધ ૫૦૦ ગ્રામ - એની અંદર સરકો ૧૦ ગ્રામ નાખી કપડાથી ગાળી ત્રણ દિવસ પીવું.

૭૪. માઈગ્રેન : તુલસીના પાંડાનું ચૂર્ણ અને મધ્ય સવારે સાંજે ચાટો.

૭૫. આધાશીશી : માથાનો દુખાવો સૂર્યોદય વધવાથી વધે અને સૂર્યાસ્ત થવાની સાથે ઓછું થાય તો આવા માથાના દુખાવમાં સૂર્યોદય થતાં જ તેની સામે ઉભા રહી જવું અને ૧૫૦ ગ્રામ પાણીમાં છ ગ્રામ ખાંડ બેળવીને ધીમે ધીમે પીવું. દરરોજ ભોજનમાં બે ચમચી મધ્ય લેવાથી આ બીમારી ઓછી થશે. માથાનો દુખાવો થાય ત્યારે એ સમયે જ અડધી ચમચી મધ્ય લેવાથી આરામ મળશે. માથામાં જે ભાગમાં દુખાવો થાય તે બાજુના નાકમાં ૮ ટીપાં સરસવનું તેલ નાંખીને સુંધવાથી દુખાવો મટી જાય છે. ૧૨ ગ્રામ કાળી મરી ચાવીને ખાવ અને ઉપર ૮૦ ગ્રામ દેશી ધી પીવું.

૭૬. એચ.આઈ.વી. : એચ.આઈ.વી. લીમડાના પાન ખાવાથી નિકળી જાય છે.

૭૭. મેરા ભારત મહાન : ભારતમાં કુલ ૨૧ હાઈકોર્ટ છે અને એક સુપ્રિમ કોર્ટ છે. તેમાં કુલ ૨૧ લાખ કેશો ૨૦૧૨ સુધીમાં પેન્ડીંગ પડેલા છે. ડિસ્ટ્રીક્ટ કોર્ટોના થઈને ૩૦૦ લાખ કેશો પેન્ડીંગ છે. જેમાં કેટલાક કેશો ૫૦ વર્ષથી પણ વધુ જુના છે. કેશો વધુ રજાઓ પણ વધુ અને જ્યાયાધીશો ઓછા. આ કેસોનો ફેંસલો થતાં ૩૦૦ વર્ષ થશે તેમ આપણી સુપ્રિમ કોર્ટના વડા જ્યાયાધીશો કહું છે.

માણસનો અવતાર મળી ગયો પણ માણસ ન બન્યો.

૭૮. સોફ્ટડ્રીન્ક્સ : હોસ્પિટલોમાં તપાસ કરો સોફ્ટડ્રીન્ક્સથી કેટલા લોકો રોજ મરે છે. પેટનો ફૂગાળો ફાટી જાય છે.

૭૯. ગુટકા : તમાકુથી રોજ કેટલા લોકોને કેન્સર અને મરણ થાય છે. તે હોસ્પિટલમાં તપાસ કરો અથવા ટિસર્ચ સેન્ટરોનો સંપર્ક સાધો.

૮૦. અજમાવી જુઆો :  
 (૧) જાયફળને દૂધ સાથે ઘસી ખીલ ઉપર લગાડો.  
 (૨) બ્રાણ ચમચા મધ્ય તથા એક મોટો ચમચો તજનો ભૂક્કો ભેળવી પેસ્ટ બનાવી સૂતા પહેલાં ખીલ પર લગાડવું.  
 (૩) કલાક પછી તેના ઉપર કોટન બાંધી દેવું – સવારે હુંફાળા પાણીથી ચહેરો ધોઈ નાખવો. બે અઠવાડીયા આ પ્રયોગ કરવો.

(૪) રાતના સુતીવખતે એક-બે સંતરા ખાવાથી કબજુયાતમાં રાહિત થાય છે.  
 (૫) જાયફળને સરસવા તેલમાં ઘસી માલિશ કરવાથી જકડાયેલા સાંધા છૂટા પડે છે. તેમજ ડોક રહી ગઈ હોય તો તે મટે છે.  
 (૬) જવના લોટમાં તલનું તેલ અને છાશ ભેળવી લગાડવાથી ખુજલી મટે છે.

અનીતિના પેસા દાનસેવામાં વાપરી નાંખો.

- (૬) મીઠાવાળુ પાણી પીવાથી નશો ઉતરે છે. હૃદયરોગીઓએ કે બી.પી.ના દર્દીઓએ આ પ્રયોગ ન કરવો.
- (૭) તુલસીનો રસ દસ ગ્રામ આદુનો રસ પાંચ ગ્રામ ભેળવીને પીવાથી મેલેદિયામાં રાહત થાય છે.
- (૮) ચંદનની લાકડીને ગુલાબજળ સાથે ઘસી લેપ બનાવી જ્લેકહેટ્સ પર લગાવી ૨૦ મિનિટ બાદ હુંકાળા પાણીથી ધોઈ નાખવું.
- (૯) બટાકાને ખમણી તેમાં લીંબુનો રસ અને એક નાનો ચમચો મુલતાની માટી ભેળવી આંખની આસપાસ લગાડી ૨૦ મિનિટ બાદ હુંકાળા પાણીથી ધોઈ નાખવો. આંખની આસપાસની સ્ક્રિન હેલ્થી થશે.
- (૧૦) હીરાના આભૂષણોને બેબીટૂથ બ્રસ પર કોલગેટ લઈ હળવેથી ઘસવાથી નવા જેવો ચમકે છે.
- (૧૧) શરીરે ખંજવાળ આવતી હોય તો મોશ્વેરાઈઝર ચુક્ત કીમ અથવા તો કોપરેલ લગાડવાથી રાહત થશે.
- (૧૨) હાઈ - લો જલદપ્રેશરથી પીડાતી વ્યક્તિઓ માટે લસણ ખાવું, ફુદીનો, લસણ લીમડો, જીર,- ઘાણા, મરી તથા સિંધાલૂણ નાંખી ચટણી બનાવી ભોજન સાથે ખાવી - અથવા ધી કે તેલમાં લસણ કકડાવીને ખાઈ શકાય.

માતાના દૂધથી બાળકનું જીવન તંદુરસ્ત બને છે.

## ૮૧. વાળો :

પગ અથળા શરીરમાંથી વાળો કાટવા માટે ફૂલાવેલી ફટકડી અટી ગ્રામ ગોળમાં ત્રણ દિવસ ખાવી. બીજા ઉપાયમાં એક નાળિયેરમાં દુ રત્તીભાર નવસાર નાખી તે ૨૪ કલાક રહેવા દઈ તે નાળિયેરનું પાણી સવારે પીવું. તે દિવસે આજ નાળિયેર આખા દિવસમાં ખાવું. બીજુ કાંઈ ખાવું નહીં. સાંજે ગાયના દૂધની છાશ શરીરે ચોળી નહાવું. પછી દહીં અને ભાત ખાવા.

## ૮૨. ભૂખ વધારવા :

(૧) દ્રાક્ષ પાક ખાવો (૨) ગોળ અને સૂર્યમુખી ખાવા. (૩) અટી ગ્રામ કાળી મૂસળી, એલચી સાથે ખાવી. (૪) અટી ગ્રામ કપાસના પાન અને નમક સાથે ખાવું. (૫) સિંધણા ૨૦ ગ્રામ, હરડે દળ દ૧૦ ગ્રામ, પીપર ૪૦ ગ્રામ લઈ એનું ચૂર્ણ બનાવી તેમાંથી અટી ગ્રામ કે પાંચ ગ્રામ જેટલું રોજ સવારે લેવું અથવા જમતા પહેલાં એક કલાકે ઠંડા પાણીનો એક ગ્લાસ પીવો.

## ૮૩. લીમડો :

લીમડાના તેલનો ભાલિસ કરી સુવાથી મરણર કરડતા નથી.

માણસમાંથી દિવસે-દિવસે માણસાઈ જતી દેખાય છે.

#### ૮૪. મેલેરીયા આટકાવ :

ઘરમાં મર્યાદ મારવાની દવાનો છંટકાવ અથવા સૂકા લિમડાના પાન-ડાળી અથવા મૂળનો ધુમાડો ઘરમાં આપો. શક્ય હોય તો મર્યાદાનીનો ઉપયોગ કરવો. ઘરમાં તુલસીનો છોડ વાવવો.

#### ૮૫. મેલેરીયાની સારવાર :

ડોક્ટરની દવાથી બચો. જેવો રીપોર્ટ આવે કે મેલેરીયા છે અથવા કોઈપણ જાતનો તાવ હોય ત્યારે એક ગલાસ પોતાનો અથવા બીજા કોઈનો પેશાબ પીવાથી દર્દ આગળ વધતું બંધ થઈ જાય છે અને એકથી વધુ વાર (બે ચાર વખત) પીવાથી તો જળમૂળથી ગમે તેવો તાવ અથવા મેલેરીયા માંથી બહાર નીકળી જશો અને હરતા ફરતા થઈ જશો. ઓ ગોરંટી છે.

- પારકા ઘણીને પડાવી લેવાના પેતરા છોડી દે ! સિંહણા છું, સિંહણા... ફાડી ખાઈશ, હા ! ! !... પદમીની
- શું તમે તમારી જાતને છેતરો છો ? કે તમારી જાત તમોને છેતરે છે ? સરવાળો - બાદબાકી આખા વર્ષનો કરો તમારા કરમ તમોને દેખાય આવશે.
- કોઈના પણ આહબદ્યાં આંસુ કદી લેશો નહીં. નહીં તો તે તેજાબ બનીને જીવન બાગ ઉભાડી દેશે.

મૃત્યુ પણી જે રહે તે તમારી સંપત્તિ !

## ૮૬. શક્તિ વધે :

બીજોરાનો મુરળ્ખો ખાવ. બીજોરાનું શરબત પીવો. રીત : એક વાસણમાં પાણી નાંખી તેની ઉપર કપડું બાંધવું તે કપડા ઉપર છાલ કાઢેલા બીજોરાના કટકા મૂકવા. અને ચૂલે ચટાવવું પાણીની વરાળથી બીજોડું બફાશે. તેને સાકર (ખડી સાકરમાં) ભેળવી મુરળ્ખો બનાવી એજ રીતે બીજોરાને બાફી તેનો રસ કાઠવો તેમાં સાકર ભેળવી શરબત બનાવી શકાય.

## ૮૭. સીતાકુળ :

ઓગાસ્ટ - નવેમ્બરમાં ફળ આવે છે. આ તેની ખરી મોસમ ગણાય છે. આયુર્વેદ પ્રમાણે સીતાકુળ સ્વાદિષ્ટ અને મધુર, અતિ શીતળ, કફ અને વાયુવર્દ્ધક પિતશામક, વીર્ય વર્ધક, પોષિક, ઉલ્ટી રોકનાર, હૃદયને બળ આપનાર, માંસ અને લોહીને વધારનાર, મૈથુન શક્તિ વર્ધક તથા હૃદયના ધબકારાને નિયમિત કરનાર છે. એસિડિટી, અમલપિત, હાથપગાના તળિયામાં બળતરા, આંખો અને છાતીમાં બળતરા થતી હોય તેમણે રોજ રાત્રે એક પાડેલું સીતાકુળ છત ઉપર ઝાકળમાં મૂકવું અને બીજે દિવસે સવારે નરણાં કોઢે ખાઈ જવું. પિતની બધીજ તકલીફો શાંત થઈ જશે. વજન ન વધતું હોય તેના માટે સીતાકુળ ઘણું ઉતામ ફળ છે. શરીરની માંસપેશીઓ ક્ષીણ થઈ ગઈ હોય, શરીર પાતળું

અને કૃશ થઈ ગયું હોય, ટાઇફોઇન્ડ-મેલેરીયા જેવાં તાવ પછી વજન ઘટ્ટી ગયું હોય તો સીતાકુળનું સેવન કરો. અશક્તિ, રોગ પછી શરીર બિર્ભળ થઈ ગયું હોય, કામ કર્તા થાક લાગતો હોય તો સીતાકુળ ખાવ અશક્તિ દુર થઈ શક્તિ વધે છે.

#### ૮૮. સાધના અને સિહ્નિ :

દેવદોષ : ધંધો બરોબર ચાલતો હોય છતાં પણ સંતોષકારનઝો ન મળતો હોય તો ઓફિસમાં બેસવાનું મન થતું નહોય, ધંધાના સ્થળે મન અશાંત રહેતું હોય - શાંતી માટે ગણેશ અથવા દેવીની ઉપાસના કરવી. ઘરમાં ગણેશ કે દેવીની સ્થાપના કરી નિત્ય જપ આરતી, પાઠ કરવો.

૮૯. દાનવ દોષ : વ્યાપાર - ઉધોગમાં અનેક પ્રકારની ચડતી પડતી આવતી હોય, કુટુંબમાં સતત કંકાસ રહેતો હોય તો તેની શાંતી માટે ભગવાન વિષણુની ઉપાસના કરવી. સંપદ વ્યક્તિએ વિષણુ ભોગ કરાવવો. વિષણુમંત્ર 'ॐ નમો નારાયણા, ઽં નમો ભગવતે વાસુદેવાય, હરિ: શરણમ'ના જપ નારાયણ કવચનો પાઠ, કરવાથી દાનવદોષનું નિવારણ થાય છે.

૯૦. પ્રેત દોષ : ધંધા સાથે સંકળાયેલ ભાગીદારો, નોકરીમાં સાથીદારો સાથે ભતલેદો થતા હોય મશીન યંત્રોમાં ભાંગતૂટ થતી હોય તો વદપક્ષની ચૌદશના રોજ નવદુર્ગાનું પૂજન

વડીલ વગરનો સંસાર એટલે મીઠાશ વગરનો કંચાર.

કરી ચંડી પાઠ, દેવી મંત્રના જપ કરવા. સંપદ વ્યક્તિએ સુપાત્ર બ્રાહ્મણો દ્વારા નવચંડી કે શતચંડી પ્રયોગ કરાવવો. વિધિપૂર્વક દશ દિગ્પાળનું પૂજન કરી ક્ષેત્રપાળને મૈવેદ્ય ધરાવવું.

**૬૧. બ્રહ્મ દોષ :** આવક સારી હોય છતાં બિનજરૂરી ખર્ચાઓને મશીનરીની ભાંગતૂટ થતી હોય અને રિપેરીંગ પાઇલ ખર્ચા થતા હોય, અવારનવાર મશીનરી કે તેના પાટર્સ બદલવા પડતા હોય, કુબેર યંત્રનું પૂજન—અર્ચન તથા કુબેર મંત્રના જપ કરવા. કુબેરમંત્ર ધાર્થિક સામગ્રી વેચતી દુકાનેથી સરળતાથી મળી રહેશે. કુબેર મંત્ર : ઊં શ્રી ઊં હી કલી શ્રીકલી વિતેશ્વરાય નમ : કુબેર યંત્રને ઈશાન કોણ કે ઉત્તર દિશામાં જમીનની ચંદ્ર કે હિવાલ ઉપર સ્થાપીત કરવું.

**૬૨. કર્પદોષ :** ધંધાને રથળો આવતા મનમાં ખરાબ વિચારો આવતા હોય, કર્મચારીને અવારનવાર ઈજા થતી હોય, બીમાર પડતા હોય, કે કર્મચારીનું અકાળે મરણ થાય તો આ દોષમાંથી મુક્તિ.

**૬૩. દેશી મરી મસાલા :**

ઓષ્ઠધીય ગુણોથી સમૃદ્ધ છે. જેમાં જાયકળ, મેથી, આમલી, કોકમ, આદુ, હળદર વગેરે.

માણસ રૂપિયાને ઠગો છે કે રૂપિયો માણસને ?

કિંતામે

શવવરો.

મૈવેદ

અનોને

જર્ચર્યા

દલવા

નંત્રના

નેથી

કલી

અંતર

ધૂં.

બારો

બૈય,

તો

બી,

#### ૬૪. કીડની :

પેશાબ ઉભાવી રાખવાથી કીડની ફેલ્બ્યોર થવાના ચાંસીસ વધી જાય છે. ઉપચાર : ફક્ત હોમિયોપેથીક ઉપચાર કરો.

#### ૬૫. કેરડા :

અથાણા તરીકે વપરાતા કેરડા અકસ્મીર ઓષધ છે. વર્ષો અગાઉ કેરડાના અથાણાનું આગાવું મહિટપનું સ્થાન હતું. સૌરાષ્ટ્રમાં સુખી માણસો પણ કેરડાનું અથાણું ખાતા હોય છે. જે ગરીબો માટે વખણાય છે. કેરડાનું અથાણું ખાવાથી : સ્વાદમાં વધારો થાય, અઝચી દૂર થાય, પાચન સુધરે, બાત કફનો નાશ કરે, શરદીથી રક્ષણ આપે. આ ઉપરાંત હરસ, ફૂભિવિશ, શાસ, ઉછ્શ્રૂલ, આમદોષ અને ચામડીના રોગો સામે રક્ષણ આપે છે. કેવડાના મૂળ, પાન, ફળ અને છાલ ઓષધ તરીકે ઉપયોગ થાય છે.

#### ૬૬. પેટની ચરણી ઘટાડો :

ગ્રિફણાનો ૪૦ ગ્રામ જેટલો કાટો પીવો.

ઉકાળેલું પાણી ઠંડુ પાડીને મધ્ય નાંખી ચોજ સવારે પીવું. એક લીંબુનો રસ એક ગ્લાસ પાણીમાં ઉમેરી પીવાથી પખવાડીયામાં ફરક પડશે.

#### ૬૭. ઓઈડ્ઝર :

અકુદરતી (ગુદાદારા) સંભોગ કરવાથી મોટા ભાગે ઓઈડ્ઝર

આભવિશાસ છે, હારમાં પણ જુત છે.

થવાના ચાન્દીસ વધી જાય છે. તેનાથી દૂર રહો. હજુ સુધી તો એઈડ્રઝની દવા શોધાણી નથી. પરંતુ મેં એક ભજદૂર ઉપર પેશાબનો પ્રયોગ આખા દિવસમાં થાય તેટલો અથવા જીજ કોઇનો પણ પી શકાય તેટલાનો પ્રયોગથી તેણે ફરી એઈડ્રઝના દિપોર્ટ કટાવતાં એઈડ્રઝ નથી તેવો ટિપોર્ટ આવેલ છે. પેશાબથી ભલભલા રોગો મટી જાય છે તે ભૂલશો નહીં.

#### ૬૮. પેશાબમાં રેતી :

ધણાને પેશાબમાં રેતી વહે છે, એટલે કે પથરી થઈ હોય તે ધીમે-ધીમે નીકળે છે. તે માટે તરબૂચની લીલી અથળા સૂકી છાલની ચા રોજ બે વખત પીવાથી થતો દુખાવો મટે છે. પેશાબ સારી રીતે છૂટે છે અને પથરી ધોવાઈ ને નિકળી જાય છે.

#### ૬૯. જખમથી સોજા :

સોજા ઉતારવા ઠંડા પાણીના પોતાં મૂકવા. સરકો, જવ, ભગા, કપાસીયાના લોટ સાથે પાણી મેળવી લેપ કરવો. પીપર અને સુંઠ સરખે ભાગો મેળવી તેમાંથી પાંચ ગ્રામ ચૂર્ણ લઈ ગોળ સાથે પાંચ ગ્રામ ફાકી લઈ તેની ઉપર દૂધ પીવું.

#### ૧૦૦. ડેલ્યુય :

ધરની આજુ બાજુ - ધરમાં તથા આજુબાજુમાં ગંદકીથી ઉત્પન્ન થતો કચરો - ખાડા - પાણી ભરેલા પાગ્રોથી થાય છે. પાણી ભરેલા પાગ્રોને હવાચુંસ્ત ટાંકણા રાખવા. ધરમાં કચરો

 સરકાર આઈ.સી.યુ.માં એટલે દેશ દેવામાં!

કાટી નાંખવો જોઈએ. ધરના બારણાં સંદ્યા સમયે બંધ  
રાખવા, સવારે અને સાંજે ધરમાં કડવો લીમડો, ગુગળ, લોભાનનો  
ઘુમાડો કરવો. ડેંગ્યુ તાવ મેડીસ નામના મચ્છરથી ફેલાતો અને  
વાયરસથી થતો રોગ છે. ડેંગ્યુના લક્ષણોમાં તાવ, માથુ, દુઃખવું,  
શરીરમાં સતત દુઃખવો જે ડેંગ્યુ તાવના લક્ષણો છે.

#### ૧૦૧. દ્વાન આપો :

- (૧) જમતી વખતે ઉતાવળ ન કરી એક સાથે વધારે ન જમો.
- (૨) નિરાંતે જમો ખૂબ ચાવીને જમો. તમો જે ખાઓ છો  
એનાથી તમારું પેટ ભરાય જાય તે બાબતની તમારા મગજને  
૨૦ મિનિટે ખબર પડે છે. ઝડપથી જમવાથી તમે વધારે  
જમી લેશો જેને સંતૃપ્તિ (સેટાઈટી) અથવા પેટ ભરાઈ ગયું  
તેવી લાગણી થાય તે માટે ધીરે ધીરે જમો. એક કોળીયો  
મોંબાં મુકો પછી તેને ચાવતી વખતે તેનો સ્વાદ અનુભવો.

#### ૧૦૨. ધરમાંથી જીવજંતુઓની છૂટી કરો :

- (૧) પેસ્ટ કંન્ટ્રોલ કરાવો.
- (૨) કીડીઓ હોય તો તમારું કીચન હંમેશા સાફ રાખો.  
અઠવાડિયામાં એકાદ વખત કેરોસીનવાળા પાણીથી પોતા  
કરો.
- (૩) ગારોળી હોય તો તમારા ધરના ખૂણાઓમાં ઈંડાના ફોતરા  
રાખો.

શક્તા છે તો દેશી દવા અપનાવો.

(૪) મરણર ભગાડવા માટે લીંમડો, તુલસીના પાંડા પોતાના ઘરની આસાપાસ પાથરવા અથવા લીંમડાના પાન-મૂળ કે ડાળનો ધૂમાડો કરવો. અથવા સૂક્કાયેલ નાળીયેરની છાલ સળગાવી ધૂમાડાયી મરણર સાથે અન્ય ફૂદા પણ ભાગી જશો.

### ૧૦૩. દાંત :

તમારી ઉંમર ૫૦-૬૦ ની થાય એટલે દાંતના ડોક્ટરને બતાવવું. કોઈ સડો છે કે નહીં તેનો ખ્યાલ આવે. રોજ બે વખત સારી પેસ્ટથી બ્રશ કરો. બ્રશ દાંતની ઉપર નીચે ધસો જેથી ખાવાનું કાંઈ ભરાઈ ગયું હોય તે નિકળી જાય. કાંઈ પણ ખાદ્યા પથી નમક (મીઠું)ના કોગળા કરવાથી ૮૦ વર્ષ પણ દાંત સડશે નહીં. જમ્યા પણી કે કોઈ પ્રવાહી ચા-કોફી-કોલર્ડીક્સ કે જથુશ પીધ્યા પણી બે-ગ્રાના વખત કોગળા ન કરો તો તમારા દાંતમાં કેવીટી પડે છે. ખોરાક કે પ્રવાહીની ચીકાશ અને મીઠાશ દાંતની પાછળ ચોટી જશો અને બેકટેરીયા કેવીટી પાકશે અને કેવીટી ઉત્પન્ન થશે.

### ૧૦૪. અજમાવી જુઓ :

- (૧) લીંબુને લાંબા સમય સુધી તાજા રાખવા કોપરેલ લગાડી કિજામાં રાખવા.
- (૨) એર્ટિલિયામાં કપૂર ભેણવી સવાર સાંજ પેટા ઉપર લગાડવાથી પેટાના રોગામાં ફાયદો થાય છે.

તંદુરસ્ત-સુંદરતાની નહીં, બુદ્ધિશાળીની દોષ્ટી કરો.

- (૩) ચાકુને થોડું તપાવી કાંદા કાપવાથી આંખમાં પાણી નહીં આવે.
- (૪) માર વાગે કે ભોય આવે તો હળદર, પાણી તથા ચુનો બેળવી તે સ્થાને લેપ કરવાથી તુરત જ આરામ મળે છે. આ લેપ લગાડવાની સાથે સાથે એક કપ ગરમ દૂધમાં હળદર બેળવીને પીવાથી તલ્કાળ રાહ્ત થાય છે. દુખાવો, સોજ માટે આ પ્રતિરોધક દવા છે.
- (૫) ગોસ આફરાથી રાહ્ત પામવા મીઠું તથા કાળા મરીનો ભૂકો ભભરાવેલું જમઝખ ખાવું.
- (૬) ખીરાના રસમાં ચપટી હળદર તથા લીંબુનો થોડો રસ બેળવી ચહેરા પર લગાડવાથી ત્વચા નિખરે છે.
- (૭) ચાર ચમચા ખીરાના રસમાં બે ચમચા મુલતાની માટી તથા વાટેલી બદામ બેળવી ચહેરા પર ૨૦ મિનિટ લગાડી રાખવાથી કરચલી દૂર થાય છે તેમજ ત્વચા મુલાયમ તથા ચમકદાર થાય છે.
- (૮) ખીરા, ફૂદીના તથા તુલસીનો રસ બેળવી રથી નિયમિત ચહેરો સાફ કરવાથી ખીલ દૂર થાય છે. તથા ચહેરા પર કોઈ પણ પ્રકારના ડાઢા-ધાબા રહેતા નથી.
- (૯) તેલની કડાઈમાં ચપટી મીઠું ભભરાવવાથી ફીણાનો ઊભરો શાખી જશે.

નિવૃત્તિ પછીની વચ્ચે એ પ્રભુનું પેન્શન છે.

(૧૦) કાચા ગાજર ખાવાથી જડભાનો વ્યાયામ થાય છે. સલાડમાં ગાજર ઉમેરીને ખાવાથી ઘણા ફાયદા થાય છે. ગાજર પેટને સાફ કરે છે, હીમોગ્લોબીનનું પ્રમાણ વધારે છે તેમજ રક્તને શુદ્ધ કરે છે. તેમાં હૃદય ઉપયારક ગુણ છે.

(૧૧) પાનમાં પાકી સોપારી તથા જેઠીમદ્ય નાખી ખાવાથી મન પર સારી અસર પડે છે.

#### ૧૦૫. વીજળી :

વીજળીની લાઈન ૭ દિવસની નોટિસ આપ્યા વગર કાપી શકતા નથી છતાં કાપી નાખે તો ફોરમમાં કેશ કરી વળતર (ડેમેજ) મળી શકે છે.

#### ૧૦૬. મોબાઇલ ટાવર :

મોબાઇલના ટાવરમાંથી નીકળતું રેડિયોશન આરોગ્ય માટે ખતરનાક છે. ઘરની આસપાસ ૫૦ થી ૧૦૦ મિટર ટાવર હોય તો કેન્સર, અનિંત્રા, માથાનો દુખાવો, એકાગ્રતાનો અભાવ, થાક, સાંધાનો દુઃખાવો, માથામાં કે મગાજમાં સોજો ચડવો, ખંજવાળ, બેચેની, દષ્ટીની ખામી વગેરે સમસ્યા થવાનો મોટો ખતરો રહે છે. નાના બાળકોને આ બધી સમસ્યાઓ વધુ ઝડપથી થાય છે. આઈ.આઈ.ટી.ના પ્રોફેસરના કહેવા મુજબ સોલફોન ટાવરની આસપાસના ૫૦ થી ૧૦૦ મિટર વિસ્તારમાં રહેવું એટલે છ કલાક માઈકોવેવ ઓવનમાં રહેવું. આ જ રીતે મોબાઇલને પોતાની ઝમાં રાત્રે રાખવો નહીં.

સત્યમેવ જયતે, પરંતુ 'સત્ય' એટલે શું ?

## ૧૦૭. અજુર્ણા :

અજુર્ણા થવાના અનેક કારણો છે જે ખોરાક ખાધો હોય તેનું અજુર્ણા થાય અને તેને મટાડવા વિવિધ પ્રયોગો છે.

(૧) કેરીનું અજુર્ણા થાય તો સૂંઠ ખાવાથી દૂર થાય છે. અખરોટ ખાવાથી અજુર્ણા થાય તો અંજુર ખાવા. પાકી કેરી ખાવાથી પુષ્કળ જાડા થાય ત્યારે કેરીના ગોટલા શેકી અંદરની ગોટલી ખાવાથી પણ જાડા બંધ થાય છે.

## ૧૦૮. કાનમાં બારીકીડા :

કાનમાં કીડા થયા હોય તો મીઠી ગલોડી પાનનો રસ અને ચોખા જેટલી હિંગા મેળવી કાનમાં નાખવું અને ઇ કાનમાં મૂકવું. આથી કીડા ઇ ઉપર તરી આવશે અથવા મરી જશે. આ કીડા મેલ થઈને બહાર આવશે. કાનમાં કીડા ન હોય તે જો રસ નાખવામાં આવે તો પણ કોઈ નુકશાન થતું નથી. આ ઉપરાંત ગલોડી અને આંબાના પાનનો રસ કાનમાં નાખવો.

## ૧૦૯. શ્રી ગણપતિબાપા :

શ્રી ગણપતિના પૂજન વગાર દેવતા પદ્ધારતા નથી તેતો આપ જાણતાં જ હશો અને એટલા માટે જ આપણે કોઈ શુભ કાર્ય કરતા પહેલા ગણપતિની પૂજા - ગણપતિની સ્થાપના કરતા હોઈએ છીએ. શ્રી ગણપતિની આજ્ઞા વગાર કોઈ દિશામાંથી કોઈપણ દેવતાનું આહન થઈ શકતું નથી.

શ્રી ગણેશજુને પ્રસક્ત કરવા (૧) ગણપત્યેય નમઃ ના જાપ કરો. (૨) ગણેશજુને ભગા, ગોળ અને જસ્તૂદનું ફૂલ ચડાવવાથી સમૃદ્ધિ આવે છે. (૩) દેવું વધી ગયું હોય તો રોજ ગણેશસોતના પાર્ક કરવા. (૪) જીવનની પહેલી જરૂરીયાત ધન છે. એની પ્રાપ્તિ માટે ગણપતિ અષ્ટોતર નામાવલી અને શ્રી ગણપતિ સોતના પાઠ નિયમિત કરવા. (૫) જીવનમાં સંકટ આવતાં હોય તો રોજ સંકટનાશક ગણેશસોતનો પાઠ કરવો. (૬) ગણેશજુની મૂર્તિ બે રૂપમાં ભળે છે. ડાબી સૂટવાળા અને જમણી સૂટવાળા જમણી સૂટવાળી પ્રતિમા ગણેશજુનું તંત્રોક્તૃપ છે. એની પૂજા રોજ કરવી. આવી પ્રતિમા ઘર ઓફિસ કે દુકાન વગેરેમાં હોય તો એની નિયમિત પૂજા કરવી. (૭) ગણેશજુ પર તુલસી ન ચડાવાય. (૮) જો કોઈ વ્યક્તિ તમને વધુ હેરાન કરતી હોય તો ૪૦૦૦ ધતુરાના ફૂલ ગણેશજુને અર્પણ કરો. એનાથી હેરાન કરનાર વ્યક્તિ તમારી અનુકૂળ થઈ જશે. (૯) લગ્નમાં અડચણ આવતી હોય તો છણદર અને ચોખાથી ગણપતિનું પૂજન કરવાથી વરને કન્યા અને કન્યાને વરની પ્રાપ્તિ થાય છે.

#### ૧૧૦. સારણાંઠ :

પેટમાં ગડગાડાટ થાય, કબજિયાત, મંદાગિન કે વાયુની ફરિયાદ થાય, વૃષણાના કદમ્બાં ફેરફાર થાય તો સમજાવું કે સારણાંઠ થઈ છે. આમાં વૃષણમાં આંકડાનો ભાગ વાયુ વડે નીચે ઉત્તરવાથી થાય છે. વધુ પડતી ખાસી કે શ્રમ આખો દિવસ ઉભા રહેવા કે બેઠા રહેવાથી સતત વિરેયરનો લેવાથી થાય છે.

તમારા ખોટા વખાણ કરનારથી ચેતજો.

## ૧૧૧. દાંત - રૂટકેનાલ :

દાંતમાં સડો પડે ત્યારે સડો કાઢી નાંખી તે દાંતમાં સીમેન્ટ ભરી દઈ દાંત બચાવી લેવાય છે.

દાંતને પોષણ કરવા રોજ ૮૦૦ થી ૧૨૦૦ ગ્રામ કેળુંયમ લેવું જરૂરી છે. અને તેના માટે ખોરાક પણી ગમે તે હોય ખૂબ ચાવી-ચાવી ખાવો. કાચા શાકભાજુ (સલાડુઝ) કાકડી, ગાજર, મૂળા, ટમેટા, બીટ, કોબી, સારી રીતે સમારી મરી મસાલા નાંખી ૧૫૦ થી ૨૦૦ ગ્રામ રોજ ચાવી-ચાવી ખાવું. તમારા દાંત હંમેશા મજબૂત રહેશે. દાંતમાં દુર્ગંધ માટે રોજ જ્યારે જ્યારે કાંઈ ખાવ ત્યારે નમકથી અથવા કોઈ સારી પેસ્ટથી દાંત સાફ કરો. જુબને ઉલીયાથી સાફ કરો. બજારમાં મળતું દાંત સફેદ કરવાનું સોલ્યુશન વાપરશો નહીં. કારણ દાંત ઉપરનું એનેમલ નિકળી જશો. ગરમ પાણીના કોગળા કરો. દાંતને કસરત મળે માટે ખૂબ ચાવી ચાવી ખાવું. નિયમિત કસરતથી દાંતની સાથે ખોટી છેડ-છાડ નહીં કરવાથી દાંત આખી જિંદગી તંદુરસ્ત રહેશે.

## ૧૧૨. સફેદ પાણી :

ચીઓ ઘરમાં બેસી રહેતી હોય કોઈ કામ ન કરતી હોય તેને સફેદ પાણી પડે છે. ઉપાયમાં પં ગ્રામ કેસર, માખણ અને ખડી સાકર મેળવીને ખાવું. સાથે સાથે ઉંબરાના ફળનું ચૂર્ણ માખણ સાથે ખાવ. ફટકડી ગ્રણ માપ, ફટકડી ગોરચંદન એક

મસો ને બે કોડિયામાં મૂકી બાફી બનાવવું તે ચૂર્ણ ચણોઠી ભાર સાકર સાથે લેવું. વડની લીલી છાલ પાંચ ગ્રામ મધ્ય સાથે રોજ બે વખત લેવી.

#### ૧૧૩. મરડો :

ઝીણી હરડે દિવેલમાં તળીને એકબાગ કાચી હરડે સાથે મેળવી તેમાંથી પાંચ ગ્રામ જેટલું ચૂર્ણ કે તેથી વધુ ખાવું. ખડી સાકર ૩૦ થી ૪૦ ગ્રામ જેટલી ખાવાથી પણ રાહિત થાય છે. પેટું ઉપર રાયનું પ્લાસ્ટર કરો. સુવાનું ચૂર્ણ ૧૦૦ ગ્રામ અને ૫૦૦ ગ્રામ ઘઉનો મેંદો મેળવી તેની રોટલી બનાવી ગ્રાણીથી સાત દિવસ ખાવી.

#### ૧૧૪. ચામડી ફાટે :

વડનું દૂધ લગાડો. અંજુરના પાનની રાખ મસળવું. શરીરે ચચકા મારે ત્યારે ખેંચતાણ થાય તો ભોરીગાણનો ધૂમાડો શરીર પર લેવો. થંડી ભરાય તો કટોરાનું પાણી પીવું.

#### ૧૧૫. માથુ દુખવું :

ફક્ત વિકસ લગાડો. વધુ દુખતું હોય તો સુંઠનું ગારમ પાણી પીવું. વધુ પડતી શરદી થઈ હોય તો સુંઠ પાણીમાં નાખી પાણી બાળી ગાળી તેનો લોંદો માથામાં પાથીઓ પાથીઓ લગાડો. સુંઠ કેસર અને ખડી સાકર ધીમાં મેળવીને સુંધવું.

## ૧૧૬. અજમાવી જુઆ૦ :

- રવાને શેકીને રેફિઝરેટરમાં રાખવાથી ઉપમાં હલવો ફટાફટ બનશે.
- અર્થાં સતાવતી હોય તો રોજ સવારે પપૈયું ખાવું.
- કબજિયાત દૂર કરવા પપૈયું ખાઈને દૂધ પીવું.
- નિયમિત મૂળા ખાવાથી ત્વચા નિખરે છે.
- મૂળા પર મીહું-લીંબુ ભભરાવીને ખાવાથી કબજિયાતથી રાહત થાય છે.
- ભાયાના દુખાવામાંથી છૂટકારો મેળવવા ધાણાનો લેપ કરવો.
- ધાણાને વાટીને સોજા પર લગાડવાથી સોજો ઉતરે છે.
- સ્વાદિષ્ટ દાળ બનાવવા એક કપ દાળમાં ઓછામાં ઓછું બે થી ત્રણ કપ પાણી ઉમેરવું.
- ફટકડીનો ભૂકો તથા મીહુંના ભિશણથી કોઈક-કોઈક વખત દાંત સાફ કરવાથી લાભદાયક છે.
- સફરજન ખૂબજ ચાવી ચાવી છાલ સાથે ખાવાથી દાંત તથા પેટા માટે ફાયદાકારક છે.
- દહીવડા બનાવવા માટે વાટેલી દાળને ફીણતી વખતે તેમાં થોડો બેંકિંગ પાઉડર અથવા તો ખાવાના સોડા ઉમેરવાથી વડા ફૂલેલા તથા મુલાયમ બનશે.

પૈસાના જોડે મળેલ આશીર્વાદ એ આશીર્વાદ નથી.

- માથાનો દુખાવો બંધ કરવા માટે સર્જન મીહું ભભરાવીને નયણે કોઠે ખાવું.
- ચરબીના થળ ઓછા કરવા માટે મૂળા મીહું ભભરાવી નિયમિત ખાવા.
- નસકોરી ફૂટવા પર કોથમીરનાં બેટીપા રસ નાકમાં નાખવાથી રક્ત નીકળતું બંધ થાય છે.
- ચહેરો ઉજળો કરવા માટે કેળા મસળીને ચહેરા પર લગાડવું અને ૧૦ મિનિટ બાદ ચહેરો હુફ્ફાળા પાણીથી ધોઈ નાખવો.

#### ૧૧૭. રક્તપિત્ત :

શરીરના કોઈ પણ ભાગ ઉપર કાળી છાંટ પડે, ગાંઢ બંધાય તો સમજવું કે લોહી બગડ્યું છે. પિતાનો ભાગ વધ્યો હોય તો એ માટે જીરું અને સુર્યમુખી દરેક અઢી ગ્રામ લઈ ૧૦૦ ગ્રામ પાણીમાં એક રાત ભીજવી સવારે તેને ચોળી, ગાળીને રોજ પીવું. સુખડ અને રતાંજલી પાણીમાં ઘસીને છાતી પર અને તેના નીચેના ભાગ ઉપર લગાડી પિત ઓછું કરી શકાય છે. ડીકામરીના પાનનો રસ પાંચ ગ્રામ જેટલો લઈ રોજ પીવું.

#### ૧૧૮. માથાનો દુખાવો :

(૧) ત્રિફળાનું ચૂર્ણ ૫૦ ગ્રામ મધ્ય સાથે લેવું. (૨) પિતાના માથાના દુખાવા માટે તકમરીયાનો લુઆળ સાકર સાથે આપવો.

બોળા માણસો જીવનમાં હોકરો કેમ સહન કરે છે ?

(૩) કોઈપણ જાતના ભાથાના દુખાવા માટે જેઠીમધ્ય ૪ વાલ, વછનાગ એક વાલનું ચૂર્ણ એક રતી સુંધવું. (૪) દસ વર્ષથી યાલતો ભાથાનો દુખાવો ભટાડવા કનેરની કળી, ૨૦ ગ્રામ ભીલામુ, ૧૦ ગ્રામ વછનાગ અઢી ગ્રામ, તેલ ૫૦૦ ગ્રામ લઈ તેનું તેલ બનાવી સાત દિવસ લગાડવું.

- બાળકનું પેટ ચાઢે ત્યારે એલચી, ધાણા, વાયવરણો, આખરો? અને કૃદીનો સાથે લેવાથી સારો ફાયદો થાય છે.

#### ૧૧૬. મસા :

- (૧) ધાણાને વાટીને લેપ કરવો.
- (૨) ચુનો અને સાજુખાર પાણીમાં વાટી ચોપડવું.
- (૩) આંકડાનું દૂધ લગાડવાથી મસો બળી જશે.
- ઊંઘની ગોળી લેવાથી મૃત્યુનું જોખમ વધી જાય છે. ભારે કાયા અને મેદસ્વી લોકો ઊંઘની ગોળી લે તો મૃત્યુનું જોખમ વધી જાય છે.

#### ૧૨૦. નાસુર અને ભર્ખંડર :

સુંઠ, સરસવ, સારોડી અને સરગળાના મૂળની છાલ અને છાશની જાડી પોટિસ બનાવી તેના ઉપર મૂકો – નાસુર ફાટી જશે.

#### ૧૨૧. આમવાયુ :

આમવાયુ થાય ત્યારે મેથીને શેકી ભૂકો કરી તેનું પાંચ ગ્રામ જેટલું ચૂર્ણ દહીમાં મેળવી ખાવું. આમવાત થાય ત્યારે આંકડાના

ગ્રીઝની ગરમીમાં ગુલાબને યાદ કરો.

મૂળની છાલનું ચૂર્ણ દોઠ માસો ખડી સાકર સાથે મેળવી ગણ વાર ખવરાવવું આ ઉપરાંત ગળો સુટ અને તેલ મેળવીને ખાવ. લોહી સાથે થતાં અતિસારમાં બોરડીની છાલ દૂધમાં ઘર્સી મધ્ય સાથે પીવી. કડાછાલ પણ અટી ગ્રામ ખાવામાં લેવી.

### ૧૨૨. પૂરુષાતન વધે :

પૂરુષોમાં ક્યારેક શક્તિનો અભાવ જોવા મળે છે. આવા પૂરુષોએ પોતાની યાદશક્તિ વધારવા, લક્ષ્યમાં ફાયદો કરવા, સગાર્ભ સીઓની ઉલ્ટી મટાડવા માટે ઝેર કોચલા ઉત્તમ છે. આ ઝેર કોચલાને શુદ્ધ કરવા સાત દિવસ ગૌમૃતમાં બોળી રાખી ઉપરથી છાલ કાઢી તેના ઉફ્રણ ધીનો હાથ લગાડી ગરમ કરી ચૂર્ણ બનાવવું. તેમાં સરખે ભાગે મરી મેળવી સવાર સાંજ અડધી થી એક ચમચી જેટલું સાત દિવસ ખાવું.

### ૧૨૩. પાચનશક્તિ વધારવા :

પાચનશક્તિ નબળી પડતાં ખાવાની રૂચિ થતી નથી. આવા સમયે ભૂખ લગાડે તેવી વનરૂપતીઓનો ઉપયોગ કરવાથી એ સમસ્યા દૂર થઈ જાય છે. ક્યારેક માંદગી બાદ ખોરાકમાં મગ ખાવાની સલાહ આપવામાં આવે છે. તેનું પાણી નબળા માણસને પીવા અપાય છે. આનાથી ધીરેધીરે પાચન શક્તિ સુધરે છે. આ ઉપરાંત ઉંદરકાનીના પાનનું દૂધ ખાવાથી પણ ખોરાકનું બરાબર પાયન થાય છે અને ભૂખ ઉધાડે છે.

ઇન્ટરનેટ પર લાલચુ ઓફરથી ચેતજો !

## ૧૨૪. અજમાંથી જુઓ :

- ગરમ ચીજ ખાવાથી જુબ બળી જાય તો ઠંડા દૂધના થોડા દૂધના મોટાભાં બે મિનિટ ફેરવવા.
- ફળોને તાજા રાખવા રેફિજરેટરમાં ન રાખતા કાગળમાં લપેટીને બહાર રાખવા.
- ભાથાનો દુખાવો મટાડવા આદુનો કાચો ટૂકડો ચાવવો.
- ભજુયા બનાવતા સોડા નાખવા નહીં. મકાઈના ગાંધાં અધકચરા વાટી તેમાં જીએટી સમારેલી પાલક, કાંદાભાં ચણાનો લોટ તેમજ જોઈતો મસાલો નાખી કરક ભજિયા કરવા. ચણાનો લોટ જોયતા પ્રમાણભાંજ લેવો તેમજ પાણી બહુ નાખવું નહીં. આ મિશ્રણ અન્ય ભજિયાના મિશ્રણ કરતા સૂકુ હોવું જોઈએ તેમજ થાળીભાં બનાવવું. ગરમ-ગરમ લેલનું મોણ સરખું નાખવું.
- સ્ટીમ અથવા સોનાબાય શારીરને તાજગી પ્રદાન કરે છે. તેમજ શારીર છણવું ફૂલ થઈ જાય છે.
- હોઠ પર નિયમિત મલાઈ લગાડવાથી હોઠ નરમ તથા મુલાયમ રહે છે.
- કોબી ફુલાવર ને સાફ કરવા હુંકારા પાણીભાં મીઠું મેળવી થોડી વાર પલાળી રાખવાથી તેમાં જીવાત હશે તે બહાર નિકળી જશે.

સ્વાભિમાન રાખો, અભિમાન નહીં.

- પેટમાં ગોસને કારણે દુખાવો થાય તો આદુ અને ફૂદીનાના રસમાં થોડું સિંધણ બેળવી પીવું.

#### ૧૨૫. આધાશીશી :

આરીઠાને પાણીમાં વાટી તેનો નાસ લેવો અથવા ગાજરના પાનને વાટી સુંઘવાથી આધાશીશી ભટે છે. અથવા બદામના તેલમાં કેસર બેળવી સુંઘળી અથવા લીમડાના પાન, કાળામરી તથા ચોખા લગાભગ ૩૦-૩૦ નંગા લઈ વાટવા અને આ પાઉડરનો નાસ લેવો.

આધાશીશી ઓટલે અડધું અથવા એક તરફનું માથું દુઃખવું. સખત દુખાવો થાય ત્યારે આરીઠાના પાણીનું ટીપું નાકમાં મૂકવું.

હિંગ એક વાલ એને નગોડાના પાન ૧૦ ગ્રામ, અટી ગ્રામ પાણીમાં વાટી તેના ટીપાં નાકમાં નાંખવા.

આના છલાજમાં આકડાનું ફુમળું પાન લઈ તે ઉપર ગાયનું ધી લગાવી તેને અંગારા ઉપર મુકી સહેજ ગરમ કરવું. ત્યાર બાદ તેને મસળવું. તેની ચટણી કપડામાં મુકવી અને તેના ચાર ટીપાં નાકમાં નાંખવા, નાકમાં સહેજ અગન બળશે અને નાકમાંથી કષ પડશે. અન્ય એક ઉપાયમાં પારસ ભીડીના ડીડવા પાણીમાં ઘસી માથા ઉપર લગાડવા. અથવા ચાની પટી, પાણીમાં નાંખી ખૂબ ઉકાળો તેને નીચે ઉતારી નાસ લેતી વખતે તેમાં જથી દ ટીપાં ટીંથર-આચોડીનના અને એક ચમચી વિકસ નાંખી સારી એવી નાસ લો.

સમયના વહેણ મુજબ રહેનાર સફળ થાય છે.

ગીનાના જરના તેલમાં ચોખા લેવો. :ખવું. મુક્કવું. ગ્રામ વાયનું ત્વાર ચાર માંથી શીમાં નાંખી ટીપાં એવી

- (૧) આધાશીશી એટલે માઈગ્રેન એના અનેક દેશી ઉપયારો છે. જ્યારે પણ આધાશીશી હોય ત્યારે ચણોઠીના મૂળને પાણીમાં ઘસીને જે બાજુએ દુઃખતું હોય તે બાજુના નસકોરામાં સુંઘવું. ત્રણ દિવસ સુધી પ્રયોગ કરવો.
- (૨) ગળોનો રસ રૂપ ગ્રામ જેટલો લઈ મધ્ય ૧૦ ગ્રામ મેળવી રોજ સવારે ખાવું.
- (૩) ગરણીનાં મૂળને પાણીમાં ઘસી તેના પાંચ ટીપાં નાકમાં નાખવા.
- (૪) તેલનો ખોળ વાવડિંગ અને પાણી સાથે લેપ છરી માથે લગાડવો.
- (૫) ૧૦ દિવસ નાહ લેવી જેમાં ચાની પર્ટી પાણીમાં નાખી ખૂબ ઉકાળી તેને નીચે ઉતારી ૧ ચમચી વિકસ અને ૪-૫ ટીપા ટીન્યાર આચોડિનના નાખી નાહ લેવી. જડમૂળથી નીકળી જશો. આધાશીશી થવાનું કારણ છે વધુ પડતી શરદી જે ભાથા સુધી ચડી ગઈ છે.
- માઈગ્રેન (આધાશીશી)નું દર્દ માથાના અડધા ભાગમાં થાય ત્યારે ભાથું પણાડવાનું મન થાય એ આધાશીશી. આધાશીશી થવાના કારણો : ભૂખાં પેટે રહેવું, ટાટ, હંડા પીણા કે હંડા પવન કે તડકાથી, ઉલ્જારાં, માનસિક આધાત, શરદી, સાયનસ,

માં-બાપના હૈયા બાળશો તો તમારા પુણ્ય પૂરા થયા જામજો.

દુષ્પિરોધ, માનસિક રોગ, મગજની ગાંઠ, કેન્સર, ડાયાબિટીસમાં શર્કરાનો વદારો, મગજનો સોજો, મર્સિટિઝના રક્તવાહિનીઓના સંકોચ આવા ઘણાં કારણો છે. જે સીઓને વધુ જોવા મળે છે. આધાશીશીની ઘણી દવાઓ છે. એમાંની ખોટા ભાગની દવાની અસર થતી નથી. મને પોતાને એક સમયે આધાશીશી હતી. મેં નીચેનો પ્રયોગ કર્યો અને આધાશીશી કાયમી મટી ગઈ છે.

**પ્રયોગ :** નાહ એક તપેલીમાં ૪-૬ ગ્લાસ પાણીમાં બે ચમચી ચાની પટી નાંખી ખૂબ ઉકાળવું. પછી નીચે ઉતારી તેમાં ટીવચર આયોડિનના ૪-૫ ટીપાં એ ગરમ પાણીમાં નાખવા અને એક ચમચી વિકસ નાખી સારી એવી ચાંદ નાખી ૮-૧૦ દિવસ આ પ્રયોગ કરવાથી આધાશીશી કાયમી મટી જશે.

#### ૧૨૬. કાળા વાળ :

અનેક ટેન્શનથી વાળ બચપણથી જ ધોળા થવા લાગે છે અને કાળા કરવા માટે અનેક લોશન વાપરતાં થઈ ગયા છે. જેમાં રસાયણી ભેળસેળ હોય છે, તેથી ચાંખના નંબર વધવા, મોતીયા જલ્દી આવવો, મગજમાં ગાંઠો થવી વગેરેથી બચવા તેલમાં તળેલા અંબળા આઠ ભાગ, સૂકૂ કોપચ ચાર ભાગ, કપૂરકાચલી કચોરો, ચુગંધીવાળો, મોથ, અગાર, તગાર, ચુખડ, ગુલાબની કળી દરેક ૧૦ ગ્રામ લઈ તેને પાણીમાં ભીજવી વાળ ઉપર લગાડો. થોડા દિવસોમાં વાળ કાળા થઈ જશે.

બાળકો ઈન્ટરનેટ ઉપર બેસે ત્યારે તપાસો.

જાયફળ દરેક બે આનીભાર મેળવીને દસ્તાન દેખાય તે દિવસથી ચાર દિવસ સુધી રોજ એકવાર લેવું. ગર્ભધારણ થયા પછી બાળક પડી જતું હોય (મિસ કેરેટ) તો ગાઈના તાજા છાણમાં ૧ લોટો પાણી નાંખી તેની પરાશ કાઢી બે દિવસના અંતરે ૪-૫ વખત આપવાથી બાળકને પડી જવાના (મિસ કેરેટ) થવાના ૬૬% ચાંસ નીકળી જશે અને બાળક તંદુરસ્ત જન્મશે.

### ૧૩૦. ભીઠો પેશાબ :

ભીઠો પેશાબ થાય ત્યારે વડના ગાડની અંતરણાલ ૪૦ ગ્રામ લઈ તેને ૫૦૦ગ્રામ પામીમાં ઉકાળી માત્ર ૧૦૦ ગ્રામ જેટલું રહે ત્યારે તેને પીવું. ભીઠાને પાણી સાથે મેળવીને પીવાથી પણ પેશાબ ઓછો થાય છે. ડાયાબિટિસવાળી વ્યક્તિએ ભીઠાનો પ્રયોગ ન કરવા વિનંતી છે. ભીઠા પેશાબ માટે લાલ એરેંડિયાના મૂળ ૨૦ ગ્રામ, ધાણા ૨૦ ગ્રામ અને પાણી ૪૦૦ ગ્રામ લઈ તેને ઉકાળી માત્ર ૫૦ ગ્રામ જેટલું દ્રાવણ બાકી રહે ત્યારે રોજ સવારે નરણો કોઢે પીવું. લીમડાની છાલનો ઉકાળો રોજ મધ્ય સાથે પીવો.

### ૧૩૧. બરોળ :

બરોળ ડાબી બાજુની પાંસળી નીચે હોય છે. ક્યારેક બરોળમાં કોઈ તકલીફ ઊભી થાય ત્યારે ચેવલીના પાન સાથે ફૂલાવેલો ટંકણાખાર ખવડાવવાથી એની તકલીફ ભટે છે અથવા કનેરના મૂળની છાલ ચપટી વાટી રોજ શરબત બનાવી પીવાથી

સથી  
પછી  
નાં ૧  
૪-૫  
૮૮%  
૪૦  
શ્રીલુણ  
એ  
ગ  
૨૦  
ની  
બે

બરોળ સારી થાય છે. અથવા દ્રાવણ બરોબર બરોળ ઉપર લગાડી શકાય છે.

### ૧૩૨. જીવજંતુનો નાશ :

ચોમાસું હોય એટલે જીવજંતુનો ઉપદ્રવ વધશે. પાણીજન્ય રોગો પણ આ જીવજંતુના કરડવાથી ફેલાશે. એટલે જીવજંતુ મારવા કીડામારીના પાનનો રસ જ્યાં ત્યાં લગાડવાથી ત્યાં માખી કે જીવજંતુઓ આવશે નહીં. આ પાવડરથી કીડા ખરી પડશે. માંદા ભાણસના બીછાણાની આસપાસ પણ સરકો છાંટવાથી પણ જીવજંતુઓ ત્યાં આવશે નહીં. લીમડાંના બાનું તેલ પણ જીવજંતુ મારવા વપરાય છે.

### ૧૩૩. ટીલી નસો મજબૂત કરો :

પીપળાની છાલની રાખ માખણ સાથે મેળવી ટીલી પડેલી નસો ઉપર લેપ કરવાથી રાહિત રહે છે. જાયફળ અને કેસરને સમભાગે લઈ માખણ સાથે મેળવી લેપ કરવો. તજ અને ચણી કબાબ સરખે ભાગે લઈ મધ્ય સાથે ગોળીઓ આશરે અટી ગ્રામ જેટલી બનાવી તે ગોળી એક મોઢામાં ચાવીને તે છુંટો ટીલી નસ ઉપર લગાડવો.

### ૧૩૪. જખમ ઝુગાયો :

કોઈ કારણસર શરીરમાં જખમ થયા હોય અથવા ધા પડ્યા હોય તો તેને ઝુગાવવા ધણા ઇલાજો છે જેમાં સૌથી દેશી

ભગવાન મંદિરમાં નથી બેઠો – ગોતો !

ઇલાજ તરીકે ચોમાસાની અડતુમાં ઉગ્રી નીકળતાં મશરૂમ. એ ઉગ્રી ત્યારે સફેદ હોય અને સૂક્ષ્માય ત્યારે એ કાળા થઈ જાય છે. તેનું ચૂર્ણ જખમ-દા ઉપર દબાવી દેવું. કુંવારપાઠમાં હળદર ભેળવીને જખમ ઉપર બાંધી દો. સંગાજુરાનો ભૂકો પણ દા ઉપર છાંટી રહેની વિધાન નાનાં હોય.

**જીવન કરું જીવન આપું હોય જીવન જીવન કરું હોય**

### ૧૩૫. અજીર્ણી :

ખોરાકનું બરોબર પાચન ન થવું ત્યારે અજીર્ણી થાય છે. તેનું મૂળ કારણ ખૂબ ચાચ્યા વગાર ખોરાક પેટમાં ઉતારી દેવો. સુંઠ, પીપર, કાળી મરી, હિંગા, મરી, અજમો, સિંધિવ સરખે બાગો રથી દુંગ વાલ જેટલો દિવસમાં બે વખત લેવું. કુમારનો રસ અઢી ગ્રામથી પાંચ ગ્રામ સુધી લઈ સાકર સાથે ભેળવીને ખાવો. આ ઉપરાંત પ્રિફળા, પીપર, સુંઠ, ચંચળનું ચૂર્ણ બનાવી છેણી ભરીને વાસી પાણી સાથે મધ્ય સાથે લેવાથી ખૂબ બરોબર લાગે અને પીતાનો નાશ થાય છે. ખોરાક ખૂબ ચાવીને ખાવો તરથી ૫૦ વખત ચાવવું..

### ૧૩૬. સંધિવા :

ગાળજુભીનો રસ પીવો અથવા તેની ભાજુ બનાવી ખાવી. ઉપરાંત સિલારસ લગાડી ઉપર તંબાકુનું પાન બાંધવું. કમરે ચસકા ભારે અથવા સાંદ્યામાં પતન થાય ત્યારે વાલની દાળને પાણીમાં એક કલાક ભોંજવી તેને વાટીને ભલમ બનાવી ચોપડવું.

ઉપરવાળો પથ્યરદિલનો નથી જ.

એ સૂક્તાય ત્યારે અંદરની પવન ખેંચી કાઢે છે. શરીર વાઈથી અટકી ગયું હોય ત્યારે સંધેસરાના પાનનો રસ ૨૦ ગ્રામ પીવો.

### ૧૩૭. ટી.બી. ક્ષય :

ટી. બી., ક્ષયનો આજકાલવધુ પડતો ફેલાવો થયેલ છે. યાદ રાખો શરદીમાંથી ક્ષય અને અસ્થમા - દમ થાય છે. કફને દવાઓ ખાઈ ખાઈ સૂક્તવી નાંખી એક પણી એક બારીક પડ છાતીમાં ચોટતા જાય છે અને જેમ વધતા જાય તેમ વ્યક્તિને શાસ (દાદર ચડતા કે વધુ ચાલતા) ચડે. અને આ પડો વધે તેને ટી.બી. અને ત્યારબાદ દમ કહેવામાં આવે છે. ટીબી માટેની ઘણી દવાઓ છે. આજે ટી.બી. કોઈ જીવલેણ દર્દ નથી. હા વર્ષો પહેલાં ટી.બી જીવલેણ હતો. જડમૂળમાંથી કાઠવામાટે સુંઠ દિવસમાં ગ્રાન્ય-ચારવખત, એક કપ પાણીમાં એક ચમચી સુંઠ નાખી ખૂબ ઉકાળો અને તે પાણી અર્દું થઈ જાય એટલે ગારમ ગારમ પીવું. ઉપરાંત આખા દિવસમાં જે સાદુ પાણી તમો પીવો છો તેમાં સુંઠ નાંખી ખૂબ ઉકાળી અને તેને ઠંડુ કરી થર્મોસમાં કે બોટલમાં ભરી સાથે રાખો. સાદુ પાણી તદ્દન બંધ કરો. સુંઠ શરીરે લગાડવામાં ગારમ છે પરંતુ પીવામાં હંડક છે. સુંઠથી શરીરના શેલ ખૂબ જ મજબુત થાય છે.

- આયુષ્ય, કર્મ, ધન, વિદ્યા અને મૃત્યુ એ પાંચ બાબતો જીવ જ્યારે ભાતાના ગર્ભમાં હોય છે ત્યારે જ નક્કી થઈ જાય છે.

જ્યારે ઇથિયો તમોને સાચવશે એટલે તમો ખલાસ...

## ૧૩૮. ચાંદી-ચાંદા :

(૧) ક્યારેય શરીરમાં ચાંદી પડે અથવા ચાંદા થાય ત્યારે ખાસ કરીને જેઠી મધને દૂધ, ઘી, મધ, સાકર સાથે ખાવા. (૨) ચાંદી અથવા ચાંદામાંથી રસી નીકળતા હોય અને ઘા પડ્યો હોય ત્યારે પકવેલી દાખણાનો બારીક ભૂકો ચાંદા-ચાંદી ઉપર દાખવો. તેનો મલમ બનાવીને ચોપડવો. (૩) ખાસ તો કરેણનું મૂળ પાણીમાં ઘસીને લગાડવું.

## ૧૩૯. બાળક :

બાળક ન રહેવાના કિરસાઓમાં પતિપળી બંનેની તપાસ જરૂરી છે. દવા તરીકે પતિપળી બજેએ વડના ટેટા રોજ ખાવા. ● કાંઈકારી : પતિની જાતીય સમસ્યા ઉકેલવામાં પલ્નીનો સહકાર સૌથી વધુ મહત્વ ધરાવેછે.

## ૧૪૦. દાંતના દર્દ :

દાંત દુખે ત્યારે તોબા બોલાવી હો છે. (૧) લવિંગને પાણીમાં વાટી તેના ટીપાં દાંત ઉપર લગાડવા. (૨) તલના ટીપાં કાનમાં નાંખવાથી દાંતનો દુઃખાવો તરત નરમ પડે છે. (૩) પીપર, સિંધવ, જીર એ બધા સમભાગો લઈ અનું ચૂર્ણ બનાવી દાંતે ઘસવાથી દાંતનો સડો અને સોજો બંને મટે છે. (૪) દાંતમાં કળતરહોય તો ઈંદ્રવરણીનું મૂળ દાંતે ઘસો. (૫) સરગવાનો ગુંડર દુઃખા દાંત ઉપર દબાવી રાખો.

## ૧૪૧. વીર્ય વદ્યે :

(૧) અડદની દાળનો આટો ધી અને ખાંડમાં પકાવી તેનો દળ બનાવીરોજ ખાવામાં લેવો. (૨) આંબળાના ચૂર્ણને લીલા આંબળાના રસમાં બે વાર પટ આપી છાંયડે સૂક્કવી તેમાંથી અઠી ગ્રામ જેટલું ચૂર્ણ તેટલી જ ખડી સાકર સાથે રોજ બે વખત ભૂખે પેટે ખાઈ ઉપરથી દૂધ પીવું. શરીરે ધાતુપુષ્ટિ વધારવા પીપર સાત ભાગ અને મધ્ય સાત ભાગ લઈ તેમાંથી અઠી ગ્રામ કે પાંચ ગ્રામ જેટલું લઈ જમ્યા બાદ ઠંડા પાણી સાથે ખાવું.

## ૧૪૨. રતાંધણાપણું :

ખાવાપીવામાં કોઈ ચીજની ઊણપ વર્તાય ત્યારે રતાંધણાપણું આવેછે. (વીટાભીનની કખીથી) (૧) સંધેસરાના પાનના રસના બે ટીપાં આંખમાં નાખવા. (૨) ધૂગારા ઉપર વેંગાણ બાફુવાથી જે રસ વેંગાણમાંથી નીકળે તે આંખે આંજવો. (૩) જીરુ અને કપાસના પાન પાણીમાં વાટી એનો લેપ બનાવી ગરદન ઉપર મૂકવો. આ પ્રયોગ રતાંધણાપણું સુધી કરવો.

દૂર કરવા માટે ભૂરા કેળાનું ભૂળ પાણીમાં ઘસીને ગ્રામ સપ્તાહ સુધી આંજવાથી સારો ફાયદો થાય છે. એના ફૂલના રસથી ચાહત થાય છે. કારેલાના પાનનો રસ આંખે આંજુ શકાય. સંધેસરાના પાનનો રસ બે ટીપા આંખમાં નાખવા.

બચપણાના દિવસો અને વતનને કદી ભૂલશો નહીં.

### ૧૪૩. રક્તાંશાવ :

પેશાબ સાથે લોહી પડે ત્યારે શતાવરીનું ચૂર્ણ પાંચ ગ્રામ લઈ ૨૦૦ ગ્રામ દૂધમાં ૨૦૦ ગ્રામ પાણી ઉમેરી ગરમ કરી એ દ્રાવણ લગાબગ અડદું થઈ જાય ત્યારે ઠંડુ કરીને પીવું. આમાં ૧૦ ગ્રામ ખડી સાકર અને ૧૦ ગ્રામ ઘી ઉમેરવું. (૨) ખડી સાકર ૧૦ ગ્રામ, ૨૦૦ ગ્રામ પાણી અને ૨૦૦ ગ્રામ દૂધ લઈ તેને ઉકાળવું. અડદું બાકી રહે ત્યારે ઠંડુ કરી ગાળીને પીવું.

### ૧૪૪. અજમાવી જુઆો :

- ઘીમાં મીણ પીગાળાવી એક શીશીમાં રાખવું. ઠંડીના દિવસોમાં હોઠ પર નિયમિત લગાડવાથી હોઠ ફાટતા નથી.
- મુખમાં છાલા પર તલના તેલમાં એક ચમચી સિંધવ ભેળવી લગાડવાથી રાહિત થાય છે. કુદીના, રામતુલસી, શ્યામતુલસીનો રસ તથા ખડી સાકર ભેળવી પીવાથી ટાઇફોઇડમાં લાભકારી નીવડે છે.
- અલ્સર શરૂઆતની ચિથિતિમાં હોય તો મધને દૂધ તથા ચાસાથે લેવાથી રાહિત થાય છે.
- સૂકી ઉધરસમાં મધ તથા લીંબુનો રસ સમાન માત્રામાં સેવન કરવાથી લાભ થાય છે.

ચાલતા રહો, નહીં તો ચાલ્યા જશો !!

- ફાટેલા, કાળા તથા પોપડીદાર હોઠ પર ફટકડીના ભૂકામાં મધ્ય ભેળવી લગાડવાથી ફાયદો થાય છે.
- મધ્યમાં ગુલાબજળ ભેળવી હોઠ પર લગાડવાથી મુલાયમ રહે છે.
- માખણમાં શુષ્ક કેસર ભેળવી લગાડવાથી હોઠ પર કુદરતી ચમક અને લાલી આવે છે.
- શેતુરનો રસ અડધો ગલાસ, ૧૦૦ ગ્રામ કોપરેલ, પાંચ ગ્રામ કપૂર અને ૨૦ ગ્રામ પીગળેલું પેરાફિન વેક્સનનું મિશ્રણ કરી એક શીશીમાં ભરી પગાની એડીના ચીરા પર રાતના લગાડવાથી ફાયદો થાય છે.
- કબજુચાતથી રાહીં પામવા ટામેટા અથવા સંતરાના રસમાં એક ચમચ્યો મધ્ય ભેળવી સેવન કરો.
- ગ્રેવીના રંગાને ઘેરો કરવા ચાપટી કોફી ભેળવવી.

#### ૧૪૫. વાળ કાળા કરવા :

જાયફળના તેલમાં વાળ કાળા કરવાનો ગુણા છે. જો વાળ કાળા કરવા હોય તો અડધુ તેલ અને અડધુ પાણી ભેળવવું અને વાળ ઉપર ભસળવું. ઇન્દ્રવરણાના બીજાનું તેલ વાળ ઉપર ઘણા સભય સુધી લગાડતાં વાળ કાળા થાય છે. નહાતી વખતે વાળ ઉપર આંબળાનું ચૂર્ણ ઘસવું.

ઓંટ મરે પહેલાં વતન તરફ મુંડી ફેરવે છે.

## ૧૪૬. છાતીએ પીતા :

(૧) છાતીમાંથી પિતાનો ઉભરો આવે ત્યારે ગોળ, હરકે સાથે લેવાથી રાહત થાય છે. (૨) આંબળાનું ચૂર્ણ અઠી ગ્રામ સાકર સાથે મિક્સ કરી દિવસમાં બે વાર લેવાથી રાહત રહે છે. (૩) પિત વધે ત્યારે દાળભાતમાં કોકમને બદલે આમળાં નાખવા. (૪) પીપર પણ મધ્ય સાથે ખાઈ શકાય. (૫) આંબળાંની ભૂકી પાણી સાથે લેવી. (૬) ગળામાં દાઉ બળતો હોય ત્યારે લુણીની ભાજુનું ચૂર્ણ અઠી ગ્રામ મધ્યમાં મેળવી ખાવું.

## ૧૪૭. કામ કરતા કરતા ચાલતાં રહો :

કામની વચ્ચે વચ્ચે ૨૦ મિનિટનો બ્રેક લ્યો અને ચાલો જેથી શરીરમાં રહેલું ગલુકોગ અને ઈન્ઝ્યુલિન ઓછું થાય છે. બેઠાબેઠા આપણા મસલ્સ નિષ્ઠિય થઈ જાય છે અને એ સમયે આપણાં શરીરની હિંયાને મદદરૂપ થતાં નથી.

## ૧૪૮. ટી.વી. :

ખૂબ જ જાણીતી ટીમે જણાવ્યું છે કે જે લોકો રોજ રૂપાં કલાકથી વધુ ટી.વી. જુઓ છે તેમનું મૃત્યુ જલ્દી થાય છે. સમજો જાણ્યા પછી બેઠા રહેવાથી કેટલું નુકસાન થાય ? ભાતમાં રહેલા ઈન્ઝ્યુલિનના કારણે લોહીમાં ગલુકોગનું પ્રમાણ વધી જાય છે. જે કોષોમાં બલડ સુગાર તરીકે વપરાઈ એનજ્ઝુ વધારે છે અને તેને બચાવે છે. અને લોહીનું પરિભ્રમણ લેવલ ઓછું થાય છે.

સરળ બનાવું જ ઘણું કઠિન હોય છે.

## ૧૪૮. ભૂખ વધારવા :

(૧) કુદીનો ખાવ, કુદીનાથી ખોરાકનું પાચન અને ભૂખ લાગે છે. (૨) મીઠી આવળના પાનનો ભૂકો, દાડમની કળીના રસ સાથે સમભાવે મેળવી ૫૦ ગ્રામ ખાવ તો ભૂખ ઘણી લાગે છે. (૩) પીપળ, પીપળી મૂળ સિંધાલુણ દરેક ૨૦ ગ્રામ, અકાલકરો, લવંગ હોળ ગ્રામ અને હોળ ગ્રામ પાણી લઈ તેમાં ખરળ કરી નાની ગોળી બનાવી ખાવી.

## ૧૫૦. કમળો :

કમળો થાય ત્યારે (૧) એળિયાનો જુલાબ એકઆંતરે લેવો. (૨) આંબળા, સોનાગોર, હળદર સરખે ભાગે લઈ બાર્ચીક વાટી આંખે અંજન કરવું. (૩) કમોદના ચોખા ૧૦ ગ્રામ લઈ ૧૦૦ ગ્રામ પાણીમાં આખી રાત ભીજવી રાખી એ પાણીને ગાળી ૩૦ ગ્રામ લેવું. તેમાં સાટોડીનો કણ ૧૦ ગ્રામ મેળવી પીવું. (૪) એરંડાના કૂણાં પાનનો રસ ૪૦ ગ્રામ અને ગાયનું દૂધ ૪૦ ગ્રામ લઈ રોજ બે વાર પીવું.

## ૧૫૧. વધરાવળ :

વધરાવળ થાય ત્યારે તેને મટાડવા લોટ, અજમો, દિવેલ, મગાજ સરખેભાગે મેળવી દૂધમાં તેની પેટીસ કરી વધરાવળ ઉપર એટલે કે પેશાબ કરવાના નીચેના ગોળા ઉપર લગાડી પાટો બાંધી દેવો. (૨) દાડમની છાલનું ચૂણ્ણ ૧૦૦ ગ્રામ લઈ અને તલ

૫૦૦ ગ્રામ લઈ ઉકાળી ગોળી ઉપર મસળવું અને પછી કચ્છો બાંધી દેવાથી ગોળી નાની થાય છે. (૩) તમાકુ અને સેલારસ ગોળી ઉપર બાંધવું.

#### ૧૫૨. હરસ :

(૧) અનિયભિત જમવાનો સમય અથવા ખોરાક પચતો ન છોય તે કારણે હરસ અને ભસા થાય છે. મોટે ભાગો કબજિયાત થાય ત્યારે કુકડવેલનું ચૂર્ણ ૧૦ થી ૬૦૦ ગ્રામ પાણીમાં આખી રાત ભીજવી રાખવું સવારે ટોયલેટ જતી વેળાએ પાણીથી ભજ નીકળનાર ભાગાને ધોવું. આ પ્રયોગ છ મહિના કરવો. (૨) કુકડવેલ, ઈદવારણી, કડવી તુંબકીના મૂળનું ચૂર્ણ ગોળ સાથે ખેળવી ધોવું. જેથી હરસ જડમૂળથી નિકળી જશે.

#### ૧૫૩. નાસુર અને ભગંદર :

નાસુર અને ભગંદરમાં શરૂઆતમાં ફોલ્લી થાય છે. તેને બેસાડી દેવા માટે વડના પાન, ઇનટનો ભૂકો, સુંઠ, રાળો, સાટોડીનો લેપ બનાવી મુકવો. ફોલ્લી ન મટે તો તેને પકવવી. આ માટે જવખાર, સાજુખાર, ટંકણખાર નાસુર પર મુકવાથી તે ફાટશે અને મોં મોટું થશે.

#### ૧૫૪. ભોજન :

(૧) ભોજનનો સમય ફિક્સે હોવો જરૂરી છે. (૨) મનફાવે ત્યારે ભોજન કરવું તે શરીરમાં વિધમ પેદા કરે છે. (૩) ભોજન

અહીં કોઇની અને કોઇ પતનની નિશાની છે.

કરણો  
સારસ  
તો ન  
જીયાત  
આખી  
મળ  
(૨)  
સાથે

તેને  
ઠો,  
વલી.  
ગી તે

ફાવે  
ઝન

કરતી વખતે કાંઈ બોલવું નહીં. જેથી પાચનક્કિયા મજબુત થશે.  
(૪) ભોજન બાદ થોડો ગોળ ખાવાથી પાચનશક્તિ અતિ મજબુત બને છે. (૫) ભોજન કર્યા બાદ અધવચ્ચે કાંઈ લેવું નહીં. નાસ્તો કરવો નહીં. (૬) ભોજન બાદ બપોરે સુવું નહીં. તેમજ રાત્રિ ભોજન બાદ ૩ કલાક બાદ જ સુવું. (૭) ભોજન સાંજના ૮ વાગ્યા પહેલા લેવાથી ફાયદો થાય છે. (૮) અતિ ભોજન નુકસાનકર્તા છે. જેથી ડાયાબિટીસ, બીપી, હાર્ટ, ઇમ જેવા રોગોને આમંત્રણ આપવા સમાન છે. (૯) શક્ક્ય હોય તો ૪૦ વર્ષ પછી અઠવાડિયામાં એક વાર ઉપવાસ મગના પાણી સાથે કરવો.  
(૧૦) વિજ્ઞાનની દસ્તિએ રાત્રિ ભોજન બંધ કરવાથી નાડી તંત્રની તાકાત વધી જાય છે. એનજીન્નું લેવલ ખૂબ જ ઊંચું આવવાથી ગંભીર રોગો આપોઆપ વિદાય લે છે. (૧૧) ભોજન સમયે બોલવું, રડવું, ખોટા વિચાર આવવા વગેરે પશુતાની નિશાની છે.  
(૧૨) ભોજનને પ્રસાદી સમજી લેવું.

#### ૧૫૫. ઓરકન્ડીશન મશીન :

ચાલુ બંધ કરતી વેળાએ છ ગાણી ઊર્જા વપરાય છે. અને કોઓસરની આવરદા ઓઇછી થાય છે. ઉપરાંત હંડક પૂરી મળો નહીં.

#### ૧૫૬. ડાયાબિટીસ :

ખાનપાનમાં બરોબર કાળજી ન રાખવાથી મીઠી પેશાબનો રોગ ભરડામાં લે છે. એ મટી શકે નહીં પણ એને અંકુશમાં રાખી

સભ્યના વહેણ મુજબ રહેનાર સફળ થાય છે.

શકાય છે. એ માટે જવની રોટી અને દૂધ સિવાય ઉથી ૧૫ દિવસ સુધી બીજો ખોરાક લેવો નહીં. આ ઉપરાંત વડના ઝાડની અંતરછાલ ૪૦ ગ્રામ પાણી લગાભગ અડધા લીટરમાં ઉકાળી ૧/૪ લાગ લેટલું રહે તે પીવું.

#### ૧૫૭. પેટનો દુઃખાવો :

પેટમાં ગાંઠ ખસી ગઈ હોય તો પણ દુઃખાવો થાય. અથવા અપાયનથી પણ દુઃખાવો થાય. કભોઈનો રસ પંથી ૧૦૦ ગ્રામ લઈ તેમાં ધી નાખી દર્દીએ ઊભા ઊભા પી જવાનું. આમાં આંતરડાનો સોજો તથા અન્ય પેટના દર્દો માટે સુવાની ભાજુના પંચાંગનું ચૂર્ણ અટી ગ્રામ ગોળ સાથે લેવાથી સારો ફાયદો થાય છે. આ બધા દર્દ ઉપર શોક કરો.

#### ૧૫૮. ડર કે ભય :

ડર કે અજ્ઞાત ભયમાંથી મુક્ત થવાની ગુરુ ચાવી – ડરપોક સ્વભાવને દૂર કરો. ગુરુ ચાવીનો મંત્ર : “ॐ સૂક્ષ્વવલ્ય સૂક્ષ્વવલ્ય વૃજંશુ વૃજંશુ મુક્તિ નમः” આ મંત્ર રોજ ૨૭ વખત ગાણવો. આ મંત્ર ગાણતી વખતે તુલસીના નવ પાન હાથમાં રાખવાના અને મંત્ર થઈ જાય પછી એ વિધાન ચાવી જવાના. આ પ્રક્રિયા સવારના ફથી સાંજના પ વાગ્યા સુધી ગમે તે સમયે કરી શકાય છે. આ મંત્ર કરવા માટે જો તુલસીના પાન ન મળે તો તેના બદલે અભિમંત્રિક જળ પણ ચાલે. (અભિમંત્રિક જળ એટલે છેલ્લી

પરમેશ્વરની પૂજા કરો, કાંઈ પણ લીખ માગ્યા વગાર.)

ટચલી આંગળીની આગાળની આંગળી એટલે પૂજા કે પૂજાની જમણા હાથની આંગળી પાણીમાં મૂકવી અને મંત્ર બોલવો.) આ મંત્ર દિવસમાં એક વખત અથવા વધુ વખત પણ કરી શકાય. આ મંત્રથી તમારા જીવનમાં એક નવો આનંદ અને એક નવો પ્રકાશ ફેલાશે. આપ ડરની પરિસ્થિતિમાંથી સંપૂર્ણપણે મુક્ત થઈ જશો.

#### ૧૫૮. કોઠ :

સુનામુખી ૮૦ ગ્રામ લઈ ભીક્ષ કરી સવારે પાંચ ગ્રામ રોજ લેવું. આ પ્રયોગ ત્રણે માસ સુધી કરવો. તુલસીના સૂક્તા પાન વાટીને લગાવવા. ખાવાની દવામાં બોરડીની અંતર છાલ ૧૦૦ ગ્રામ લઈ તેના ૪૦ પડીકા કરી રોજ બે પડીકા ખાવા. આ ઉપરાંત બ્રહ્મચર્ય પાળવું. મેંદીના પાન ૧૦ ગ્રામ લઈ પાણીમાં રાત રાખી સવારે ૪૦ દિવસ સુધી લેવું.

#### ૧૬૦. પરમો :

પેશાબે ગરમી, પેશાબે પરુ હોય તો તે માટે આમણા ૧૫ ગ્રામ જેટલા લઈ તેને ૨૫૦ ગ્રામ પાણીમાં એક રાત ભીજવી રાખવું. આ પાણીને સવારે નયાએ કોઠે ૧૦ ગ્રામ જેટલું મધ્ય ભેળવીને પી જવું. જુનો પરમો-છૂપાં દર્દીમાં બાવળના પાનના ઉકાળાની પીચકારી મારવાથી જુનો પરમો તથા સીના છૂપા દર્દીને ફાયદો થાય છે. ભીડાનો ઉકાળો પીવાથી પણ પરમામાં ફાયદો થાય છે.

આધુનિક ખાણીપીણી નોંતવે દાંતની પીડા.

## ૧૬૧. પથરી :

આટો ગ્રામથી પાંચ ગ્રામ જેટલી હળદર ગોળ સાથે ખાઈ ઉપરથી જવનો અથવા ઘઉંનો ઉકાળો પીવો. સરગવાની છાલનો કાઢો મરી, પીપર સાથે પીવો. પથરી પીગળાવવી હોય તો કુંવારનો રસ પાંચ ગ્રામ જેટલો લઈ તેમાં એક ચમચી હળદર ભેગવી રોજ બે વખત ખાવો. પીપર, મધુ અને છાશ પીવાથી દર્દમાં રાહત રહે છે.

## ૧૬૨. હરસ :

આપચાને કારણે હરસ થાય છે. જેમાં કફના હરસ થયા હોય તો હળદરના ગાંઠીયાંને ધૂવરના દૂધમાં સાત ભાવના દર્દ તેને પાણીમાં ઘસી ભસા ઉપર લેપ કરવો. હરસ મળદ્વારના માર્ગ થાય છે. બીજું હરસ માટે જો ઉત્તમ ઔષધ હોય તો તે છે છાશ. છાશના સેવનથી ઘણી સારી રાહત રહે છે. સુરણાના પાનની ભાજુ બનાવી રોજ બે વખત ખાવી.

## ૧૬૩. આંખનું તેજ વધે :

(૧) આંખે ઝાંખપ આવે અથવા ઓછું દેખાય તે સમયે આંખનું તેજ વધારવા સાજુખારને લીલી દ્રાક્ષના રસમાં ખાવો.  
 (૨) હરડે એક ચમચી ખડી સાકર સાથે રોજ રાત્રે ખાવું. (૩) બાવળના પાલાનો રસ આંખમાં નાખવો.

## ૧૬૪. શરીરે સોજા :

(૧) દૂધમાં એર્દિયું પીવું. (૨) કાળીયારનો ઉકાળો અથવા

કૂતરાની પૂછડી અને જલેબી સીધી થઈ શકતી જ નથી.

ખાઈ  
ગલનો  
॥ રનો  
જ બે  
ક છે.  
  
થયા  
દઈ  
માર્ગ  
ગશ.  
ગની  
  
મચે  
બો.  
૩)  
  
॥

ત્રિફળા ગૌમૂળમાં પીવો. (૩) બીલીના પાનનો રસ પીવો. (૪) ગોળ પીપર, સુંઠ સરખે ભાગે મેળવી ખાવી. ગોળ અને આદુનો રસ ખાવામાં લેવો. ગોળ અને સુંઠ અથવા ગોળ અને હરડે અથવા ગોળ અને પીપર ખાવી.

#### ૧૬૫. અજમાવી જુઆો :

- (૧) વાણિયાળી સાથે આદુ અથવા જુરાનું સેવન કરવાથી પેટની બળતરા તથા પાચનક્રિયામાં લાભ થાય છે.
- (૨) જેઠી મધની સૂકી જડોને રાતના પાણીમાં પલાળી રાખી સવારે ભાત ઓસાવેલ પાણી સાથે સેવન કરવાથી અલ્લાર મટે છે.
- (૩) ઘઉં અને ચોખાના લોટમાં ઘનેડા ન પડે માટે આ લોટને એક કલાક તડકામાં તપાવવો. વ્યારબાદ તેમાં એક ચમચી હળદરનો ભૂક્કો મેળવી ડળામાં ભરવો.
- (૪) કાંદા-લસણા નાખ્યા વગારની ગ્રેવીને ઘટ કરવા પ્રેડની બે ટ્લાઇસ ગ્રેવીના મસાલા સાથે મેળવવી.
- (૫) નખને મજબુત કરવા ઓલિવ ઓર્ઝલમાં ૧૦ મિનિટ દુબાડી રાખવા. અઠવાડિયે એક વખત કરવું.
- (૬) ચાકુ ઉપરનો કાટ દૂર કરવા વિનેગર ચાકુ પર ચોપડવો અને ૧૫ મિનિટ બાદ બ્રશથી ચાકુ ધોઈ નાંખવું.
- (૭) લાલ મરચું કે હળદર જેવા મસાલાને લાંબો સમય સુધી

ફાસ્ટફૂડથી વજન વધી જાય છે.

તાજા રાખવા તેમજ તેમાં જીવાત ન પડે ભાટે તેને હવાચૂસ્ત બરણીમાં ભરી રાખવાથી મસાલાનો કલર તથા સુગંધ તો જળવાય રહેશે. તેમજ સાથે તે લાંબા સમય પછી પણ તાજા જેવા જ દેખાશે.

- (૮) કોઈપણ ગ્રેવીનો કલર લાલ કરવા માટે લાલ રંગની બદલે થોડું બીટ ખમણીને નાખવું. રંગ તો લાલ થશે વાનગી સ્વાદિષ્ટ થશે.
- (૯) દાંતના દુઃખાવાથી રાહત પામવા લવિંગ દાંતમાં દબાવી રાખવું. પેશાબના કોગળા જુડગડાવીને કરવા.
- (૧૦) ભજુયા બનાવવાના ચણાના લોટમાં બે ચાર ટીપાં લીંબુનો રસ નાખવાથી ભજુયા તેલ નહીં પીએ તેમજ કિસ્પી થશે.

#### ૧૬૬. મેલેચિયાના ચિન્હો-લક્ષણો :

ઠંડી લાગી ધૂજારી સાથે તાવ આવવો, માથાનો દુઃખાવો તીવ્ર થવો, પરસેવા સાથે તાવ ઉતરી જવો, સામાન્ય દીતે તાવ એકાંતરે આવે છે.

#### ❖ સુવિચાર :

- વાણીનો પ્રભાવ અદ્ભુત છે. કડવું બોલનારની સાકર નથી વેચાતી અને ભીંઠ બોલનારના મરચા પણ વેચાય જાય છે.

પ્રેગનન્સીમાં રત્નિનું વજન ફાસ્ટફૂડથી વધી જાય છે.

- બાળપણથી જ વિકસે છે પ્રેમ, વિશ્વાસ જેવી લાગણી.
- શરીર શ્વાસથી ચાલે છે એમ માણસ વિશ્વાસથી ચાલવો જોઈએ.
- જીજાને ખુશી આપી હંમેશા ખુશ રહેતી વ્યક્તિ જ સાચી ત્યાગી છે.
- આચારમાં વ્યક્તિનું આંતર પ્રતિબિંબ જિલાય છે.
- નિવૃત્તિ પછીની વય (ઉમંર) એ પ્રભુનું પેન્શન છે !
- પ્રાર્થના શરૂઆતનો અર્થ : ભગવાનની સામે વિનભ્ર થઈને ઇચ્છિત વસ્તુ તાલાવેલીથી માંગવી એને પ્રાર્થના કહેવાય છે.

#### ૧૬૭. અજમાવી જુઆ૦ :

- દાગ્યા ઉપર છુંદેલું કેળ લગાડો. લીંબુ તથા તુલસીના પાનનો રસ સપ્રમાણ ભાગ્રામાં બેળવી પ્રતિદિન બે વખત ચહેરા ઉપર લગાડો, ત્વચામાં નિખાર આવે છે.
- દહીભાંથી ખારાશ દૂર કરવા તેમાં દહીના પ્રમાણ પ્રમાણે બે-ત્રણા કપ પાણી નાખી અડધો કલાક રહેવા દઈ પાણી નિતારી લેવું.
- પુસ્તકના કબાટમાં થતી જીવાત અટકાવવા લોલ મરયાં અથવા તો લીમડાના પાન મૂકવાં.

આખો દિવસ ઈશ્વર કરે છે શું ?!

- કિંગરમાં થોડું મીઠું ભબરાવવાથી બરફની દ્રે કિંગરના તળિયે ચોંટશે નહીં.
- હળદર તથા ચપટી બેકિંગ સોડા બેળવેલ પાણીમાં ચણા રાતના પલાણવા અને સવારે પ્રેશર કુકરમાં ત્રણ સીટી વગાડી બાફવા. આ ચણા જલડ પ્રેશરના દર્દીઓ માટે ગુણકારી છે.
- અપચાની તકલીફ હોય તો તરખૂચનો તાજો રસ પીવો.

#### ૧૬૮. કડવો પણ લાભકારી લીમડો :

- લીમડાના ફૂલનો અર્ક રક્તની કભી, કૃભિ, ફોડલા-ફોડલી તથા કૃષ્ણ રોગથી છુટકારો થાય છે.
- લીમડાના ફૂલનો કાઢો બનાવી પીવાથી દાંત તથા દાંતના પેટા મજબૂત થાય છે.

#### ૧૬૯. કમળો – લીમડાના ઝંથી ૫૦ પાન લઈ તેને ઝીણા વાટી એક ગલાસ પાણીમાં ઉકાળા. પા ભાગ જેટલું પાણી રહી જાય ત્યારે તેને ગાળી તેમાં એક ચંચળો મધ્ય બેળવી સવાર-સાંજ સેવન કરવું.

#### ૧૭૦. ખંજવાળ – લીમડાના ઉકાળેલા પાણીથી સ્નાન કરવું.

#### ૧૭૧. કાનમાં દા થવો :

લીમડાના તેવમાં મધ્ય બેળવવું. રૂના પૂમડા ને આ ભિશાણમાં બેળવી કાનમાં રાખવું. આમ કરવાથી કાનની સફાઈની સાથે સાથે કાનમાં જખમ થયો હોય તો તે પણ ચુગાય છે.



બચત કરો, ભવિષ્યના સંકટો દૂર કરો.

## ૧૭૨. વાયુ ગોસ, અપાચન :

મુંજારો થાય, જીવ ગભરાય, ભૂખ ન લાગો અને પેટમાં વાયુ જેવું લાગ્યા કરે ત્યારે સમજવું કે આ વાયુ-ગોસ અપાચનથી થાય છે. ઉપાય તરીકે ચિત્રકાદીવટી એ તમામ વાયુનો અકસ્મીર ઉપાય છે. ગંધકવટી, કલ્પતરવટી, અનિનતુંડી, શંખવટી, હિંગવાષ્ટક, શિવાક્ષાર પાચન, દ્રાક્ષાદિચૂર્ણ વગેરે ખૂબ જ અદ્ભુત પ્રયોગો છે. આમાં નરમ, હલકો ખોરાક, પેટ પર ગરમ પાણીનો શેક કરી શકાય તે પ્રમાણે પ્રયોગ કરવો.

## ૧૭૩. મીઠું :

દિવસમાં ૪-૫ ગ્રામથી વધુ મીઠું શરીરમાં નાંખતા હો તો સમજું લેવું કે તમે તમારી જ જુંદગી જાયે ખેલી રહ્યા છો.

## ૧૭૪. કેળા :

પીળા રંગાની લાલ છાલ ઉપર કાળાં ટપકાંવાળા પાકાં કેળાંમાંથી ટ્યુમર કોસિસ ફેકટર નામનો પદાર્થ શરીરને મળે છે. જે શરીરમાં રહેલા ખરાબ તત્ત્વો સામે બાધ ભીડે છે. કેળાની છાલ ઉપર કાળા ટપકાં જેટલા વધુ એટલા વધુ સ્વાસ્થ્યવર્દ્ધક છે. બીજા કેળા એટલે કાળા ટપકા વગરના કેળા કરતાં ૮ ગણાં વધુ ગુણકારી વધુ ટપકાવાળા કેળામાં છે. કેળા પચવામાં સરળ અને તેના દ્વારા ઝડપથી શરીરને એનજૂર્ઝ મળે છે. સગાર્ભા સી માટે

ભોળા માણસોનો ભગવાન હોય છે.

કેળામાં રહેલા “ફોલિક”ને બાળક સહેલાઈથી ગ્રહણ કરે છે. જોકે કેળાનું સેવન સગાર્ભા સીએ ઓછું કરવું.

#### ૧૭૫. અંજુર :

કબજિયાત, વજન ધારાડવા ફિગ કુટ્સમાં રહેલા ફાયબર્સ મેદરવીપણાને ધારાડે છે. કેળા અને અંજુર આ બે ફળ ‘પહેલું સુખ તે જાતે નર્યા’ કહેવત છે. અઠવાડિયે બે-ગણ વખત ઉપયોગ કરવો.

#### ૧૭૬. પેટમાં ગોળો :

કબજિયાત, તરસ, પેટમાં ગડગડાટ, મોળ, ઓડકાર, અરચિ, દાહ સાથે પેટમાં એક પ્રકારની ગાંઠ થઈ ફરેંદ્રે છે. ઊંચે ચડે અને દર્દીને બહુ જ હેરાનગતિ થાય છે. વાયડા પદાર્થો ખાવાથી, ભૂખ્યા છતાં પાણી પીવાથી, ઉપવાસ કરવાથી, શોકથી ગુલરોગ થાય છે. એના ઉપાયમાં શંખવટી, કુમાર્યાસવ, નારાયણ તેલ દૂધમાં પાંચ ગ્રામ નાખીને પીવું તથા ભાલિશ કરવું. આ બધા શાસ્ત્રીય પ્રયોગો છે.

#### ૧૭૭. ગાંઠ ગ્રૂમડાં :

ભીંઢું દોઢ ગ્રામ લઈ તેને ઝ ઓંસ પાણીમાં મેળવી એક એક ચુમચી દર ત્રણ કલાકે પીવી. મરીને વાટી તેનો લેપ બનાવી ગાંઠ-ગ્રૂમડાં ઉપર લગાડતાં ગાંઠ તથા ગ્રૂમડાં પીગાળે છે. પકવવા માટે મેથીને વાટી તેમાં ભીંઢું ભેળવી પાણીમાં પોરીસ કરી બાંધવી.

તમો જે કાંઈ ભોગાવો છો તે કર્મને આધિન છે.

## ૧૭૮. ડાયાબિટિસ :

મીઠી પેશાબનો રોગ ઘણા પરિવારમાં જોવામાં આવે છે. તલને ઘાણીમાં પીલી થોડું તેલ કાઢી લેવું. થોડું તેલ તલમાં રહેવા દેવું. આ તલના ખોળને ગોળ સાથે મેળવી લાડુ બનાવવા અને રોજ ખાવા. શરીરમાં ઠંડી દૂર કરી ગરમી લાવવાનો એમાં વૈદક ગુણ હોવા જોઈએ. આ ઈલાજ સાવ સરળ અને સસ્તો અને સ્વાદિષ્ટ છે.

## ૧૭૯. પાઈસસ :

રાત્રે જાગવું અને દિવસે સુવાથી કામ, કોધ, મોહ, લોભથી તેમજ શોક, ચિંતા, ઉજગારાથી આ રોગ થાય છે. હરકે દરરોજ, દિપન-પાચન : સુંદ મરી, પીપર, સૂરણા, મૂળા, પપૈયા વિગેરે યોગ્ય ભાગ્રામાં ખાવાથી કબજુયાત મટે છે. અભિયારિષ્ટ આમાં રામબાળ ઉપાય છે. હિંલાષ્ટક ચૂર્ણ, ચિત્રકાદીવટી, બ્રિફળાચૂર્ણ રાત્રેલઈ શકાય. હરકે દરરોજ રાત્રે લેવી.

## ૧૮૦. કાનમાં ગૂમડા :

તુલસીના પાન દિવેલની કુંપણમાં વાટી ગરમ કરી પોટિસ બનાવીને મુકવાથી ગૂમડા પીગળી જાય છે. ગુલાબના પાનની પોટિસ અથવા કેળના મૂળિયાને મૂત્રમાં ગરમ કરી બાંધો. અથવા કુંવારનાં એક પાઠાને ચીરી તેમાં અંદર રસવંતી તથા હળદર ભભરાવી જરા ગરમ કરી બાંધો.

ગાયનું દૂધ અને ગાયનું ધીનો ઉપયોગ કરો.

## ૧૮૧. વાળને ડાઈ :

બજારમાં ભળતી કોઈપણ ડાઈને એક પ્લાયવુડના બોક્સમાં નાંખી થોડી મિનિટ બંધ કરી દો. અને જુઓ એ બોક્સમાંથી ઘુવાડા નકળતા દેખાશે અને થોડો વધુ સમય નહીં ખોલી નાંખો તો કદાચ એ બોક્સ બળતું દેખાશે.

## ૧૮૨. શારીરમાં સુસ્તી મટે :

ખોરાકનું બરોબર પાચન થયું ન હોય અથવા કબજિયાત હોય ત્યારે સુસ્તી આવે છે. ખોરાકનું પાચન થાય તો સુસ્તી મટે. નિવારણ માટે ગરમ પાણી એક કપ દિવસમાં ત્રેણ વાર પીવું. આ પ્રયોગ ૧-૨ મહિના કરવો. આમાં ઠંડુ પાણી વાપરવું નહીં. જમ્યા પણી અડધાથી પોણા કલાકે પાણી પીવું અને જમ્યા પહેલા એક કલાક અગાઉ પાણી પીવું.

## ૧૮૩. અજમાવી જુઓ :

- (૧) ચક્કર : મધ્ય સાથે તુલસીની પેસ્ટ અથવા રસ ભેળવી ચાટવાથી ચક્કર આવતા મટી જાય છે.
- (૨) કાચા કારેલાનો સહન કરી શકાય તેટલો ગરમ રસથી માલિશ કરવાથી ગઠિયા વા મટે છે.
- (૩) આંખમાં સામાન્ય બળતરા થતી હોય તો શુષ્ણ મધ્ય આંજવાથી બળતરા બંધ થઈ જાય છે.

ગાયના દૂધથી ૧૦૦ રોગો થતા નથી અને થયેલા મટી જાય છે.

- (૪) ચહેરા પર ખીલ ફૂટતા હોય તો કાંદાનો રસ ખીલ ઉપર લગાડવાથી ખીલ દૂર થશે.
- (૫) દાગ્યા પર મધ્ય લગાડવાથી બળતરા ઓછી થશે. તેમજ ફોડલા નથી પડતાં તથા દાગ્યાના ડાઘ દૂર થશે.
- (૬) વધુ પડતી દવાઓ ખાવાથી ભાથાના વાળ ઓછા થઈ ગયા હોય, તદ્દન નીકળી ગયા હોય તો કાચો કાંદો વાટી ભાથામાં લગાડો રાખો, અથવા કડવી પરવળનો ભાવો લગાડો, પછી અડધો કલાકે નાહીં લેવું. વાળ આવી જશે.
- (૭) ભાથાના વાળ શરીરની રચના થતી ઓછા થઈ ગયા હોય, ટાલ પડી ગઈ હોય તો ભાથામાં નહાતા પહેલા અર્ધો કલાકે પેશાબ નાખી ધસવો.
- (૮) સતત આવતી હેડકીથી છુટકારો પામવા હળદરને પાણી સાથે લેવાથી તુર્ન જ બંધ થઈ જશે.
- (૯) શારીરિક થાકને તલ્કાળ દૂર કરવા મધ્ય, લીંબુનો રસ તથા પાણી એક ઉતામ પીણું છે.
- (૧૦) તુલસીના પાનને આદુના રસ સાથે દર બે કલાકે લેવાથી દરેક પ્રકારના પેટના દુઃખાવા મટી જાય છે.
- (૧૧) ફુદીનાનો તાજો રસ મધ્ય સાથે સેવન કરવાથી તાવ દૂર થાય છે તથા ન્યુમોનિયાથી થતા વિકાર પણ નષ્ટ થાય છે.

આપણે ભગવાનના જ વંશ છીએ.

(૧૨) પાકી કેરી ખાવાથી રક્તની ભાગા વધે છે. દુબળા લોકોનું વજન વધે છે. તેમજ શરીરમાં સ્ક્રૂટિં વધે છે.

૧૮૪. કઈ રીતે ઓળખશો દૂધમાં બેળસેળ કરાઈ છે કે નહીં ? :

(૧) પાણીની બેળસેળ માટે એક ટીપું દૂધ લીસી સપાટીવાળી વસ્તુ કે જમીન પર મૂકો. પાણી મિશ્રિત દૂધ ગડપથી સરકી જશે.

(૨) દૂધમાં સ્ટાર્ચ અથવા લોટ મિક્સ હોય તો દૂધને ઉકાળ્યા બાદ ઠંડા કરેલા પ મીલી દૂધમાં ૩-૪ ટીપાં ટીન્યર આયોડિનના ઉમેરતા મિશ્રણ જ્યુ રંગાનું થઈ જશે. (૩) દૂધની થેલીનો એકાં ખૂણો કાપીને સીલ કરવામાં આવ્યું છે કે જોવું. (૪) દૂધની થેલી ખાલી થયે તેને બારીક ટુકડા કાતરથી કરી ફેંકો. બેળસેળીવાળા દૂધથી પેટના રોગો, પાચનશક્તિ નખળી પડે, ગેસ્ટ્રો, લોહીની ઊણાપ, લિવર અને અન્ય અવયવોને નુકસાન, થાય છે. ત્વયાના રોગ થાય, ફૂટ પોઇઝનિંગના લક્ષણો દેખાતા સારવાર લ્યો.

૧૮૫. ઝુગનો મલમ :

(૧) ધા કે ચાંદા પડવાથી દેશી ઉપાયમાં ૫૦૦ ગ્રામ કોપરેલ, ૩૦૦ ગ્રામ રાબ, મોરથુથુ ૧૫ ગ્રામ લઈ થાળીમાં મસળી તેમાં મીણ એક ભાગ, મધ્ય ચાર ભાગ ગરમ કરી મલમ બનાવી ઉપર લગાડો. (૨) પીંડસનો મલમ બનાવવા માટે ધી ગરમ કરી અંદર રાબ નાખવી. આ મલમ યોપડવો.

ખાંડ ખાવાથી ફાયદો અને નુકસાનની ગણતરી કરો.

કોનું

## ૧૮૬. સારણગાંઠ :

સારણગાંઠની સારવાર શાસચિહ્નિસાં ઉપરાંત પ્રાથમિક અવસ્થામાં પાટો બાંધવો. તત્કાળ રાહિત માટે પંચસકાર ચૂર્ણ લેવું.

## ૧૮૭. વાતવિકાર :

મળમૂગ્રના વેગોનો અવરોધ, અપરય આહાર, વિહાર, તીજા, કડવા, કષાય, ખાટાં, ઇક્સ અને અલ્પ ભોજનને લીધે વાતવિકાર થાય છે. રાત્રિ જગરણા કે શોક, ચિંતાને લીધે પણ આમ થાય છે. અને કુપિત વાયુ શરીરમાં સ્થાન પામે છે. આના ઉપાયોમાં સામાન્ય ભહિયાસનાદિકવાય, ભહિયોગરાજ નારાયણ તેલ, વાતાવિ તેલ વગેરે આ વાતવિકારમાં અકસ્મીર છે. તેલની માલિશ ગરમ પાણીનો શોક રાહિત આપે છે.

## ૧૮૮. હરસમસા :

હરસના ભસા થાય ત્યારૈ તેને મટાડવા અનેક આયુર્વેદિક ઘલાજો છે. જેમાં સૌ પ્રથમ કાળા તલ, ગાયનું માખણા, સાકર, એક ચમચી જેટલું લઈ રોજ ખાવું અથવા કાળા તલ વાટીને ઇચ્છાપટી જેટલાં લઈ તેને માખણા સાથે રોજ ખાવા. આમાં વરવરનું સુરણ પણ ખૂબ જ ઉપયોગી છે. હરસ માટે અઢી કીલો કાચું સુરણ લઈ તેને સૂક્ષ્મવી તેનું ચૂર્ણ બનાવી રોજ પાંચ ગ્રામ ચૂર્ણ પાણી સાથે લ્યો.

ખાંડની જગ્યાએ ખડીસાકરનો ઉપયોગ કરો.

## ૧૮૯. ઊંઘ આવતી નથી :

અશ્વગંધા, પિપરીમૂળા (ગંઠોડા) કુંગાળી, દહીં અને અડદની દાળ વ્યો.

## ૧૯૦. સોજા :

શરીરે સોજા આવે ત્યારે એ કોઈ પણ રોગના લક્ષણાઙ્કે આવે છે. એમાં ખાસ કરીને હૃદય, કીડની અને થકૃત આ પ્રણામાંથી કોઈ એક અવયવમાં વિકૃતિ થાય ત્યારે સોજો દેખાય છે. પાંડુ એ પણ સોજાનું મુખ્ય કારણ છે. ઉપચારમાં આરોગ્યવર્ધની અને પુનર્નવાહિમંડુર એ ઉત્તમ થાય છે. બેમાંથી કોઈ એક દૂધ સાથે આપી શકાય. મૂગ્લ કલ્પો જેવા કે પુનર્નવાહિકવાથ ઉપયોગી નીવડે છે. એનાથી તુર્તજ ફાયદો થાય છે.

## ૧૯૧. પથરી :

અનેક ઉપાયોમાંના (૧) કાચી હળદર ૧૦૦ ગ્રામ લઈ વાસી પાણી સાથે બે સપ્તાહ પીવાથી ફાયદો થાય છે. આ ઉપરાંત પથરી ભટાડવા ૧૦ ગ્રામ કાકડીના મગાજને ગરમ પાણી સાથે પીવું. વધુમાં ગોખરની ચાંપણ પેટ ભરીને પીવાથી ઘણો લાબ થાય છે. (વિશેષમાં સારોડીના પંચાંગનું ચૂર્ણાંપાંચ ગ્રામ લઈ તેમાં ૧૦ ગ્રામ સાકર મેળવી દિવસામાં બે વારું પીવું.)

**૧૯૨. સંગ્રહણી :** વારંવાર ઝાડે જવું, કાચા પાકા ઝાડા થાય, પેટમાં ગોળો

બાળકો સાથે વધુ સમય વીતાવો.

જેવું લાગો, જમ્યા બાદ તરત જ પાતળો કે કાચો ઝાડો થાય ત્યારે સમજવું કે સંગ્રહણી થયો છે. આવે વખતે ભૂખ, તરસ, દાહ, ક્ષીણતા વધતા જાય છે. ભૂખ ઘણી તીવ્ર હોય છે. ઉપાયમાં માગ છાશ કે દૂધ પીવું. પંચામૃત પર્પટી, બિલ્વાદી ચૂર્ણ, હિંગવાષ્ટક ચૂર્ણ આ બધા શાસ્કીય ઉપાયોની યોજના છે. બેલફણનો મુરણ્ણો ખાવો. ચિગ્રક, જુર, સૂંઠ, હિંગ, લવણ, દાડમ, જુના ચોખા એ બદું પથ્ય છે. ખાસ : સમયે-સમયે જમવું, ક-ટાઈએ જમવાયી બીજા ઘણા રોગો થાય છે.

#### ૧૬૩. સુવારોગા :

સામાન્ય રીતે પ્રસૂતી બાદ સીઓને શરીર વાતપ્રધાન બની જાય છે. અને અશક્તિ વધુ આવી જાય છે. તાવ, અરચ્ચી, વેદના, અશક્તિ ઘણી આવી જાય છે. ઉપાય તરીકે દશમૂળ કવાથ દસ દિવસ સુધી આપવું. નારાયણ તેલ અને વિષગાર્ભ તેલનું માલિશ કર્મર વગેરે અંગોમાં કરવું. અને જો બગ્રીસુ યાને કાટલું વિદ્યિસર દરરોજ સેવન કરવામાં આવે તો આરોગ્ય જળવાય રહે છે.

#### ૧૬૪. દાંત :

૬૦ વર્ષથી વધારે વચ્ચના જે લોકોને ગમ ડિસીઝ એટલે કે પેટાં સંબંધી સમસ્યા હોય છે તેમની યાદશક્તિ અણગણી નબળી પડી શકે છે. નોર્મલ જે વ્યક્તિને પેટાં સંબંધી સમસ્યા હોય તેમના દાંતોમાં રહેલા બેકટેરિયા પેટાંના માધ્યમથી રક્તવાહિનીઓમાં સરળતાથી પ્રવેશ કરી શકે છે. ઉપરાંત ફેટી જ્લોકનું નિર્માણ કરે

છે. તેનાથી વાહીનીઓમાં બલોક્ડ કેસ્ટ્રોકનો ખતરો વધી જાય  
છે. આ બધી સમસ્યાઓ માટે દેશી ઉવાચું કરો. ઘણી બધી ઉવાઓ  
છે. ડોક્ટરો પાસે જશો એટલે તમારી પાસે મોટા પૈસા લઈ તમારા  
દાંત કાઢી નાખશો. ૧૫ વિભાગીય રૂપાંદરી રૂપી રૂપ કે રૂપ  
૧૦૦૮૫. હરસ મસા : કે માર્ગરિટ મિલિયની ડાંનીના રૂપી રૂપ  
૧૮૫. હરસ મસા : કે માર્ગરિટ મિલિયની ડાંનીના રૂપી રૂપ

હરસ મસા નાગકેસરના બીજ, ધદર જવ, ચસમની સરખે  
ખાંખાં માંદાં - કે માર્ગરિટ મિલિયની ડાંનીના રૂપી રૂપ  
બાગો ચૂર્ણ બનાવી મૂઠી જેટલું ચોખાનું ધોણ લઈ સાત દિવસ  
ચુધી પીવું. નાગકેસર અને ખડી સાકર સરખેબાગો મેળવી પાંચ  
ગ્રામ જેટલું લઈ પાણી સાથે સવારે અને સાંજે લેવું. નાગકેસર  
અને માખણ પણ ખાઈ શકાય. ઉપરાંત જૂના ગોળ સાથે હરડે પણ  
ખાઈ શકાય. હરસમાં લોહી પડતું હોય તો ગાળીનો ભૂકો દાખવાથી  
લોહી અને રૂમાંડું તેઠિં કાપત. કે માર્ગરિટ મિલિયની ડાંનીના  
લોહી બંધ પડે છે.

૧૯૬. ગાડા અને લોહી : કે મિલિયની ડાંનીના રૂપી રૂપ  
ગાડા અને લોહી : કે મિલિયની ડાંનીના રૂપી રૂપ  
ઘણી વખત ગાડા વાટે લોહી પડે ત્યારે ઇસબગુલ અઠી  
ગ્રામ લઈ તેને શોકી છુંદીને દર્દી સાથે ખાવું. આડામાં અગાન  
બળતી હોય તો ખડી સાકર સાથે લેવી. આ ઉપરાંત સુંદ ૫૦  
ગ્રામ, દૂધ ૨૦૦ ગ્રામ લઈ તેને ૨૦૦ ગ્રામ પાણીમાં નાખીને  
બાફવું. તેને ગાળીને પીવું. આમાં આંબળાનો મુરલ્યો પણ રોજ  
૩૦ ગ્રામ જેટલો સવાર-સાંજ લેવાથી આંબળાનું ચૂર્ણ અઠી ગ્રામ  
દીમાં મેળવી રોજ બૂખે પેટે ત્રણ વખત ખાવું. ૧૯૭. મિલિયની

બાળકોને સિરીયલમાં “પોગો”થી દૂર રાખો. ૧૯૮. મિલિયની

શ્રી જાય  
 દવાઓ  
 તમારા  
 સરખે  
 દિવસ  
 પાંચ  
 કેસર  
 પણ  
 અવથી  
 અટી  
 અગન  
 ૫૦  
 અખીન  
 રોજ  
 ગ્રામ

#### ૧૬૭. વાળ કાળા થાય :

અકાળે અથવા વૃદ્ધાવચથા એમ લાગે કે વાળ સફેદ થઈ જાય છે તો વાળને કાળા કરવા માટે ચિંદુર, સાખુ, ચૂનો સરખે ભાગે લઈ પાણીમાં મેળવી વાળ ઉપર લગાડવું, અને ઉપરથી નાગરવેલનું પાન બાંધવું. આ ઉપરાંત લીંબોડીનું તેલ એક માસ સુધી વાળમાં લગાડવાથી તથા નાકે સુંધવાથી વાળ કાળા થાય છે.

#### ૧૬૮. બાળકોની હરકતો :

બાળકને દૂધની ગાંઠ બંધાય ત્યારે દૂધેલીના પાનનો રસ પાવો. દૂધેલીના મૂળ દૂધમાં ઉકાળી ત્રણા દિવસ પીવડાવવાથી ત્રણા દિવસમાં ઝાડા વાટે ગાંઠ નીકળી જશે. બાળક નીરોગી તેમાં તાવ ખાંસી, ઝાડો, કફ વગેરે બાળકોના વ્યાધિ માટે 'અતિવિષ' અથવા કાકડાસીંગ એકથી ત્રણા રતી સુધી રોજ ત્રણવાર ખડવાવું. બાળકના દરેક દર્દ જેવાં કે ખાંસી, વાઈ, પેટમાં કબજ, ગરમી વગેરે માટે હરકે અને કળિયાતું પાણીમાં ખસી પાવું. વિલાયતી દવાઓથી દૂર રહો.

#### ૧૬૯. બરોળની ગાંઠ :

બરોળમાં ગાંઠ નીકળે ત્યારે ખૂબ દુઃખાવો થાય છે. આવે સમયે ઈંદ્રચાયણના ફળમાં લસોટો મીહું (ભરી તેના) ઉપર ઘઉના લોટનું પડાયાટાવી ચ્યૂલામાં બાફવું. ફળને બાફવું (નહીં) તે ફળને બારીક નીમકા જીવું વારી ભૂકો બનાવવો. તેમાંથી અટી ગ્રામથી

પાંચ ગ્રામ જેટલું લઈ પાણી સાથે રોજ સવારે લેવું. આ ઉપરાંત તાડના ઝાડની રાખમાંથી ખાર બનાવી તે બે વાલ જેટલું ખાતા સારી રાહું મળે છે.

**૨૦૦. ગાળાનો સોજો :**

ખાવા-પીવાની તકલીફ જણાય તો સિધિવ, દાજ, બાવચી, હળદર, ભરી, પીપળ અનું ચૂર્ણ બનાવી અટી ગ્રામ જેટલું ચૂર્ણ લઈ મધ્ય સાથે ખાવું. અથવા ફુટકડીના કોગળા વારેવાર કરો. વાર્યથી ગળાનો સોજો થયો હોય તો તલનું તેલ અને મીઠું મેળવી તેનો કોગળા કરવા. પિતની હોય તો મધ્ય અને ધીનો કોગળો કરવો.

**૨૦૧. લોહીની ઓછપ :** પાલકના પાનનો રસ, મોસંબી, દ્રાક્ષ, સફરજન, ટમેટો અને ગાજરનો રસ પીવો.

**૨૦૨. ઓછી ભૂખ લાગવી :** લીંબુ ટામેટાનો રસ પીવો.

**૨૦૩. તાબ :** મોસંબી, ગાજર, સંતરાનો રસ પીવો.

**૨૦૪. ઓસેડિટી :** મોસંબી, સંતરા, લીંબુ, અનાનસનો રસ પીવો.

**૨૦૫. કૃષિ રોગ :** લસણ અને મૂળીનો રસ પેટના કીડાને મારે છે.

**૨૦૬. સશ્રીને દૂધ વધે :**

(૧) ઘણી સશ્રીઓને સ્તનમાં દૂધ બહુ ઓછું આવે ત્યારે જેમણે સાઠી ચોખાને વાટી અને દૂધ સાથે કાંજુ બનાવી ખડી સાકર નાખી બેસપ્તાહ પીવું. (૨) અટી ગ્રામ શતાવરીના પાનને

સામગ્રીઓમાં સુખ સમાયું નથી, સુખ તો સંતોષમાં સમાયું છે.

રાંત  
નાતા  
ચી,  
લઈ  
થી  
ના  
મ,  
દે  
ક  
ન

દૂધમાં વાટીને પીવું. (૩) સુવા તથા કોપડું ઘીનો પટ આપી ગરમ કરી રોજ ખાવું. (૪) આ સાથે દૂધની ચાર લીડી પીપર મેળવી પીવી. બાળક આવ્યા બાદ જુરું ખાસ લેવું.

### ૨૦૭. રતવા :

(૧) રતવા એ બાળકને ખૂબ પરેશાન કરી મુકે છે. આ સમયે જુવન જોટાના પાનનો રસ એ રતવાના ચાંઢા ઉપર લગાડતા ત્વચિત રાહત થાય છે. (૨) રતાળુ કંદને બાફી તેનું ચૂર્ણ પાણી સાથે ગ્રાણ દિવસ લગાડવું. થોડું બળશો પણ અંતે સારું લાગશે. (૩) રતાંજલી, ગુલાબજળી, વાળો વગેરે ઠંડક આપનારી ચીજોને શરીરે ઘસવી.

### ૨૦૮. પ્રદર્શન :

સીઓને પાણી જાય ત્યારે નળાકેસર એક ચમચી જેટલું લઈ છાશ સાથે ખાવાથી અથવા છાશ અને ભાત જમવામાં લેવું. બીજા પ્રયોગમાં હડપચી જે ખાસ કરીને ગાંધીને ત્યાં મળે છે તે પણ એક ચમચી જેટલું લઈ ખડી સાકર ભેળવી રોજ બે વાર ઠંડા પાણી સાથે લેવું. આ ઉપરાંત પકહેલી ગાભણ અટી ગ્રામ જેટલી ખાવામાં લેવાય તો પણ ઘણી રાહત થાય છે. ખાવાનું મીઠું પાણીમાં નાંખી તે પાણીની પિચકારી મારે તો પણ રાહત થાય છે.

### ૨૦૯. ગર્ભસ્થાન સુધ્યારો :

ગર્ભસ્થાન બગડે ત્યારે સંતતિ પેદા કરવામાં અનેક મુશ્કેલીઓ આવે છે. એના નિવારણ માટે આચુર્વેદમાં અનેક

શેરબજાર એ ચોરબજાર છે, ચેતો !

ઇલાજો આપવામાં આવ્યા છે. આમાં અસંગાધ પાંચ ગ્રામ લઈ તેને રૂપો ગ્રામ પાણીમાં એક રાત્રી ભીજવી રાખવું. તેને રૂપો ગ્રામ દૂધમાં ઉકાળી પીવું. આમાં પાંચ ગ્રામ જેટલું ગાયનું દી પણ દૂધણાં નાખી શકાય. ખાસ કરીને માસિક ધર્મ શરૂ થાય પછી ચોથા દિવસથી આ પ્રયોગ કરવો. આ ઉપરાંત સાખુદ્કણ દૂધમાં દાસી ગાયના દી સાથે ખોવાથી ઘણો લાભ થાય છે.

**૨૧૦. લકવો :** લકવો અથવા વાના અનેક દર્દ માટે દાખાના દી લકવો. લકવા અથવા વાના અનેક દર્દ માટે દાખાના દી લકવો થયો હોય તો તેમણે રોજ સવારે એક કાચી ફુંગળી ખાવી. લકવા આગળ ન વધે તેના માટે ૧ ગ્રામ કોઈનો પણ પેશાબ તુર્ફ જ વિના વિલંબે પાઈ દેવો જેથી લકવા આગળ વધતો બંધ થઈ જશે. આ ઉપરાંત વરણનાગનું તેલ મશળવાથી ફાયદો થશે. અડદ પણ ખૂબ જ ગુણકારી છે. તેના લોટના વડાં ખોવા માલકાંગાણીના બી ૧૦થી ૨૦ લેવાથી પણ સૌરી અસર થાય છે. ખોરાકમાં અડદ, ઘઉં, સરગવાની સીંગો, લસણ વધારે સારું.

**૨૧૧. અંડવૃષ્ટિ :**

રૂપો ગ્રામ કાંદાને ખમણી તેને ૧૦૦ ગ્રામ દીમાં તળવું. જેવી એની સોડમ બહાર નીકળે કે તરત તેને ઉતારી લેવું. ચાની પોટલી બનાવી ગોળી પર બાંધી દેવું. આ પોટલી એક સવારથી

શેરબજરમાં કદી સાહસ ન કરો.

બીજુ સવાર સુધી બાંધી રાખવી. બીજો પાટો તરત જ બાંધવો.  
આમ ત્રણ દિવસ કરવાથી ગોળી નાની મોટી થઈ જાય છે.

**૨૧૨. વાયુ ગોળો :** એ હેડ સ્પેશિયલ કિલ્ફાન્ડ મિસિન્ઝોર્સ ખોરાકનું અપાયનને લીધે શરીરમાં વાયુ ગોળો થઈ આવે છે. પ્રથમ તો ખોરાકને ખૂબ ચાવી-ચાવી ખાવું કે ઓછામાં ઓછું તરથી વધુ વખત ચાવવાથી તમે શરીરને જોઈતો ખોરાકથી વધુ ખાઈ શકશો નહીં. વાયુ ગોળો થશે નહીં. ઉપાય એ ઠળીયા વિનાની ખારેક ૭૧ ભાગ અજમો છ ભાગ લઈ એનું ચૂર્ણ બનાવી અટી ગ્રામ જેટલું ચૂર્ણ બે સત્તાહ સુધી રોજ બે વખત ખાવું.

**૨૧૩. પેશાબો રેતી :** મિસિન્ઝોર્સ કિલ્ફાન્ડ મિસિન્ઝોર્સ (૩)  
મિસિન્ઝોર્સની પાનનો રસ ૪૦ ગ્રામ સવારે નરણો કોઢે પીવો અને રોકાય તેટલી વાર પેશાબ રોકવી પછી (એકદમ પેશાબ થવાથી) રેતી બહાર આવશો. (૨), મુખાનું કિંમત મિસિન્ઝોર્સ

**૨૧૪. લીંબુ :** મિસિન્ઝોર્સ મિસિન્ઝોર્સ કિલ્ફાન્ડ મિસિન્ઝોર્સ (૩)  
અક્ષીર લીંબુ પીવાથી પાણીમાં ખરાબ જીવજંતુઓ હોય તો એ જીવજંતુઓ મરી જશે.

**૨૧૫. આસ્વરચ્છ પાણી :**  
મિસિન્ઝોર્સ મિસિન્ઝોર્સ કિલ્ફાન્ડ મિસિન્ઝોર્સ કિલ્ફાન્ડ  
પીવાથી અનેક રોગો થાય છે. હોજરી અને આંતરડામાં જીવજંતુ થયા હોય તો લીંબુ, ટમેટા, લીલી, દ્રાક્ષ, સફરજન વગેરે ખટાશવાળા ફળનો રસ પીવાથી જીવજંતુઓ મરી જશે.

## ૨૧૬. વજન ઘટાડો :

(૧) ઓછામાં ઓછા ૧૦ કલાકની ઉંઘ જરૂરી છે. આ હું નથી કહેતો આધુનિક વિજ્ઞાન કહે છે. (૨) કરમદા ખવાય એટલા ખાવ. (૩) તાંબાના ઘડામાં પાણી નાખી ખૂબ ઉકાળો. ૫૦% પાણી બાકી રહે તેને ઠંડુ પાડી આખો દિવસ એ પાણી પીવું. ચરબી નિકળી જશો. ઇ કલાકથી ઓછી ઉંઘ લેનાર વ્યક્તિનું વજન વધે છે. અને વોશિંગટનના વિજ્ઞાનીઓનું સંશોધન છે. રોજુંદો ખોરાક રેગ્યુલર લો.

## ૨૧૭. સાળોખમ :

(૧) સરસયું તેલનાકે લગાડવાથી રાહ્ત થાય છે. (૨) નવસારને સુંદરવાથી સાળોખમ નરમે પડે છે. (૩) મરી, ગોળ અને દહીં ખાવું. (૪) શરદીથી સાળોખમ થયું હોય તો એલચી અને લવિંગ ચાવી મોટામાં રાખવું. (૫) રાત્રે સુતી વખતે કાચો કાંદો ખાવો. (૬) સંઠનો પાઉડર એક ચમચી પાણીમાં નાખી પાણી ખૂબ ઉકાળો અને પી શકાય તેટલું એ ગરમ પાણી પી જવું. જરૂરતે તેમાં હળદર ઉમેરવી.

## ૨૧૮. દાડમ :

અનેક રોગોનું મારણ સમું 'દાડમ' હૃદય માટે શ્રેષ્ઠ છે.

## ૨૧૯. કપૂર કાચલી :

વમનનું અક્સીર ઔષધ છે. વૈધોનું માનીતું ઔષધ છે.

આયુર્વેદિક દવાખાનામાં કપૂર કાચલી પ્રથમ હરોળમાં જેવા ભરે છે. આ જડીબુણી અતિ પ્રાચીન સમયથી પ્રશંસા પામેલ છે. મહર્ષિ ચરકે શાસ, ઉધરસ અને હેડકીમાં ખૂબ જ ઉપયોગી બતાવેલ છે. દાંત, પેટાની દુર્ગાધ દૂર કરે છે. દુઃખાવો મટે છે. કપૂર કાચલી વધુ સાધારણ કડવી અને તીખી હોય છે. ચિન અને ભારતમાં પેદા થાય છે. તેમાં ભારતની નાની અને ચીનની મોટી હોયછે. પરંતુ ભારતમાં ઉગેલી કપૂર કાચલી વધુ ગુણકારી હોય છે. ખીલ માટે કપૂર કાચલીને ગુલાબના જળમાં ધસીને ખીલ ઉપર લગાડવથી ખીલ મટી જાય છે.

#### ૨૨૦. અજમાવી જુઆો :

- સફરજન કાકડીને છાલ સહિત ખાવું જોઈએ. બોજન બાદ રોજ એક સફરજન દાંતથી તોડીને ખાવાથી દાંતની સફેદી વધે છે.
- દહીંમાની ખટાશ દૂર કરવા તેમાં પાણી ઉમેરી અડધો કલાક રહેવા દઈ પાણી નીતારી લેવું.
- શાસ નળીની બામારીમાં પાન રામભાણ ઇલાજ છે. પાનનું તેલ ગરમ કરી છાતી પર એક અઠવાડિયા સુધી લગાડવું.
- ભૂખ વધારવા, તરસ બુઝાવવા અને પેટાની સમસ્યાથી રાહત પામવા બનારસી તથા દેશી પાન ફાયદાકારક છે.
- શરીરમાં પાન પર લવિંગ નાખીને ખાવાથી શરદી જલદી પાકી જાય છે.

● કાર્યપ્રેશારો કુકર ઉપયોગમાં લેવાયું હોય ત્યારે તેના ટાંકણા પર છીકમ લસણાની કળીઓ (૧૦) બિનિટિભારખવાથી છોતરા જલદી (૮) નીકળી જશે. એ વિષુદ્ધ માર્ગેને નિયમિતી (૧૫) માર્ગે કાંઈ ચહેરાની ત્વયાને નરમ, મુલાયમ રાખવા કેળાને છુંદી અનુકૂળ ચહેરાએ પર લગાડવું (૧૦) બિનિટિ પછી ચહેરો હુંફળા (૧૫) પાણીથી ધોઈ નાખવો. એ નિયમની નિયમિતી (૧૫) માર્ગે કાંઈ ગાજર રક્તમાના ખરાબ કોલોસ્ટ્રોલનું સ્તર ઓછું કરે છે. નીચ્યાનું પણ સામાન્ય રોગ માટે ગુણકારી છે. તે કંદ હોવા છતાં ફળો જેવો લાભ આપે છે.

- કસ્ટર્ડ બનાવતી વખતે ખડી સાકર સાથે એક ચમણો મધ્ય આપ નાખવાથી (૧૫) વધુ સ્વાદિષ્ટ થાયા છે. નિયમિતી (૧૫) બટાકા બાફ્તી વખતે તેમાં ચપટી મીઠું નાખવાથી બટાકા ફાટી નથી જતા.

- નાળિયરનું પાણી ત્વયા, પાચનતંત્ર અને વાળ માટે લાભકારી છે. અઠવાડિયામાં બે વાર નાળિયેર પાણી પીવું ફાયદાકારક છે.

૨૧. સંધિવા :

નિયમિતી (૧૫) વિષુદ્ધ માર્ગેને નિયમિતી (૧૫) માર્ગે નિયમિતી (૧૫) ઠંડીના દિવસોમાં સંધિવા ઉભરે છે. અનેક ઇલાજેમાંથી આસગંધ ૧૫ ગ્રામ, તેમાં આસગંધ ૧૫ ગ્રામ, સુંધ પાંચ ગ્રામ લઈ (૩૫) બ્રાન માર્ગેને નિયમિતી (૧૫) માર્ગે નિયમિતી (૧૫) તેનું ચૂર્ણ બનાવી ધી સાથે ખાવું. બીજા ઇલાજમાં આંબા હળદર,

સુરીમન અને ઝેરકોચલા સરખેભાગે મેળવી ગૌમૃતમાં ગરમ કરી દુઃખતા ભાગ ઉપર લગાડવું. સ્કૂકાયા બાદ પણ વારંવાર લગાડવું. આ ઉપરાંત કાળી માટી રૂપો ગ્રામ લઈ તેમાં ૧૦૦ ગ્રામ નીમક નાખી પાણી સાથે મેળવી દરદ ઉપર લેપ કરવો.

**૨૨. પૈટનો વાયુ :** જે હાથ પોતિની નાંદળી, ફૂલ લુંઘાયા મરી અને પીપરનું ચૂર્ણ પાંચ ગ્રામ ભધ સાથે ખાવું. જમતી વેળા દાળ-ભાત ખાતાં તેમાં મરી અને લસણ લેવા. આ ઉપરાંત કટોરીનું પાણી પીવું. આમાં આઠ ગલાસ પાણી લઈ તેને માટીના વાસણામાં રેડી તેમાં સફેદ મરી, લવિંગ, તજ, વાવડિયાનો એક એક ચંમચી પાઉડર નાખી ઉકાળવું અને માત્ર એક ગલાસ જેટલું જ પાણી બાકી રહે તેને ગાળી પીવું. આ કટોરીનું પાણી વા, અચેતન માનવી, ઊલટી, શરીર ઠંડું પડી ગયેલા દર્દીને ખૂબ જ લાલ થાય છે.

**૨૩. બંધકોશ :** અજૂર્ણ થાય અને ભૂખ ન લાગો ત્યારે સમજવું કે બંધકોશ થાય છે. આને મટાડવા સિંધવ અને લીંબુના રસમાં આથેલી ફ્ઝાકી પાંચ ગ્રામ જેટલી લઈ રોજ બે વખત ખાવી. આમાં વરીયાળી પાક પણ લઈ શકાય. એ માટે સોનામુખી, જુણી હરદે, ગુલાબના ફૂલ દરેક ૬૦ ગ્રામ લઈ તેને ધીમાં તળી સાકરના શીરામાં પાક બનાવી રાત્રે સુતી વેળા ખાવું.

સફળતા તેને મળે છે જે સાહસથી કામ કરે છે. ગરીબ

## ૨૨૪. રક્તસાવ :

દ્વારા ધાથી કે મહિલાને અવર્ત દ્વારા કે કોઈને ઝડા વાટે લોહી વણી જાય ત્યારે જાસવંતીના પાનનો રસ એક ચમયો જેટલો લઈ ૨૫૦ ગ્રામ દૂધમાં આપવો. આ પ્રયોગ ત્રણ દિવસ કરવો. ખોરાકમાં માત્રકાંજુ લેવી. ઉપરાંત મેથીનાં દાણા ૨૧ લઈ તેને ખોખરા કરી સુંદ અઢી ગ્રામ સાકર ૧૦ ગ્રામ, ખળખળતાં પાણી ૧૦૦ ગ્રામમાં મેળવી આખી રાત રાખી સવારે પીવું.

૨૨૫. કુશા ખર્ચ વગાર અનેક રોગોને દૂર રાખનાર પાણી પ્રયોગ :

દ્વારા કુશાની રોગોને કાંદું લાગતું હોય તો કુશાની પદ્ધતિસર “પાણી પ્રયોગ” કરવાથી નાની-મોટી જીવલેણ બિમારીઓ મટી શકે છે, દૂર રહે છે. જેવા કે ભાથાનો દુઃખાવો, લોહીનું દબાણા, લોહીની અષ્ટત, સંધીવા, લક્વો, જડાપણું, છુદયના ધબકારા, બેઠોશી, કષ, ખાંસી, દમ, ટી.બી., મેનેજાઈટીસ, લીવરને લગતા રોગો, પેશાબની બીમારીઓ, હાઈપર એસિડીટી, ગેસને લગતા તકલીફો, મરડો, કબજિયાત, હરસ, ડાયાબિટિસ, આંખોની દરેક તકલીફો, સીઓનું અનિયમિત માસીક, ગાર્ભાશયનું કેન્સર, નાક, કાન, ગળાને લગતા રોગો.

પાણી પીવાની રીત : વહેલી સવારે ઊઠીને મોટું ધોયા વગાર કે બ્રશ કર્યા વગાર ૧.૨૬૦ કિ.ગ્રામ જે અંદાજે ઝ મોટા

ગલાસ થાય તેટલું પાણી ઘુંટકે ઘુંટકે પી જવું. તે પછી ૪૦ મિનિટ સુધી કાંઈ પણ ખાવું નહીં. પાણી પીધા પછી બ્રશ કરી નાસ્તો કરવો અને બપોરના જમતા-જમતા પાણી પીવું નહીં. કે એક કલાક અગાઉ પાણી પીવું નહીં. બપોરના-રાત્રે જખ્યા બાદ બે કલાક બાદ પાણી પવું. આ પ્રયોગ બિમાર તંદુરસ્ત વ્યક્તિઓ પણ કરી શકે છે. એકી સાથે ઘુંટકે-ઘુંટકે થાર ગલાસ પાણી પી શકાય તેમ ન હોય તો ધીમે ધીમે આ ટેવ પાડવી.

#### ૨૨૬. કમર દુઃખવી :

સામાન્ય રીતે ભહિલાઓને કમરનો દુઃખવો ખૂબ રહે છે. તેઓએ કૂવાડીયાના બીજ પાંચ ગ્રામ લાવી રોજ સવારે તેની ફાકી મારવી. ઉપરાંત સુનામુખીને દૂધમાં રોજ લેવાથી પણ કમર મજબુત થાય છે. યુવાન સીઓને કમર દુઃખે તો આચુર્વેદનો સુપ્રસિદ્ધ યોગ યોગરાજ ગુગાળની બે ગોળી તથા ચંદ્રભાગ નં. ૧ની બે ગોળી સવાર સાંજ લેવી. કુમાયાસવ પણ વધુ ફાયદાકારક નીવડશે.

#### ૨૨૭. રક્તપિતા :

રક્તપિતા શરીરમાં ચાઠાં અથવા હાથપગાના નખ ખવાય જાય ત્યારે આમળા તથા લીમડા બજેના પાનનો રસ ૫૦ ગ્રામ લઈ સવારે અને સાંજે ભૂખે પેટે લેવો. આ પ્રયોગ ત્રણ સપ્તાહ કરવો. જરૂર પડે તો વધુ થોડા દિવસ કરવો. (૨) ૧ ભાગ સમુદ્રફીણ અને તેટલો જ સરખો લઈ મલમ જેવું બનાવી પિતા ઉપર લગાડવું. પિતના ચાંદા ભાટે સાજુખાર, સિધાલુણને કડવા તેલમાં મેળવી

મુસીબત ટૂંક સમયની હોય છે અને ઉપકાર જિંદગીભરનો.

શરીરે એક કલાક સુધી મસળવું. પણ ગરમ પાણીથી શેક કરવો.

**૨૨૯. મોટા પરના ચાઠાં :** મિથ્યા હોલ્ડ ક્રૂઝ રઘુ કાર્સ ડિસ્પોલ

કાળી મુસળી દિવેલમાં ઘસીને લગાડવો. મોટામાંથી દુર્ઘટા આવે ત્યારે સાજુખાર અને ખારેકના પાણી સાથે ખાવો. મોટા પર છાલીયા પડે તો કોડો પાણીમાં ઘસીને લગાડવો. મોટા ઉપર કાળાશ થાય ત્યારે ત્વચા ઉપર ગણાનો લોટ પાણી સાથે મેળવી મસળો. ચામડી નરમ પડતે અને સુંવાળી બનશે. મોટામાં ગરમી થાય ત્યારે લુણીની ભાજુ કાચી ચાવવી અથવા તેના રસના કોગળા કરવા.

**૨૩૦. પેશાબ છૂટે :** મિથ્યાની કાળાશ હુંડ મિથ્યા માર કાંપ જરૂર કરું કરું કરું

તો કેળના રોપાનું પાણી પં ગ્રામ તાપેલું ધી ૨૦ ગ્રામ મેળવી પીવું. આમાં એવો ચંદ્રકાર છે કે આવી રીતે ખાદ્યેલું ધી છુટું પડી પેશાબ વાટે નીકળે છે અને પેશાબનો માર્ગ મોકળો થાય છે. આ ઉપરાંત સીતાફળનું મૂળ પાણીમાં ઘસીને પીવું.

**૨૩૦. આમવાત (રેમેટિંગ) :** મિથ્યાની કાળાશ હુંડ મિથ્યાની કાળાશ હુંડ આમવાતના દર્દીએ દર્દીં, છાશ, આંબલી, ખાટાં પીણા,

ખાટાં ફળો, કાચી પાકી કેરી, કરમદા, લીંબુ, ટમેટા, શિંબંડ વગોરે ખાટા પદાર્થો નહીં ખાવો. ઉપરાંત હંડવો, ટોકળા, ખમણા,

બ્રેડ, પાઉન્ડ, ઇડલી, ટોસા, ઉતપમ વગેરે આથ્યો આવીને તૈયાર થતાં ખાદ્ય પદાર્થો પણ અહિતકર સિદ્ધ થાય છે. આમખાતના દર્દીઓ માટે લસણ, સરગાવો, મેથી, સૂંઠ, દિવેલ, મગ, ભાત, દિવેલનું મોણ નાંખેલ ભાખરી વગેરે ખાવું.

### ૨૩૧. એસીડીટી - અભિપ્રાત : જાણાં અને છાતીમાં બળતરા

જાણ ઓડકાર, ગાળામા, પેટમાં અને છાતીમાં બળતરા થાય. અવારનવાર ખાટી ઉલ્ટી થાય, માથું સખત દુઃખે, ગુરુદુઃખે આવે, સ્વભાવ ચીડિયો થઈ જાય તથા ખાટી 'કડવી' ઉલ્ટી થયા બાદ જ થોડી રાહીત થાય. આ દર્દીએ આમળા સિવાયના તમામ ખાટા પદાર્થો છોડી દેવા. આથ્યો આવે તેવા પદાર્થો પણ નહીં ખાવા. તીખા અને ગરમે પદાર્થો છોડી દેવા. તડકામાં ફરવું કે રખડવું નહીં. લીધુ ફૂલ, આંબલી, ભીડા, ટમેટા, દહી, ખાટા ફળો, લસણ, ડુંગાળી, તલ, અડદ, કળથી, કટી મધ્યપાન, આસવ, અરિષ્ટ, તમાકુ અને ગુટકા નહીં લેવા. તડકો, કોઇ, ઉપવાસ, એકટાણા અને ટેન્શન આ બધા અભિપ્રેત - એસિડીટીના ઉત્પાદક અને વર્ધક કારણો છે. મનની શાંતિ અને પ્રેમપૂર્ણ વાતાવરણ મોટું ઔષધ છે.

- પારકા પોતાના લાગે છે કેમ ? અને પોતાના પર હાલ રાખવું અધ્યરૂં લાગે છે આમ કેમ ?
- ભૂતકાળનું સ્મરણ કરી વર્તમાનમાં દુઃખી ન થવું કારણ કે નદીનું વહી ગયેલ જળ પાછુફરતું નથી. પછી પશ્ચાતાપ શેનો ?

વગર લેવાદેવા, કોઈને કંઈ સૂચન ન કરવું.

- એકાગ્રતાનો અભાવ કારકીર્દીને આડે પાટે ચડાવી દે છે.
- મોબાઇલ પેઈનફૂલી જ નહીં ! મેન્ટલી ઓક્સ્યુપાઈડ પણ રાખે છે. દુર રહો.
- ભારતની સંસ્કૃતિ આજે આથમતી દેખાય છે. કયાં ગાઈ એ સંસ્કૃતિ ? એ ખમીર ? એ જમીર ? એ રાણી ?
- ઇન્જેક્શનની સોય ઇન્જેક્શન લેતાં પહેલાં તપાસી જોવી કે સીલપેક છે કે ઉપયોગ કરેલી ? એજ રીતે દાઢી કરાવતા નિયમ નાંનાં હશે. જીવનની વિધું નાંનાં હશે. એજ રીતે પહેલાં નવી બ્લેડ લે સીલપેક જેવો દેખાવ કરીને સારામાં નિયમ નાંનાં હશે. એજ રીતે બ્લેડ લેબોરેટરીના ઇન્જેક્શન દેનાર માણસો વાપરેલી બ્લેડને પાછા એજ પેકમાં મૂકી દે છે. અને તમે કાંઈ વિચારો એ પહેલાં નવી બ્લેડ ખોલી નાંખી બતાવે છે અને જુની બ્લેડ ઇન્જેક્શન વાપરે છે. બચો.
- હે ઈશ્વર મને મારી હેસ્થિયત કરતા વધુ ન આપશો કારણ કે જરૂર કરતા વધારે રોશની માણસને અંધ બનાવી દે છે.

## ૨૩૨. એઈડ્જન : નિયુ ૧ નિયુ ૭ વિભાગીની રૂદ્ધા

દવાઓથી જલ્દી નહીં મટે પરંતુ રોજ પીશકાય તેટલો પોતાનો અથવા બીજાનો પેશાબ પીવો. આ પ્રયોગ મેં મજદૂર ઉપર કરેલ અને તેને એઈડ્જ બિલફુલ મટી ગયેલે. એઈડ્જ વાળી વ્યક્તિનો ચેપ લાગતો નથી.

### ૨૩૩. રોજ સવારના નરણે કોઠે છ ગલાસ પાણી પીવું : કણ

કદી બિમાર પડશો નહીં. જુદા જુદા રોગો આ પાણી પ્રયોગથી નીચેની મુદ્દત સુધીમાં ભટી શકે છે -

- હાઈપર ટેન્શન, લોહીનું ઉચ્ચ દબાણ એક મહિનામાં.
- ડાયાબિટીસ - મીઠો પેશાબ મહિનામાં.
- કેન્સર - છ મહિનામાં.
- ગોસની તકલિફો - દસ દિવસમાં.
- કબજુયાત - દસ દિવસમાં.
- ટી.બી. - ત્રણ મહિનામાં.

આ પ્રયોગ દિવસમાં ત્રણ વખત કરવો. જેમાં (૧) સવારે નરણા કોઠે છ ગલાસ પાણી મોટો ગલાસ પીવો. (૨) બપોરે અને રાગે જમ્યા બાદ બે કલાક પછી બે-ત્રણ-ચાર ગલાસ પાણી પીવું. ષ્પ દિવસ બાદ રોજ સવારે આ પ્રયોગ કરવો. જમતા પહેલાં કલાકે અને જમતા-જમતા પાણી પીવું નહીં. આ પ્રયોગથી શરૂઆતમાં વારંવાર પેશાબ આવશે. પરંતુ દેગ્યુલં થઈ જાવ પછી પેશાબ નિયમિત થઈ જશે.

### ૨૩૪. કોઠે: કુદાની માસાનું કિંદળાનીએ વિભાગ કેન્દ્ર સફેદ ડાંધ, કોટ મટાડવા માટે અનેક ઉપયારો છે. જેમાં બાવચી દૂધ સાથે મેળવી લગાડવું. બાવચી બારીક ગાળીને કોટ

ઉપર લગાડવું. બાવચી કૌચા તેલ, કાયલીનું એ સર્વે દહીમાં નાખી કોઠ ઉપર મુકવું. કૌચા શુદ્ધ કરેલા લેવા. ભીલાયુ નંગા-૩, નવસાર ૧૦ ગ્રામ, લીંબુના રસમાં પીસી ગોળી બનાવી તે ગોળી લીંબુના રસમાં ઘસીને ચોપડવી.

#### ૨૩૫. લોહી પડવું :

દાડ પીવાથી કે ગરમ ચીજો ખાવાથી લોહી પડે છે. ત્યારે બે દાણાની રાબ બનાવી પીવી અથવા વરિયાળીને દિવેલમાં તળીને તેનું ચૂર્ણ બનાવી તેમાંથી રોજ ૧૦ ગ્રામ જેટલું ખાવું. આની ઉપર વાસી પાણી પીવું. નાકમાંથી લોહી પડતું હોય ત્યારે ઘોડાધાસ લાવી તેનો રસ કાઢી નાકમાં મુકવું. નાક અને મોટામાંથી લોહી પડતું હોય તો જૂના કપાસની ધૂણી નાકે લેવી. પણી કપાસના પાનનો રસ ૧૦ ગ્રામ ખડી સાકર સાથે પીવો.

#### ૨૩૬. મરડો :

મરડો થાય ત્યારે ચુંક આવે એને મટાડવા સુંઠને ધીમાં તળી ખાવી. અથવા સુંઠના કાળામાં દીવેલ નાખી પીવાથી ચુંક, શુળ વગેરે મટી જશે. ઉબરાના દૂધનાં પાંચ ટીપા ખડી સાકર સાથે ખાવાથી અતિસાર અને આમમાં રાહિત રહે છે. વારંવાર ઝાડો થતો હોય ત્યારે ૧૦ ગ્રામ એખરો દહી સાથે ખાવો. અટી ગ્રામ શંખજુદુને મેલાઈ અથેવા માખણ સાથે ખાવું.

## ૨૩૭. કબજિયાતનો સાચો, સરળ ઉપયાર :

ચોવીસ કલાકમાં કલાકે-કલાકે મોટો ખ્યાલો ભરી પાણી પીવું. રોજુંદા ખોરાકમાં અતુ અતુના શાકભાજુ, ફળો ખાવ. ધાર્મિક ઉપસાવો વગેરે છોડો. અંત્ર તો પ્રાણ છે. સારા પ્રમાણમાં વિવિધ ફળો ખાવા.

## ૨૩૮. પેસમેકર :

અમેરિકાના વૈજ્ઞાનિકોની શોધથી બેટરીના બદલે હૃદયના ધબકારાથી ચાલતા પેસમેકરની શોધ થઈ. જેને બેટરી બદલવાના ઓપરેશનથી દર્દીઓને રાહત મળવા સંભવ.

## ૨૩૯. બલગામ-કફ્ફી :

બલગામ દુર્ક કરવા માટે લવિંગ ૩ નંગા, જવાખાર બે ચંપટી લઈ આદુના રસમાં વાટી પાન સાથે ખાવાથી સારો લાભ થાય છે. ગળાનો કફ્ફ છુટો પાડવા માટે બદામ નંગા ૧૫ લઈ તેને ગરમ કરી સવારે ખાવાથી મોટે ભાગો કફ્ફ તોથા ખાંસી મટી જાય છે.

## ૨૪૦. શરીરનો કોઈ પણ ભાગ બળી જાય :

અથવા પાક પર કોઈ પણ ભાગને સાફ કરવા માટે ચણાનો લોટ દૂધમાં ભેળવીને લગાડવો અને પાણીથી ધોઈ નાખી દીનો મલમ લગાડવો.

શરીરના દરેક અંગ નહાતી સમયે સાફ કરો.

## ૨૪૧. પથરી : કાકડીના બાદ દુવાલથી સાફું કરીએ.

પથરી મટાડવાના અનેક ઉપાયો છે. જેમાં સિંધાલુણા ૧૦ ગ્રામ લઈ તેના ૧૨ પડીકાં બનાવી તેમાંથી રોજ સવારે એક પડીકું ખાવું અને ઊભા-ઊભા ગાયના દૂધમાંથી બનાવેલી છાશ પીવી. આ ઉપરાંત સુનામુખીને કાકડીના બીજ સાથે ખાવી. કાકડીના રસ સાથે પણ સુનામુખી લઈ શકાય.

## ૨૪૨. વૃષણામાં પાણી :

કોઈપણ કારણસર પૂરુષના વૃષણ એટલે ગોળીમાં પાણી ભરાય ત્યારે સાર્યાંખાના મૂળનું ચૂર્ણ એક માસ પાણી સાથે રોજ ખાવું. આ ઉપરાંત ચુંઠનો ભૂકો, મધ્ય સાથે ભેળવી પાક બનાવી શકાય, તેમાંથી ખપ પૂરતો પાક રોજ બે વખત ખાવો. આ ઉપરાંત દિસામણીનું પાન વાટી ગરમ લેપ કરી સુજુ ગાયેલા વૃષણ ઉપર બાંધવું.

## ૨૪૩. ચહેરાની કાળાશ :

૩૫ વર્ષની ઉમરની પછી ચહેરા ઉપર કાળાધાબાઓ પડવાના શરૂ થાય છે. તો કેટલાકનો આખો ચહેરો કાળો થઈ જાય છે. તો કેટલાકને આંખ નીચે કાળા કુંડાળા થાય છે. ગાલ ઉપર ધેરા ખાઉન રૂંગાના ચકરડાઓ થઈ જાય છે. ખીલ મટી ગાયા પછી કાળા ડાઘ રહી જતા હોય છે. નાડી, પ્રકૃતિ, દોષને તપાસી પછી

કાળા ડાઘની સારવાર કરવામાં આવે તો કાળા ડાઘ સંપૂર્ણ મટી જાય છે. કાળા ડાઘ ઉપર કિંમ, લોશન, સ્કબર, લેપ ગમે તે લગાડો તો પણ કોઈ ફરક પડતો નથી. પિતા અને વાયુનું કારણ કાળા ડાઘ પડવાનું મોટે ભાગો હોય છે. નિવારણમાં વધારેમાં વધારે કુટ્ટસ ખાવા. લીલા શાકભાજુ વધારે લેવા. કાકડી, ગાજર, કોબીજનું સલાડ વધારે ખાવું. મોતીયુક્ત કામદૂધારશની ગોળી સવાર સાંજ બે-બે એક ગલાસ દૂધ સાથે લેવી. કામદૂધારમાં મોતીની ભરમ ઉપરાંત સુવર્ણગૈરિક હોય છે. ચહેરાની કાળાશ વધારતી શરીરની ઉખાને નિયંત્રિત કરે છે. પ્રવાલયુક્ત ગુલકંદ રોજ એકથી બે ચમચી લેવી. જેમાં મોટે ભાગો ગુલાબની પાંદડીઓ હોય છે જે પિત અને વાયુ દોષને નિયંત્રિત કરી ખીલ અને ખીલ પણીના કાળા ડાઘ મટાડે છે. સહજશુદ્ધ ચૂર્ણમાં મજુઠ, છુરું, સાકર, વાવડીંગ અને સ્વર્ણપત્રી છે જે મચી માર્ગ પિત અને રક્તના દોષનું નિર્હરણ કરે છે અને ચેહરા પરની કાળાશ દુર કરીને ચહેરાને તેજસ્વી અને ગૌર બનાવે છે.

#### ૨૪૪. વીર્ય વધે :

દેશી ઉપચારોમાં વિદાહીકંદના તાળ કણાના કટકા બનાવી છાંયડે સૂકૃવવા. તાળ કણાનો રસ કાઢી પેલા સૂક્કા કટકા કરેલા વિહારી કંદના કટકાને બોળી રાખવા અને સૂકૃવી તેનું ચૂર્ણ

ખીલ થયા છે ? વિલાયતી દવા કદી ન કરશો.

બનાવી તેને ૧૦ ગ્રામ લઈ દૂધમાં ઉકાળી ખાવામાં લેવાથી વીર્યની વૃદ્ધિ થાય છે. આસનનું ચૂર્ણ અઢી ગ્રામથી પાંચ ગ્રામ જેટલું લઈ મધ્ય અને ધીમાં મેળવી રોજ સવાર-સાંજ લેવું.

૨૪૫. વા : ધનદોરિયો વા :

વાના અનેક પ્રકાર છે જેમાં કમરથી પગ સુધી રપડદ્યું અંગ રહી જાય તેવો પણ વા હોય છે. તેમાં ગ્રિંગા, પીપર, ગુગાળ સરખે ભાગે લૈઈ તેમાંથી અઢી ગ્રામ જેટલું ચૂર્ણ લઈ દિવસમાં બે વાર ખરીવું. આવા વાના દર્દમાં વારંવાર એરેન્ડિયું આપી ઝડો ખુલાશો રાખધો. બીજે ધનદોરિયો વા તેમાં દર્દી સુતેલો ઉઠે ત્યારે ધૂણે છે. ત્રીજે ગ્રધસી વાયુ જેમાં પીઠ, કમર, ગોઠણી વગેરે જગા પર ફરતો વાયુ. તેમાં પાંચ ગ્રામ દિવેલો ગૌમૂરત્ર સાથે મેળવી રોજ એક વાર એમ મહિનો પીવું.

૨૪૬. રક્તશુદ્ધિ :

રક્ત અશુદ્ધિના કારણે અનેક રોગો થાય છે. આ માટે પ્રિફણ એટલે કે હરડે, બેરડાં અને આંખળાનું ચૂર્ણ અને કરિયાતાનો ઉકાળો પીવો. વાવડિંગા, પ્રિફણ અને ગુગાળ સરખે ભાગે મેળવી નાની ચણીબોર જેવડી ગોળી બનાવી બે ગોળી દિવસમાં બે વાર લેવી. આ ઉપરાંત ચોપચીની ૧૬૦ ગ્રામ ખુરસાની અજમો, સુંદ, વાવડિંગા, એચલી દરેક ૧૦ ગ્રામ લઈ એનું ચૂર્ણ બનાવી અઢી ગ્રામ જેટલું ચૂર્ણ રોજ પાણી સાથે સવાર-સાંજ પીવું.

ઓટા વિચારો – બીમારીને આંખત્રણ છે.

## ૨૪૭. અજમાવી જૂઓ :

- કોથમીરને એક ગલાસ પાણીમાં દાંડી સાઈડથી ઉભી રાખી દો, કરમાયેલી કોથમીર એક કલાકમાં તાજુ થઈ જશે.
- લોટ બાંધયા પછી એક કલાક બાદ રોટલી, પરોઠા કરવાથી રોટલી-પરોઠા કુણા થશે. રોટલી-પરોઠા કરતાં પહેલા લોટને ફરી મસળવો.
- એક ગલાસો પાણીમાં લીંબુનો રસ તુનાખી સવારે કોગળા કરવાથી મુખની દૂર્ઘા દુરથાયી છે.
- બટાકા બાફ્તી વખતે તેમાં થોડો સરકો નાખવાથી બટાકાનો રંગ સફેદ રહે છે.
- દૂધના વાસણને ઘઉંના લોટથી લુણી રોટલી કરવાથી રોટલી મુલાયમ થાય છે.
- સમારેલું લીંબુ પર મીઠું ભભરાવી રાખવાથી જલ્દી બગાડતું નથી.
- આભલીને તડકામાં સૂક્વી પાવડર બનાવીને રાખવાથી આભચુરના સ્થાને તેનો ઉપયોગ કરી શકાય.
- કોબીજને સમારી તેમાં અડધો ચમચો લીંબુનો રસ ભેળવીને વધારવાથી કોબીનું સ્વાદિષ્ટ તથા ખીલેલું થાય છે.

- સ્કૂલ મરચાંને મિક્સરમાં પીસતી વખતે તેમાં સરસિયાના તેલના થોડાંક ટીપાં નાખવા એનાથી મરચાનો રંગ વધારે લાલ ચટક બનશે.
  - મેલામાઈન કોકરી પરના ડાદા દુર્દ કરવા સરકામાં મીંડ ભેણવેલ મિશ્રણ ઘસવું.
  - કારેલામાંની કડવાશ દુર્દ કરવા સમારેલા કારેલા રાતના દહીમાં રાખવા.
- મિશ્રણ માટે પ્રયોગિક વિધાન : દુર્દ કરવાની પ્રયોગીકતા

#### ૨૪૮. લીમડો લાજવાળ :

લીમડાનો દરેક ભાગ ઉપયોગી છે. (૧) રક્તશોધક અને વ્યાચોગાનાશક છે. (૨) લીમડાના ફૂલનો અર્ક રક્તની ઉણપ, ફૂભિ, ફોડલી, ખીલ તથા કૃષ્ણ રોગી માટે લાભદાયી છે.

#### ૨૪૯. ઘરગાઢ્યુ ઉપાય :

ખંજવાળ, દાદર મટાડવામાટે લીમડાના પાનથી ઉકાળેલા પાણીથી સ્નાન કરવું.

#### ૨૫૦. ‘કાનમાં ઘા જખમ’ :

કાનના ઘા જખમાં લીમડાના તેલમાં મધ્ય લેળવી તેમાં ઇન્નું પૂમંડું ભીજવી કાનમાં રાખવાથી કાનની સફાઈની સાથે જખમમાં પણ ફાયદો થશે.

અમેરિકનો મધનો ઉપયોગ રોજ કરે છે.

૨૫૧. પથરી :

કિડનીની પથરીમાં બે ગ્રામ લીમડાના પાનની રાખનું સેવન કરવાથી પથરી ગાળીને નીકળી જાય છે.

૨૫૨. શૈતપ્રદર : ગ્રામ લીમડાના પાનની રાખનું

નીકળું લીમડાના પાનને પાણીમાં ઉકળી તેમાં થોડી ફટકડીનો ભૂકો નાખવો. આ પાણીથી યોનિ સાફ કરવી.

૨૫૩. ખીલ : બેચયમતા લીમડાનું તેલ થોડા દિવસ પીવું.

૨૫૪. મેલેરિયા : ગ્રામ લીમડાના પાનની રાખનું

૨૦ ગ્રામ લીમડાના પાન, અડધી ચમચી સુંઠ, એક ચમચી વાટેલી કોથમીર, અને ૨૦ તુલસીના પાનને એક ગલાસ પાણી ભેળવી કાઠો બનાવી ઉકળવું. પાખાગ જેટલું પાણી રહે એટલે ગાળીને પીવું.

૨૫૫. પેટાની તકલીફ : ગ્રામ લીમડાના પાનની રાખનું નીકળું લીમડાનું દાંતણ એપેટા માટે ફાયદાકારક છે. લીમડાની છાલમાં અવાજુણો છે જે દાંતદિંતથા એપેટામાં બેકટેરિયાનો ઉપદ્રવ થવા નથી દેતો.

૨૫૬. જૂ :

લીમડાની લીંબોડીનો કૂટી-વાટી માથામાં લગાડવાથી જુનો નાશ થાય છે. લીમડાનું તેલ પણ માથામાં નાખી શકો છે.

## ૨૫૭. મરછર :

સુકૃત લીમડાના પાન-ડાળિને સૂકવી રાત્રે ધુમાડો ઘરમાં દેવાથી મરછર દેખાશે નહીં.

“હવે તો પ્રિયાના હાથમાં રમાલ નથી કે પોતે એ લઈને આપી શકાય. કોલેજમાં આવે છે ત્યારે નોટબુક પણ નથી હોતી કે માંગી શકાય. સાયકલો તો ચલણમાં જ નથી કે હળવેથી અથડાવી શકાય. સેલફોનવાળા હાથ ફૂલ-પકડવા ખાલીય નથી તો કઈ રીતે ‘I love you’ કહી શકાય ?”

**૨૫૮. પોપકોન :** પોપકોનની વિધિ અને પોપકોનની પીળા ઉત્કૃષ્ટ ખાવા એ આરોગ્યની દિલ્લિએ જોખમ છે. પોપકોનને પીળા કરવા માટે હળદર નહીં પરંતુ બજારમાં મળતો સર્તો આરોગ્યને હાનીકારક રંગ નાખવામાં આવે છે. રંગને ઓળખો : હળદર નાખી પોપકોન પીળો કરવામાં આવ્યો હશે તો હાથી ધોતા જ હાથ ઉપરથી રંગ નિકળી જઈ હાથ સ્વરષ્ટ થઈ જશે. પરંતુ રંગથી પીળા કરવામાં આવ્યું હશે તો હાથમાંથી રંગ જલ્દી નીકળશે નહીં.

**૨૫૯. માસિક :** આજકાલ સીને માસિક ૩૦-૪૦ વર્ષે સમાપ્ત થઈ જાય છે. ખાવા પીવામાં દ્યાન રાખો.

**(૨૬૦. બટેટા અથવા દૂદી) :** બેમાંથી એકની છાલ ચહેરા ઉપર પાંચ મિનિટ ધસવાથી ચહેરો ચમકીલો બને છે.

સંક્ષયના પાયામાં વિશ્વાસ જરૂરી છે.

## ૨૬૧. બરોળ :

(૧) ફટકડી એકભાગ, જવખાર બે ભાગ, સુરોખાર ર ભાગ, સિંધવ એક ભાગ પ્રમાણે લઈ એ બધાને મેળવીને એનો ભૂકો બનાવવો. આમાંથી એકથી ગ્રાણ વાલ જેટલો ભૂકો પાણી સાથે પીવો. આ પ્રયોગ ખૂબ જ જાણીતો છે.

(૨) ખાર મોટા પ્રમાણમાં ખાવાથી વીર્ય નબળું પડે છે. (૩) પેટમાં ગોળો આફરો મટાડવા માટે સંચારો, સંચળ, જવખાર, ટંકણખાર ફૂલાવેલો સરખે ભાગ લેવો. તેને કુંવરના રસમાં મેળવી નાની બોર્ડ જેવડી ગોળી બનાવી એક અથવા બે ગોળી રોજ પાણી સાથે ગંભીરી.

## ૨૬૨. અજમાવી જુઆી :

- મુખના છાલાના છૂટકારા માટે ભોજન બાદ એક નાની હરડે ચૂસવી.
- શેતુરનો રસ અડધો ગલાસ એક-એક ઘૃટડો દિવસમાં બે વાર પીવાથી છાલા મટે છે.
- ચપટી કપૂર તથા એક નાનો ચમચો દળેલી ખડી સાકર ભેળવી છાલા પર લગાડવાથી છાલા મટે છે.
- સંતરાની છાલના પાવડરમાં બે ચમચા મધ્ય નાખી ફીણી પેસ્ટ બનાવી ચહેરા પર લગાડવાથી ત્વચા નિખરે છે તથા કાંતીવાન બને છે.

- દાંડિના લોટમાં થોડો રવો ભેળવવાથી પૂર્ણી છિસ્પી બને છે.
- ઈ ઉધરસમાં નાની એલચી ખાવાથી ફાયદોરથાય છે.
- આદુ-તુલસી અને કાળા મરીવાળી ચા પીવાથી શરીરીમાં તીવ્ય વિષ નિરાકાર કરીની જરૂર નિરૂપિત કરીની ફાયદો થાય છે.
- મચ્છરને ઘરમાંથી ભગાડવા સૂક્ષ્મ લીમડાના પાનને બાળીને મચ્છરને ઘરમાંથી ભગાડવા સૂક્ષ્મ લીમડાના પાનને બાળીને એક-બે મિનિટ માટે ઘરમાં ધૂમાડો કરવો અથવા લીલી મોટી ડુંગાળી સાચારી - ઘરમાં રાત્રિના ચાર ખૂણામાં નાખવી રીતું અથવા ડુંગાળીના બે ફાડા કરી ટીગાડી દેવાથી ઘરમાં એક પણ મચ્છર રહેશે નહીં.

મિનાર (૩૫૬)

- લીબુનો રસ ગરમ પાણી સાથે રાતના લેવાથી કબજિયાતમાં ફાયદોરથાય છે.
- ઈડલી માટે ચોખા પલાળતી વખતે તેમાં એક મુણ્ઠી પૌઆ નાખવાથી ઈડલી પોચી બનશે.
- પેટમાં ગોસ ભરાયો હોય તો વરિયાળી, મેથી, લવિંગને ધીરે ધીરે ચાવવા.
- વધુ પડતા ગોસની તકલીફથી બચવા એક કપ ઉકળતા પાણીમાં અજમો નાખી રંગ બદલાય જાય ત્યાં સુધી ઉકાળી તેમાં થોડું નમક નાખી પીવું.

આજનું કામ કાલ માટેબીકી નહીં રાખો! (૩૫૭-૩૫૮)

## ૨૬૩. ગર્ભરથાનનાં દર્દો : મિત્રાંગું રહેતી હોય કારણો

પીપળાનાં જીણા પાનને કટકા કરી પાણીમાં બાફવું. સાકર અને પાણીની ચાસણી બનાવી તે ચાસણીમાં બાફેલા પાન નાખી મુરળ્બો બનાવી એ મુરળ્બો ખાવ. આમાં બંગાભસ્મ, ગજવેલ ભસ્મ તથા સોનાના વરખ નાંખતા વિશેષ ગુણ આપે છે.

## ૨૬૪. કોલ્ડફ્રીક્સ :

કોલ્ડફ્રીક્સથી હૃદય રોગ, બીપી વગેરે કંઈક રોગ ઉપરાંત અમુક ઉંમર પછી સ્વયંભતા વગેરે થાય છે. ટુટી ગયેલ દાંત કોલ્ડફ્રીક્સની બોટલમાં થોડા દિવસ રાખી મુકો તમોને તેનો ભુકો પણ દેખાશે નહીં. ગળી જ્શે.

## ૨૬૫. આઈરકીમ - ચોકલેટ :

આઈરકીમ - ચોકલેટથી ખૂબ જ કેલેરી વધી જાય છે. સ્વાદીષ્ટ છે એટલે મજા તો આવે પરંતુ અમુક વર્ષોમાં શરીર ખૂબ જ વધી જાય છે. પછી શરીર ઉત્તરતું નથી. જે કોઈ વસ્તુ સારી લાગે તે નુકસાન વધુ કરે છે તે દ્યાન રાખો.

## ૨૬૬. મરડો આમવાયુ :

મરડો તથા ગળાનો સોજો થયો હોય તો જીણા કરમદાં જેવાં કેરીના નાના મરવાનો ભૂકો અઠી ગ્રામ, સાકર, અઠી ગ્રામ બેળવી પાંચ દિવસ લેવાથી મરડો મટે છે. જ્યારે ગાળું બેસી ગાયું

હોય તો આંબાના ભરોરને ચુસવાથી પણ ગળાનો સોજો ઉતરી જાય છે. એ પ્રમાણે આમવાચુમાં પણ કમર, પીઠ અને બરડો દુઃખ ત્યારે ૧૦૦ ગ્રામ ખજુરને ભીજવી તે ચોળી પાણી ગાળી નાખી સાત દિવસ પીવું.

#### ૨૬૭. પેશાબે પથરી :

પેશાબે પથરી હોય તો તેને પીગળાવવા આંબા હળદરનું ચૂર્ણ ચાર વાલ લેવું. તેને આંબલીના પાનના રસ ૧૦૦ ગ્રામમાં મેળવી ત્રણ સપ્તાહ પીવું. પ્રથમ દિવસનો પેશાબ તપાકી જોવો એમાં નીચે થર થયેલા હોય દેખાય તો સમજવું કે પથરી પીગળે છે. આ પ્રયોગ કરતી વખતે મીઠું અથવા કોઈ પણ ક્ષાર પદાર્થ ખાવો નહીં. પેશાબે પથરી હોય તો તે માટે સુરોખારે, બરાસ બે વાલ મેળવી બે સપ્તાહ લેવું.

#### ૨૬૮. મરડો :

મરડો થયો હોય તો જાયફળ અને ખારેક સરખે ભાગે લઈ પાનના રસમાં દુંગી ચણા જેવડી ગોળીઓ બનાવી તેમાંથી એક-એક ગોળી દિવસમાં ત્રણ વાર છાશ સાથે એક સપ્તાહ લેવી. ચોખાને ત્રણ વાર ધોવા અને ચુકવીને દૂધ સાકર સાથે પકવી ખાવાથી મરડાવાળા દર્દીને આપવી. સંગ્રહણી મરડા માટે કોથમીર, જીર્ણ, અટી ગ્રામ દહીની મેળવી દિવસમાં ત્રણ વાર ખાવું. બોલસરીના બીજ પાણીમાં ઘસી પીવાથી મરડો નરમ પડે છે.

રોષ અને રીસ, ક્ષમાના ભાર્ગમાં બે અવરોધક તત્ત્વો છે.

## ૨૬૬. અજુર્ણા :

શરીરમાં ખોરાકનું બરાબર પાચન થાય ત્યારે સૂંઠ, ભરી અને પીપર સરખે ભાગે લઈ તેમાં સિંધાલૂણ નાખી લીંબુના રસમાં પ્રણા દિવસ ભીજવી રાખી સૂક્કવી તેનું ચ્યાર્ણ બનાવી તેમાંથી બે વાલ વજન જેટલું ખાવું. ઠંડા પાણીમાં માફક આવે એટલું લીંબુ નીચોવીને પીવું.

૨૭૦. નવરાત્રિનો ઉત્સવ એ દિવસનો છે. - માતાના ગર્ભમાં બાળક નવ ભાસ રહે છે. ક્રી યંગમાં નવ ચક છે. દુર્ગાની નવ ભૂર્તિઓ છે. નવ સ્વરૂપ છે.

## ૨૭૧. વધુરાવળા :

પાણી અથવા લોહી ભરાવાથી ગોળી સુણ જાય ત્યારે તે કઠણ હોય છે. માગવાચું ન હોય તો શૂણ થાય છે. આના ઉપચારમાં પ્રથમ તો કબજુયાત હોય તો મટાડવી. ઉપચાર : (૧) તમાકુનાં પાન ગરમ કરી તેના ઉપર શિલારસ ચોપડી વૃષ્ણા પર બાંધી રાખો. શોથશગ્રુવઠી ઘસી તેના ઉપર લેપ લગાવો.

- દીકરી, તું મારો શ્યાસ છે, જે બહાર જવા માટે જ અંદર આવ્યો હતો. દીકરીને ગાય....
- મનમાં જે સમાય જાય તે સ્વાભિમાન અને બહાર છલકાય તે અભિમાન.
- આપણું શરીર અંદાજે ૬૦ હજાર અબજ કોષોનું બનેલું છે

 બાળકોને ચોકલેટથી દૂર રાખો.

પરંતુ આપણો આરંભ એક કોષ રૂપે થયેલ હોય છે. તે સ્ટેમસેલ કરે છે. તેની મદદથી કોઈ અવયવ ઉગાડી અથવા સમારકામ કરી શકાય છે. સો દર્દીની એક દવા સ્ટેમસેલ. આપણાં અનેક રોગોનો ઉપાય આપણાં શરીરમાં જ પડેલો છે.

### ૨૭૨. બાળકો :

ભણતરનો સમય ઠોકી બેસાડવામાં આવે તો તેમનું દ્યાન ભણવામાં રહેતું નથી.

### ૨૭૩. જડાપણું :

વિશ્વમાં વરસીના આશરે આઠથી દસ ટકા વ્યક્તિઓ મેદચિત્વતાકે જડાપણાથી ગ્રસ્ત છે.

### ૨૭૪. વજન વધવાના કારણો :

(૧) બેઠાડું જીવન (૨) માતાપિતાનો વારસો (૩) વ્યાયામનો અભાવ (૪) સાધન-સગાવડનો વધુ ઉપયોગ (૫) રોજબરોજની શારીરિક ઊર્જાનો વપરાશમાં ઘટાડો. (૬) જંક ફુડ કે ફાસ્ટ ફુડ (૭) પ્રેમમાં નિષ્ઠળતાં (૮) લગન જીવનનો અસંતોષ (૯) વ્યવસાયક તનાવ તથા ભાગાડો ભર્યો જીવનની વ્યગ્રતા અને હિતાશા, આ બધા કારણોથી ભૂખનું પ્રમાણ વધે છે. (૧૦) ડિપ્રેશન - ડિપ્રેશનવાળી વ્યક્તિઓ આભહિત્યા કરવા વધુ પ્રેરાય છે.



બાળકોને મોબાઈલથી દૂર રાખો.

૧૧૪

## ૨૭૫. બગાતમાં ફોડલો :

આ એક જાતનો ફોડલો થાય તેને સતત ધેદનામય હોય છે. એને પકવવા માટે અને ફોડલો ફોડવા માટે ચણોઠીને પાણીમાં વાટીને ગરમ કરી લેપ કરવાથી જલ્દીથી પાકીને ફૂટી જાય છે. આ ઉપરાંત સુવાની પોટીસ પણ ધી સાથે લગાડતાં રાહત થાય છે. આકડાનું દૂધ અને રેવંચીનો શીરો અને ઝડપાણીનો લેપ કરો.

## ૨૭૬. વૃષણમાં પાણી બરાયું :

હાઈડ્રોસિલ કહો કે વૃષણ ઉપર સોજો કહો, એ ગોળીમાં પાણી બરાવાથી થાય છે. હવે તેના સાદા ઉપાય તરીકે ખાવાના કચિકાનો ભૂકો દિવેલના પાન ઉપર લગાડી ગોળીએ બાંધી દેવું. કાચુકીના પાન છૂંદી તેમાં દિવેલ નાખી ગરમ કરી ગોળી ઉપર લેપ કરવો. આ ઉપરાંત આખવાના બીજને પાણી સાથે ઘસી લેપ બનાવી ગોળી ઉપર લગાડવાથી પાણી ઝરીને નીકળી જાય છે. રાત્રે સુતી વખતે લગાડવું એટલે બીજાનું ખરાબ ન થાય. ગોળી એટલે સી પૂરુષના લીંગ નીચે હોય છે તે.

## ૨૭૭. ગૂમડા ફૂટે :

કોઈપણ કારણસર શરીર ઉપરના કોઈ પણ ભાગમાં ગૂમડું થયું હોય તો તેને પક્કવ્યા વિના ફૂટે નહીં. એના સાદા ઇલાજોમાં ગૂમડા ઉપર સાજુખાર, જવખાર મૂકી શકાય. દાડીની ડાળીનો

રસ ચોપડવાથી પણ ગાંઠ ફૂટે છે. સિંદુર પા ભાગ, મીણ એક ભાગ, તેને ઉકાળી મલમ બનાવી તેની પહૂંચ ગૂમડા ઉપર મારવી. વડના દૂધમાં રૂ ભીજવી લગાડવું. કાચુ ગૂમડું હોય તો બેસી જાય અને પાકું ગૂમડું હોય તો ફૂટી જાય.

#### ૨૭૮. બાળકને ખૂંધ નીકળો :

સામાન્ય રીતે નાનપણમાં ખૂંધ નીકળો એટલે કે ખૂંધનો એક તરફનો ભાગ ઉપસેલો રહે આને બેસાડવા માટે આયુર્વેદમાં અનેક પ્રયોગો છે - બાળકને હીંચકા પર બેસાડી ઢોરી પકડાવી હિંચકા ખવરાવવા. આસુંદરાના મૂળ અટી ગ્રામ લઈ તેને પાણીમાં ઉકાળી બે વાલ ભાર જેટલું ગુગળ તેમાં મેળવી રોજ પાવું. ગ્રિફળાનો ઉકાળો પણ ગુગળ મેળવીને પાઈ શકાય. આશોદરાના મૂળની છાલને અટી ગ્રામ લઈ તેમાં એકથી બે જેટલું ગુગળ નાખીને પાતાં લોહીમાં સુધારો થાય છે.

#### ૨૭૯. પેશાબ છૂટે :

ક્યારેક પેશાબ બંધ થઈ જાય છે અથવા એમાં રૂકાવટ આવે છે, આવે વખતે કેસુડાંના ફૂલને બાફીને પેટું પર મુકી તેના ઉપર ગરમ પાણીથી ભરેલી બાટલી મુકી રાખવાથી પેશાબની છૂટ થશે. આ ઉપરાંત પં ગ્રામ જેટલો સોડા બાયકાર્બ પીવાથી પણ પેશાબનો છૂટકારો થશે. આ ઉપરાંત સભુદ્રફળને લીંબુના રસમાં ઘસીને ઝુટી અને પેટું ઉપર લગાડવાથી પણ બંધ થયેલ પેશાબ છૂટે છે.

સ્વાચ્છ આંસુ તો આંખોમાં તડપે, પડે નહીં.

## ૨૮૦. લીમડો : કીડનીની પથરી :

બે ગ્રામ લીમડાના પાનની રાખનું સેવન કરવાથી કીડનીની પથરી ગાળીને નાકળી જાય છે.

## ૨૮૧. શૈત પ્રદર્શન :

લીમડાના પાનને પાણીમાં ઉકાળી તેમાં થોડી ફટકડી નાખી ભેળવી લઈ આ પાણીથી યોની સાફ કરવી. શૈત પ્રદર્શની તકલીફ ગામે તેટલી જુની હશે તો પણ આરામ અવશ્ય મળશે.

## ૨૮૨. મેલરિયા :

૨૦ લીમડાના પાન અડધી ચમચી સંંઠ, એક ચમચો ધાણાનો પાવડર અને ૨૦ તુલસીના પાનને એક ગલાસમાં ભેળવી કાઢો બનાવવો. પાણી પા ભાગ જેટલું રહી જાય પછી આંખ પરથી નીચે ઉતારી ગાળીને પીવું.

## ૨૮૩. પેટાની સમસ્યા :

લીમડાના દાતણ ફાયદાકારક સાબિત થાય છે. લીમડાની છાલમાં એવા ગુણ છે જે દાંત તથા પેટામાં બેકટેરિયા થવા નથી દેતા. જેથી દાંત તથા પેટા મજબૂત રહે છે.

## ૨૮૪. જૂ :

લીમડાની લિંબોડીઓને કુટી-વાટી વાળમાં લગાડવાથી 'જૂ'નો નાશ થાય છે.

પેશાબ પીવો અને તંદુરસ્તી મેળવો.

## ૨૮૫. ભસા :

ભસા થવાનું કારણ કબજિયાત છે. નિયમિત ટોયલેટ ન જવાને કારણે આ ભસા થાય છે. આ ગરમીથી પણ થાય છે. લોહી પડે છે. પર અથવા આમ પણ પડે છે. વા વિકરતા હોય તો સૂકા હોય પણ દરદ કરે છે. આમાં ચોખખો ગુગળ લઈ પાણીમાં પીગળાવી અને ગાળી લેવું. તેમાં મધ અને સાકર રૂરેક અટીઓ ગ્રામ નાખી ચાસણી બનાવવી. તેમાં મોટી હુરકે ૪૦ ગ્રામ નાખી રસ પાક બનાવી તેમાંથી રોજ પાંચ ગ્રામ જેટલો રોજ બે વખત ખાવું. ભસા મટી જશે.

## સુવાક્યો

- ‘પ્રેમ કરવાવાળી વ્યક્તિ કયારેય ઉજ્જ્વલ અત્યારારી અને સ્વાર્થી નથી હોતી.’
- ‘જેનું દર્શન કરવાથી અંદર આનંદ પ્રગટે અને આપણા મનમાં શાંતિ થઈ જાય તે મંગળમૂર્તિ છે.’
- જોખમ ત્યારે ઊભું થાય છે, જયારે તમને ખબર નથી હોતી કે તમે શું કરી રહ્યા છો.
- મનુષ્ય : મનુષ્યનું જીવન નઢીના વહેણ જેવું છે કે જે વહેણ દ્વારા પોતાનો માર્ગ શોધી લે છે.
- ‘અહમ્ કોઇની અને કોઇ પતનની નિશાની છે.’

પેશાબમાં જે વાકાત છે તે વર્કની કોઇ દવામાં નથી.

- દેશી દવાઓ દરેક ગામેગામ - પરાઓમાં મળે છે.
- આપણું ભાવિ લખવા કોઈ વિધાતા નથી આવતા પણ આપણા ભાવિ ઉપર આપણા જ હસ્તાક્ષર હોય છે.
- ‘શરીર જળથી, આત્મા ધર્મથી અને બુદ્ધિ જ્ઞાનથી પવિત્ર થાય છે.’
- દરેક વાત પર હસ્તા માણસનો ક્યારેય વિચાર ન કરવો.
- ફૂલની સુગંધ પવનની દિશામાં જ ફેલાય છે, પણ માણસના સારપ ચારેય દિશામાં ફેલાતી હોય છે.
- શ્રજા : જ્યાં હોય શ્રજા મંગળમથી ત્યાં દૃઃખ અસ્થાને.
- ‘પ્રતિષ્ઠા બનાવવામાં વર્ષો લાગે છે. પણ તેને ગુમાવવામાં ગાણતરીની ભિનિટો જ લાગે છે.’
- હું ભલે મારા નિર્ણયમાં ખોટો પડું પણ મારા ઉદ્દેશમાં ક્યારેય ખોટો ના પડું.
- કાયા હજુ સાજુ છે. હાથમાં હજુ બાજુ છે ત્યાં સુધી ધર્મ કરવાની તક તાજુ છે... ! ! !

ખોટા વિચારો અનેક રોગો ઉભા કરશો.

## ૨૮૬. અળશી :

રામબાળ બધા દર્દોની એક દવા એટલે જ અળશી. આપણી ખાણી પીણીથી જતભાતના રોગો થાય છે. દરરોજના આહારમાં સૌથી પહેલા તો અળશીનો ઉપયોગ કરવાની જરૂરિયાત છે. આયુર્વેદમાં અળશીને ઈનિક બોજન માનવામાં આવે છે. અળશીથી ભરપૂર શક્તિ અને ઉત્સાહનો સંકેત થાય છે. હાઈ જલડપ્રેશાર અને ડાયાબિટિસ નહીંવત (ઓઇઝું) થાય છે.

થોડા રૂપિયા કમાવવા માટે મોબાઈલ ટાવર મુકવું એટલે સોસાયટીમાં રહેતી વ્યક્તિઓ તો શું પં મીટર સુધીના મકાનોમાં રહેતી વ્યક્તિઓને રેડિયેશનના કારણે તમામ સભ્યોની તબિયત નરમ-ગરમ રહેવા માંડે છે. મગાજનું કેન્સર, શારીર જાડુ થઈ જવું, અનિદ્રા આવવી, પાચનતંત્ર ખરાબ થઈ જવું, આંખના નંબર વધી જવા, ચાદશક્તિ ઘટવી વગેરે રોગોથી ઉપરાંત છોકરાઓ પેદા કરી શકતા નથી. આજકાલ નાના છોકરા-છોકરીઓ મોબાઈલનો બેફામ ઉપયોગ કર્તા થઈ ગયા છે. ૪ થી ૫ મિનિટથી વધુમાં વધુ ૭ થી ૮ મિનિટથી રોજનો વધુ વપરાશવાળાને ઉપરોક્ત રોગો જંલ્લી લાગુ પડે છે. ઉપરાંત હાથમાં ખાલી ચડવી, કાનના રોગો થવા, એટેક આવવો, પેરાલિસીસ થવું. કરી જુઓ નીચેનો પ્રયોગ – મોબાઈલ શું છે ? ૪ મોબાઈલ ફોનને એકબીજાની પાસે પાસે ફરતે ગોઠવવાં અને આ ચારેય મોબાઈલની વચ્ચે કાચી પોપકોર્ન મૂકી અને આ ચારેય મોબાઈલને રણકી ઉઠાડી આ રેડિયેશનથી પોપકોર્નનો દાઢો ભગવાન માણસની કસોટી કરે છે, તરફોડતો નથી.

પાકી જશે. ચેરિયેશનની ગરમી આટલી બધી હોય તો મોબાઈલ ટાવરની તો શું વાત કરવી ?

#### ૨૮૭. ધોળાવાળ કાળ કરવા માટે :

સુરક્ષિત - આવશ્યક હોય તેટલો ગ્રેનીલનો પાઉડર ઉકળતા પાણીમાં ભેળવીને ખૂબ દાટ થાય ત્યારે આ પેસ્ટ દાઢી, મૂષ, માથાના વાળ - સંપૂર્ણ સફેદ થઈ ગયા હોય તો પણ આ ગ્રેનીલ વરદાન રૂપ છે, વાળ વધે છે. સરસ ઉંઘ આવે છે - આરોગ્ય સુધરે છે.

#### ૨૮૮. લસણા :

સગાર્ભાઓ અને પિતાની તકલીફવાળાઓએ લસણાનો ઉપયોગ ન કરવો. લસણાના અથાણાં બનાવી ખાવાથી સ્વાદિષ્ટ લાગો છે. લસણાના અથાણાં વગાર ભોજન અધુરુ લાગો છે. લસણાનું તેલ કાન માટે ગુણકારી છે. લસણાની કળીને તેલમાં કકડાવીને ઠંડા કરેલા તેલના ટીપાં કાનમાં નાખવાથી નસો ખૂલી જાય છે. કાનમાંથી મેલ નિકળી જાય છે. કાનના રોગો મટાડે છે. લસણ કેન્સર સાથે લડી શકે છે.

- લસણમાં વિટામિન સી, ચે, બી અને જી તથા સફ્ટર, લોહ, કેલ્લિયમ ઉપરાંત નકામાં બેકટેરિયાનો નાશ કરતું એલિસન નામનું તત્ત્વ છે.
- લસણ : મોંખાં વાસ રહી જાય તો બ્રશ કરીને કોગાળ કરવા.
- હૃદયરોગ : રોજ લસણ ખાવ.
- ડાયાબિટિસ માટે લસણ શ્રેષ્ઠ ફુદરતી ઓષ્ધય છે.

કેટલાક લોકોની આડે ન ઉત્તરવામાં ડહાપણ છે.

### ૨૮૯. દમ રોગીઃ :

રાગે ધીમાં લસણાની કળી પકાવીને ચાવી જાવ તો બીજા દિવસે કફનો ઉત્સર્જ થતા શ્વાસ તકલીફ ઓછી થાય છે.

### ૨૯૦. રથૂળતાઃ :

લસણાની કળીવાળો આહાર લેવાથી ચરણીનું પ્રમાણ ઘટતાં કુભરનો ધેરાવો ઓછો થાય છે. નિયમિત ખાવાથી શરીર પતલું બને છે.

### ૨૯૧. લીવરની તકલીફઃ :

રાતે સુતા પહેલાં એક ચયમચી ઓલિવ ઓર્ડિલ અથવા સોયાબિન ઓર્ડિલમાં લસણાની પેસ્ટ લેવાથી લીવર સ્વરચ્છ થવાની સાથે તે મજબૂત બને છે.

- વધારે પડતા જુલાબ લેવાથી શરીરમાંથી પ્રવાહી નીકળી જશે. તેની સાથે શરીરને જરૂરી પોટાશ્યમ અને સોડીયમ નીકળી જશે જેની અસર તંમારા હૃદય ઉપર થશે. જુલાબ લેવાથી વજન ઓછું થશે પણ જેવું ખારો એટલે વધી જશે.
- નવી નવી જાતીની ગોળીઓ દેશી-પરદેશી લઈને તમોને થોડો વખત વજન ઓછું થયું લાગશે પણ રોગપતિકારક શક્તિ ઓછી થવાથી નુકસાન થવાનો ભય વધી જાય છે.
- વજન ઓછું કરવાનો શ્રેષ્ઠ રસ્તો પ્રમાણસર ચાવી-ચાવીને ખોરાકનો કંટ્રોલ અને નિયમિત કસરત આટલો જ છે. એ ભૂલશો નહીં.

માથાબારે માણસો અંધારી આલમના જ હોય તેવું નથી.

## ૨૭૨. લોકિક લસણાના અલોકિક ગુણા :

- (૧) લસણાનો છૂટથી ઉપયોગ કરી અને ઘણાં બધા ન સમજુ શકાય - વિચારો શકાય તેવા ફાયદા મેળવો.
- (૨) લસણાનો ઉપયોગ છેક બીજા વિશ્વયુદ્ધના સમયથી થતો રહ્યો છે.
- (૩) યુદ્ધભૂમિ પર ઘવાયેલા સૈનિકો લસણાની કળીથી પોતાનો ધા સાફ કરતા હતા.
- (૪) લસણાના તેલમાં ફંગાસ અને જેરી જીવાણુને નાશ કરવાનો ગુણ છે.
- (૫) શીયાળામાં સવારે નાસ્તામાં બાજરીના રોટલા સાથે લીલા લસણાની ચટણી સાથે મોળી છાશ કે પછી બપોરે તાજા લીલા લસણાની પેટટને અન્ય ભસાલા સાથે બેળવીને બનાવેલું સ્વાદિષ્ટ ઊંધિયું પૂરી કે સાંજે વધારવાળી બિયડી-કટી, લીલા પોકના ગરમા ગરમ ભજુયાં કે પછી ખમણાનો લસણવાળો લોચો તથા લીલી મેથીના લસણ નાખેલા મુડીયાં, કેન્ઝરની ગાંઠ, ક્રી રેડિકલ્સથી થતી હોવાનો સંશોધકોને મત છે. લસણ આવા કોષનો નાશ કરે છે. આ ઉપરાંત દમ, સંધિવા, સ્વૃદ્ધતા, ડાયાબિટિસ, લીવરજન્ય તકલીફો વગેરેમાં

અંતરમાં નિહાળો તો આનંદ અને બહાર જુઓ તો આકંદ !

ખૂબ જ ઉપયોગી છે. ઉપરાંત હાઈપર ટેન્શન, હાઈબીપી, એનેમિયા, ઇભેટિક ડિસિઝ, કટિવા, ડાયાબિટિસ, હાઇપોલાઈસેમિયા, આરથમાં, ઉધરસ, એલજ્ર્ઝ, આંતરડાના વાર્સ પેરાસાઈટિક ડાયેરિયા અને કેન્સલની સારવારમાં ખૂબ જ ઉપયોગી છે. કબજિયાત દૂર કરે છે.

#### ૨૬૩. સુપ અને સલાડ ડાયેટ :

શરીરને પ્રોટિન જોઈએ. તમે ના લો તો વજન ઓછું થશે પણ શરીરને જુવવા માટે જોઈતી કેલેરી તે વમારા શરીરના સ્નાયુમાંથી લઈ લેશો. પરિણામે ચરબી ઓછી નહીં થાય.

#### ૨૬૪. ભૂલે ચૂકે વજન ઓછું કરવા નીચેના પ્રયોગ કરશો નહીં :

- (૧) વધારે પડતી કસરત.
- (૨) વધારે પડતા જુલાબ લેવાની ટેવ.
- (૩) નવી નવી જાતની ગોળીઓ દેશી-પરદેશી લઈને.
- (૪) ઓપરેશન કરી ચરબી કાટવાનો રસ્તો કદી અપનાવશો નહીં.

વજન ઓછું કરવાનો કાર્યક્રમ ધીરે ધીરે કરવો. એક કલાક ચાલવાથી ૩૫૦ કેલેરી બળે છે. પુરુષને ૨૦૦૦ અને સીઓને ૧૮૦૦ કેલરી જોઈએ. વધુ પડતો વ્યાયામ નુકસાન કરે છે.

આપણા માટે બીજાના વિચારોને ટીકા ન ગણી શકાય.

રોજ એક સફરજન અને એક ગલાસ દૂધ લઈને તમારા શરીરને ઓછામાં ઓછી ૮૦૦ થી ૧૦૦૦ કેલેરી તો જોઈએ. એક સફરજનમાં ૬૦ કેલેરી, એક ગલાસ દૂધમાં ૧૫૦ કેલેરીથી કાંઈ નહીં થાય. વજન ઉતારવા ખોરાક ઓછો કદ્દી ન કરશો. દાળ-ભાત, રોટલી, શાક ખાબ જંક ફૂડ કે તળેલી આઈટમો પણી ભલે ઘરે બનાવી હોય તેનાથી દૂર રહો.

વજન ઓછું કરવાની ઘેલણામાં તમને માનસિક રોગ થશે જેથી કોઈપણ ખોરાકને જોઈને તમને ઉલ્ટી થઈ જશે. સ્વભાવ ચિંતિયો થઈ જશે. આવે વારે ગુસ્સે થશો. નબળાઈ એટલી આવશે કે પથારીમાંથી ઉભા થવાનું મન નહીં થાય. અંતે શરીર દુબળું થઈ જશે અને મોતના મુખમાં ધકેલાય જવાનો રસ્તો કરો છો.

- જાદુ અને ચમલ્કાર એક સરખા નથી પણ બજે વચ્ચે મોટો ભેદ છે. હાથચાલાકી, ચુક્કિથી જાદુ થાય છે જ્યારે ચેતનાની બદલાયેલી સ્થિતિમાં ચમલ્કાર થાય છે.
- ચું તો દુનિયામે સભી આયે હે મરને કે લિયે, મોત ઉસ્કી હે કરે જુસ્કા જમાના અફ્સોસ...
- પીના આયા તુજે, પીલાના ન આયા તુજે,  
તોડના આયા તુજે મીલાના ન આય તુજે,
- કેસા જિંદગીકા તલબગાર હે તુ અલફાત,  
સબ ફુછ આયા તુજે, જુના ના આયા તુજે...

ડિપ્રેશન... ફસ્ટ્રેશન... આત્મહિત્યા... માનવજાતની મૂર્ખામી છે.

## લસણ લાજવાં : લસણ ની વિધાની પ્રક્રિયા

હાઈબલડપ્રેશરના દર્દીઓ માટે લસણનો ઉપયોગ ભરોસાપાત્ર અને હાનીરહિત ઔષધિ તરીકે આધુનિક તબીબીશાસ્ત્રોએ સ્વીકાર્યો છે.

## લસણના ફાયદાઓ :

- (૧) નાડીના ધબકારાને નિયમિત કરે છે.
- (૨) રક્તવાહિનીઓમાં થતી તાણ ઘટાડી હૃદયના ધબકારાને નિયંત્રિત કરે છે.
- (૩) માનસિક અને શારીરિક તાણ-વ્યથા ઘટાડી ચિંતાને પ્રકૃતિલિત રાખે છે.
- (૪) પાયનકિયાને ઉદેજિત કરી પેટ-આંતરડાના છુપા ગોરસને બહાર કાઢી પેટમાં આવતી ચૂંક મટાડે છે.
- (૫) તેમાં રહેલી “જંતુનાશક” પ્રકૃતિને લીધે આંતરડાનો સડો અટકાવે છે.
- (૬) વાળને ખરતા અટકાવે છે.
- (૭) માથા પર લસણના ટુકડા ઘસવાથી થોડા જ દિવસમાં ફરજ જણાય છે.
- (૮) લસણના ટુકડાને ખીલ કે મોં પર ગરમીનું પ્રમાણ વધારે હોય તો ફાયદો થાય છે.
- (૯) ગરમ પાણીમાં લસણના ફોલેલા ટુકડા નાખી ચા બનાવી પીવાથી રાહત જણાય છે! ચાનો સ્વાદ સહ્ય કરવા માટે તેમાં આદુ કે મધ્ય ઉભેરી શકાય.

ભૂલો ભલે બીજું બધું, મા-બાપને ભૂલશો નહીં.

(૧૦) પગામાં પડતા છાલા ઉપર લસણાના તેલની નિયમિત માલીશ કરવાથી ફાયદો થાય છે. સોઝા અને દુઃખાવામાં પણ અસરકાક ઔષધ તરીકે વાપર્ટી શકાય છે.

લસણાનો ઘણી જગ્યાએ જંતુનાશક ઉપયોગ થાય છે. આમ, લસણ જેટલું નાનું દેખાય છે અનેના કરતાં અનેક ગણા વધારે ગુણો પોતાનામાં સમાચેલ છે. ઉપયોગ કરો.

- રિઝર્વ બેંક પબ્લિકને લુંટવાના જે લાયન્સ બેંકોને (ગામે તેટલા ચાર્જ મારવાના) આપ્યા છે, તે તુરત જ પરત લેવા જોઈએ.
- પબ્લિકને નવી બેંકોની નહીં, બેંકોના નવીનીકરણની આવશ્યકતાની જરૂર છે.

### વાળ કાળા કરવા :

ઘણાને આધેડ વયે જ વાળ સફેદ થવા માંડે છે. એમાં તો ભગાજે ગરમી અથવા વાળને પૂર્તું પોષણ ન મળવાથી વાળ સફેદ થઈ જાય છે. વાળને કાળા કરવા ભાંગારાનું તેલ ઉત્તમ પ્રકારનું છે. એમાં ભાંગારાનો રસ ૧૫૦ ગ્રામ, મંડુર ૧૦ ગ્રામ, નાળિયેર એક અને ઉપણાસટી ૧૦ ગ્રામ લઈ તેને ૪૦ ગ્રામ તેલમાં નાખી, લોખંડના વાસણામાં ઉકાળવું. પાણી બળી જાય ત્યારે તે ગાળી લેવું. આ થયું ભાંગારાનું તેલ.

સામયે-સામયે લસણાનો ઉપયોગ કરો.

બાદળ સુભાષ દોશી

૯૮૨૧૩૨૨૪૭૭

પવન સુભાષ દોશી

૯૮૨૧૦૫૮૦૪૩

ફ્લેટો - દુકાનો - રો હાઉસીસ -  
કોમર્સિયલ મોટી જગ્યાઓ - ખારદર  
સી.બી.ડી., બેલાપુર અને કામોટે  
પણેશાન સાથે  
**૧૦૦% ટાઇટલ કલિયર**



## દોશી બિલ્ડર્સ

દ. ૫૧/૫૨ ગ્રેઇન મર્ચિન્ટ્સ કો. ઓ. હા. સો. લિ

સેકટર - ૧૭, વાશી, નવી મુંબઈ - ૪૦૦૬૦૩

ફોન : ૨૭૮૮૮૮૪૭ (ડાયરેક્ટ), ૨૭૮૮૦૫૮૪, ૨૭૫૫૫૫૪૧



ફ્લેટો - બંગાલા - દુકાનો - રો હાઇસીસ ખારઘર, સી.બી.ડી,  
બેલાપુર અથવા કામોટે ખાતે રેડી પરેશનમાં ઓ.સી સાથે  
૧૦૦% ટાઇટલ કલિયર

બાદળ સુભાષ દોશી

પવન સુભાષ દોશી

## દોશી બિંડર્સ

ફોન : ૨૭૮૮૮૮૮૪૭, ૨૭૬૫૮૫૪૧, ૨૭૮૮૦૫૮૮

મો.: ૮૮૨૧૩૨૨૪૭૭, ૮૮૨૧૦૫૮૦૫૩

BOOK - POST

To,  
Mr./Ms.

VIJAY R DOSHI  
4 JAIPRAKASH  
90 FEET ROAD, GARODIYA NAGAR  
GHATKOPAR (E) *Bombay*



Pin code

બુક મણવાનું સ્થળ :

**SUBHASH R. DOSHI**

E-51/52, GRAIN MERCHANTS CHS LTD.,  
SECTOR-17, VASHI - NAVI MUMBAI - 400703